

# પરબ

સ્થાપના વર્ષ : ૧૯૬૦

વર્ષ : ૪

આગસ્ટ : ૨૦૦૯

અંક : ૨

નારાયણ દેસાઈ  
પ્રમુખ

: પચામર્શનસમિતિ :  
લોળાભાઈ પટેલ  
વરિષ્ઠ કાર્યવાહકસમિતિ સભ્ય

ભારતી ર. દવે  
પ્રકાશનમંત્રી

: તંત્રી :

યોગેશ જોધી

: સહતંત્રી :

પ્રફુલ્લ રાવલ



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાષી શાનપીઠ m ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ,  
'થાઇમ્સ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯  
ફોન : ૨૬૫૮૭૮૪૭

## પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- v 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
- v 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
- v 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.
- v વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે, પ્રમાણપત્ર સાથે બીડવું.
- v ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
- v પરિષદના વાર્ષિક બ્યક્ઝિંગત સભ્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
- v પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
- v 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રૂકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

## લેખકોને :

- v 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
- v લેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા A4 સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અભિરૂત્ત લખી મોકલવું, પોસ્ટકાર્ડ, ઠિન્લેન્ડ કે ચબરખીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવા તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.
- v સ્વીકૃત કૃતિની જાણ કરાશે. ટ્પાલ-ટિકિટે ચૌંટાટેલું કવર મોકલ્યું હશે તો જ અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ રદ ગણાવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.
- v પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ' ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઇમ્સ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ S તંત્રી : યોગેશ જોધી S મુદ્દણસ્થાન : શારદા મુદ્દણસ્થાય, ૨૦૧, તિલકરાજ, પંચવતી પહેલી લેન, અંબાવાડી, અમદાવાદ-૬ & ૨૬૫૬૪૨૭૮

E-mail : gspadm@vsnl.net

Web-site : [www.gujaratisahityaparishad.org](http://www.gujaratisahityaparishad.org)  
[www.gujaratisahityaparishad.com](http://www.gujaratisahityaparishad.com)

ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭

ISSN0250-9747 પરબ

છૂટક ક્રિ. રૂ. ૨૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : ભારતી ર. દવે (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઇમ્સ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ S તંત્રી : યોગેશ જોધી S મુદ્દણસ્થાન : શારદા મુદ્દણસ્થાય, ૨૦૧, તિલકરાજ, પંચવતી પહેલી લેન, અંબાવાડી, અમદાવાદ-૬ & ૨૬૫૬૪૨૭૮

આ નું ક મ

પરિષદ-પ્રમુખનો પત્ર

કવિતા

પત્નીવિરહ • ભગવતીકુમાર શર્મા ૪, કૃતૂહલ • ચન્દ્રકાન્ત ટોપીવાળા ૧૨, તાજ • ચન્દ્રકાન્ત ટોપીવાળા ૧૩, વિલાપ • ચન્દ્રકાન્ત ટોપીવાળા ૧૩, અમદાવાદ ઠાર્યો • ચન્દ્રકાન્ત ટોપીવાળા ૧૪, એક મૌલિક અનુસરણ યાને ગજલના ને મારા જન્માક્ષર • લાલિત નિરેદી ૧૫, શગને સંકેરો • જિરીશ ભણ ૧૯

વાર્તા

કાઢું વરહ • કલ્પેશ પટેલ ૨૦, “પ્રશ્ન ?” • ડૉ. નીલેશ રાણા ૨૭

ધ્વનિનોદ

શાનસત્રમાં ગડમથલ • નટવર પંડ્યા ૩૨

ભારતીય સાહિત્ય

વર્ષના અંકુર • એન. ગોપી, અનુ. રમણીક સોમેશ્વર ૩૬, કોંકણી ભાષાના સર્જકને ભારતીય શાનપીઠ : ૨૦૦૬ • નવનીત જાની ૩૭

વિદેશી સાહિત્ય

નવલકથાકાર જેઈમ્સ જોય્સ • સુરેશ શુક્ર ૩૯

પ્રક્રિયા

એક માણસના વૃક્ષ બનવાનીખબર • જગદીપ સ્માર્ત ૪૪

અભ્યાસ

‘બારણે ટકોરા’ અને ‘મંકીઝ પાવ’ – તુલનાદિષ્ટિઓ • વિજય શાસ્ત્રી ૪૯, ‘રાગ-પરાગ’ની કવિતા • ડૉ. ડિમત ભાવોદિયા ૫૭

સમીક્ષા/ગ્રંથાવલોકન

‘જગરું’ : એક અનોખી અમરકથા • રમેશ બી. શાહ ૬૪, ‘એક ક્ષણનો ઉન્માદ’ : સ્થાપિત પરંપરાને અનુરૂપ • કંઈર્પ ૨. દેસાઈ ૭૩, સાચા સૌદર્યનો સુરેખ મહિમા : ‘એક રૂપકથા’ • ડૉ. પ્રવીણભાઈ એસ. વાધેલા ૭૭, સાંપ્રત સમાજનું લઘુકથાઓમાં પ્રતિબિંબ • ગણપત સોંગ ૮૦

પરિષદવૃત્તા

સંકલન : અનિલા. દાવલ ૮૪

સાહિત્યવૃત્તા

સંકલન : પ્રકૃત્લ રાવલ ૮૬

ઠકાચિત્ર

સાક્ષરસૃષ્ટિ : નિર્મિશની નજરે • નિર્મિશ ઠાકર ૮૭

આ અંકના લેખકો

૮૮

જગદીપ સ્માર્ત (જંગલમાં વાધ)

પરિષદ-પ્રમુખનો પત્ર

પરિષદની સાહિત્યયાત્રાનો ગ્રીજો તબક્કો પૂરો થયો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં સંખ્યાબંધ નગરો અને કસબા સુધી પરિષદ પહોંચી અને ઓંગસ્ટ-સપ્ટેમ્બરમાં કચ્છ અને મધ્ય ગુજરાત કરી પહેલી-બીજી ઓંક્ટોબરે સાહિત્ય યાત્રાના સમાપનની યોજના વિચારાઈ છે. હવે આપણા બંધારણમાં પણ એનો ઉલ્લેખ થયો છે. આ પ્રવૃત્તિ સારુ એક મંત્રી વિશેષ ધ્યાન આપશે એવી અપેક્ષા રખાઈ છે, તેથી આવતા સત્રમાં હજુ વધારે વિસ્તારમાં અને ઊંડાણમાં પહોંચવાની આશા છે. આ સત્રમાં ત્રણોય ક્ષેત્રોમાં ત્રણ-ચાર દિવસો યાત્રા સાથે ગાળવાથી મેં જે તાજગી અનુભવી છે એની લહાણી ‘પરબ’ના વાચકો સાથે કરી લાઉં.

‘પરિષદ અમારે આંગણે આવી’ કહી ત્રણોય પંથકે યાત્રાને વધાવી લીધી. અનેક ડેકાશે યાત્રા પહોંચી તે આખો દિવસ જાણે ગુજરાતી સાહિત્યની વરસગાંઠ હોય એવો ઊજવાયો. દરેક ડેકાશે સમગ્ર કાર્યક્રમમનું આયોજન કરવાનું સ્થાનિક આયોજકોને જ માયે હતું, તેથી દરેક જગાની ઊજવાણીમાં પોતપોતાની આગવી વિશેષતા જણાઈ આવતી હતી. ક્યાંક આખા પ્રદેશમાંથી યાત્રામાં જોડાયેલા સાહિત્યકારો પૈકી એક-એક બજ્જેને જુદી જુદી હાઈ સ્કૂલ કે કોણેજોમાં નિમંત્રી હજારો વિદ્યાર્થીઓને એમનો અને તેમને વિદ્યાર્થીઓનો પરિચય કરાવવામાં આવ્યો. જેમનું નામ માત્ર પોતાનાં પાઠ્યપુસ્તકમાં વાંચ્યું હતું એવા લેખક કે કવિને મળીને વિદ્યાર્થીઓ રોમાંચિત થતા. કૂડીબંધ વિદ્યાર્થીઓએ આ સાહિત્યકારો સમક્ષ પોતે તાજેતરમાં વાંચેલ કોઈ પુસ્તકનો પરિચય આય્યો. ટેટલીક રજૂઆતો તો એવી થઈ કે મહેમાન સાહિત્યકારો મૌખાં આંગળી નાખી ગયા. ક્યાંક નવોદિત સાહિત્યકારોએ પોતાની રચનાઓ રજૂ કરી. ક્યાંક એ રચનાની તાજગીને પોરસાઈ. ક્યાંક નવોદિત કવિઓને પ્રતિષ્ઠિત કવિઓ કે વિવેચયો સાચી કવિતા કેવી હોય એની સમજ આપી. ક્યાંક આખા નગરમાં ભબ્ય સાહિત્યકારી નીકળી. ડેકેકાશે કવિસમેલનો થયાં. લગભગ દરેક સ્થળે તે ગામ અને આસપાસના સાહિત્યકારો સાથે રસિક સાહિત્યગોઠીઓ થઈ. ક્યાંક કોઈ સાહિત્યપ્રેમી પુસ્તકવિઠાએ પોતાના વિશાળ અને આધુનિક ઢિલ ગોરક્ષવાયલા પુસ્તકબંદારમાં જ એમને તાં નિયમિત રીતે નવાં નવાં પુસ્તકો શોધતા આવતાં યુવાન-યુવતીઓ જોડે જ પ્રશ્નોત્તરીની બેઠક રાખી. આમ વિવિધ પ્રકારની બેઠકોને લીધી આ મિલનો અચરણ અને આનંદના મેળાવડા બની રહ્યા. ક્યાંક સાહિત્યકારોને એટલા શ્રોતાઓ મળ્યા કે જેટલા એમને બહુ ઓછી વાર મળતા. ક્યાંક શ્રોતાઓને એવા સાહિત્યકારો મળ્યા કે જેમને મેળવવા વારંવાર પત્રવ્યવહાર કરવા છતાં તેઓ સર્જણ નહોતા થયા.

બધો હરબ એકતરસી નહોતો. સાહિત્યકારોને માટે પણ આ અવનવો અનુભવ હતો. કેટલાક વિદ્યાર્થીઓના પુસ્તક-પરિચયથી સાહિત્યકારો આનંદાશ્રય પામ્યા. પોતાની કૃતિ આટવી સમજ સાથે આટવા ભાવપૂર્વક વંચાતી સાંભળવી એ અનુભવ સાહિત્યકારો સારુ ઓછો આબ્દલાદક નહોતો.

આખા કાર્યક્રમમાં બંને બાજુઓ રહેલી ઘણી ઘણી સંભાવનાઓ દેખાઈ આવી. કેંક

વિદ્યાર્થીઓ સારુ સાહિત્યમંડિરનાં દ્વાર ખૂલ્યાં હોય, કો'કને સરસ્વતી-ઉપાસનાની રઢ લગ્ની હોય. કોઈ કવિ બનવાનો ઉમળ્ણો ધરાવતા જીવને કવિતા એટલે માત્ર પદ્ય, પ્રાસ કે છંદ કરતાં કાંઈક ઊંઠી ચીજ છે, એ સમજાયું હોય. વળી કોઈને એમ પણ સમજાયું હોશ કે હોંશેબેર એમણો કોઈ પત્રિકાને પાઠવેલ લખાણ પાછું આવવાનું કારણ પોતાની ધારણા મુજબ, રાગદ્વેષમૂલક કોઈ કારણ નહીં, પણ સાહિત્ય અંગેની વધુ પુખ્ત સમજ પણ હોઈ શકે.

પરિષદ્ધના આમંત્રણને માન આપીને જે સાહિત્યકારો યાત્રામાં જોડાયા તેમનો આનંદ ઢેકઢેકાણેના યજમાનો કરતાં ઓછો નહોતો. ગોઝીઓમાં થયેલી પ્રશ્નોત્તરી બંને પક્ષને કાંઈક નવું નવું શાન આપનાર નીવડી. માતુભાષા અંગેની પોતાની નિસભત આમ જનતા સુધી લઈ જવા પ્રયાસ કરનારને એ અંગેની પ્રજાની વ્યાવહારિક કે કાલ્યનિક મુશ્કેલીઓનો ખ્યાલ આવ્યો તેમ માતુભાષાને ટકાવી રાખવામાં વાલીઓનું શું કર્તવ્ય છે એ લોકોને સમજાયું. સાહિત્યકારોને રોજેરોજ નવી નવી ગોઝીઓમાં એ વસ્તુનો પણ ખ્યાલ આવી ગયો કે પોતાની અથવા અન્ય સાહિત્યકારોની કૃતિઓ જનમાનસ પર કેવો પડઘો પાડે છે. શાન કદી એકમાર્ગ હોતું નથી. શાન પીરસનાર જો સાવ જડ કે વાંનિક ન બની ગયો હોય, તો તે હંમેશાં આપે તેના કરતાં વધુ પામતો હોય છે. એને ડગવે ડગવે નવું નવું શીખવાનું મળે છે. બધા સારા શિક્ષકોનો વર્ગખંડનો એ અનુભવ છે. સાહિત્યયાત્રાએ વર્ગખંડને સમાજવ્યાપી બનાવી દીધો.

આ સત્રમાં જ સાહિત્યયાત્રા હજુ ગુજરાતના બે પંથકો ફરી વળવાની છે. વળી આગળ ઉપર જેમ જેમ વર્ષોવર્ષ નવી નવી યાત્રાઓ ગોઈવાશે તેમ તેમ એનાં નવાં સ્વરૂપો ઊંઘડતાં જશે. તેથી કદાચ લાંબા ગાળે યાત્રાનો સૌથી વધુ લાભ મળશે ગુજરાતી સાહિત્યને. થોડા વાંચનારા વધશે, કાલ્યોના કેટલાક ભાવકો વધશે. સમીક્ષાના સમજનારા વધશે, જુદા જુદા સાહિત્યપ્રકારો અંગે નવાજૂના સાહિત્યકારોની સમજ વધશે. એ બધું તો દેખીતું છે. પરંતુ જો સાહિત્યયાત્રા આજના જેટલા જ ઉત્સાહપૂર્વક ચાલતી રહે, જો પરિષદ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા સાહિત્યકારો યાત્રાને આજના કરતાં પણ વધુ ગંભીરતાથી લે અને ગુજરાતની દિવસે દિવસે વધુ શિક્ષિત બનતી રહે, જો આ યાત્રાને સાહિત્ય અંગે ઊંઠી સમજ કેણવાના અવસર તરીકે લે, તો સાહિત્યયાત્રા સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યની મૂલ્યવાન સેવા કરી શકે એમ છે.

યાત્રા સાહિત્યકારોને પોતાની જાતમાં ઊંઠું ડેક્ઝિયું કરવાનો મોકો આપે છે. માણસ જ્યારે એક મિશન લઈને નીકળે છે ત્યારે એ મિશન જ એને પોતાને વધુ સમજાવામાં, વધુ પ્રક્ષાલિત કરવામાં અને વધુ પ્રોત્સાહિત કરવામાં મદદગાર થઈ પડતું હોય છે. સાહિત્ય સૌથી પહેલાં તો પોતાની જાતને ઓળખવાનો અવસર પૂરો પાડે છે. જ્યારે એ સીધો સમાજમાં જાય છે, ત્યારે એ માત્ર પોતાની વાત જ સમજાવતો ફરતો નથી પણ સમજ પોતે એની આગળ પ્રત્યક્ષ થાય છે. સમાજના પ્રશ્નોને એ સમજે છે. પોતે જો સમાજની ક્ષુદ્રતાઓથી અણગો રહેતાં શીજે અને યાત્રા દરમિયાન રોજેરોજ બદલાતી પરિસ્થિતિને કારણે યાત્રિકે ઓછાવતા પ્રમાણમાં તટસ્થ રહેતું પડતું જ હોય છે તો તેવે યાણે સમાજની, ક્ષુદ્રતાઓથી અણગો રહી સમાજને સમત્વ તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો એ

સાહિત્યયાત્રીનો સ્વર્ધમ બની જાય છે. તે સમાજના પ્રશ્નો જોડે પોતાની નિસભત જોડે છે. આનો પડઘો સમાજમાં પડચા વિના રહે નહીં. આથી એની કૃતિ લોકભોગ્ય, લોકોપ્યોગ્ય, અને લોકોનિતિકારક થઈ શકે.

યાત્રામાં સાહિત્યકાર પોતાના ઘર કે સંસ્થાની દીવાલોથી બહાર નીકળી, ઓછેવરે અંશે નિસર્જ જોડે નાતો જોડે છે. સૃષ્ટિનો આસ્વાદ કરનારની કલ્યાણ અને કૃતિમાં પણ પ્રાણ પુરાય છે. પ્રકૃતિ સાહિત્યકારના વર્જનનો વિષય બને એ પહેલું પગલું, સાહિત્યકારો પોતે વર્જનવા રસ સાથે સહચારી ભાવ પેદા કરવા પ્રકૃતિનો અનાદિકાળથી ઉપયોગ કરતા આવ્યા જ છે. પરંતુ પ્રકૃતિને જીલનાર સાહિત્યકારો પોતે જ તેમાં રમમાણ થઈ જતા હોય છે. પછી તેમને પોતાને અને પ્રકૃતિ વચ્ચે કશા દૈતનો અનુભૂતિનો એક ભાગ બની જાય છે. કુદરત તેમની કવિતા કે વાર્તાનો સહચારી ભાવ મટીને તેમની આગળ જીવતા જાગતા પાત્ર તરીકે જ પ્રગટ થાય છે. કાલ્યિદાસના મેઘદૂત કે કુમારસંભવમાં, રવીન્દ્રનાથના ‘નિર્જરેર સ્વભંગ’ કે ઋતુઊત્સવનાં ગીતોમાં, ટોલસ્ટોયની ઘણી ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓમાં, હેમિંગવેની ‘ઓલેમેન ઓન ધ સી’ જેવી કૃતિઓમાં પ્રકૃતિ માત્ર વર્જન કરવાના વિષય તરીકે નહીં, પણ કૃતિના મહત્વપૂર્ણ અંગ કે પાત્ર તરીકે આપડી સમક્ષ ખડી થાય છે.

આપણા સાહિત્યકારો જો સાહિત્યયાત્રા મારસ્ફત ગુજરાત આખાની ભૂમિને ખૂદી વળી તો ગુજરાતની પ્રકૃતિ પાસે પણ એવું અણણ ધન છે જે આપડી છાતી, મસ્તિષ્ક અને કલમને છલકાવી છે. આખા દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો આપડો ત્યાં પથરાયેલો છે. ગુણવંતરાય આચાર્યથી માંડીને ધ્રુવ ભવ સુધી આપણે ત્યાં એક તેજસ્વી ચીલો પાડ્યો છે. આગળ ઉપર પણ દરિયા તથા દરિયાકાંઠની પ્રકૃતિ આપણા અનેક દરિયાદિલ કવિઓ કે લેખકોને પ્રેરી શકે. આપડી પૂર્વપદ્મી જેટલી આર્થિક દસ્તિએ દરિદ છે તેટલી જ પ્રાકૃતિક સૌન્દર્ય અને નિર્મણ માનવીઓની હદ્યશ્રીથી ભરપૂર છે. સૌરાષ્ટ્રના સૂક્ષ્મ વોંકળા ચોમાસામાં સેંકડો નાનામોટા બંધો છલકાવે છે. પંચમહાલની હુંગરાળ ધરતી પર જરણાં જેમ અષાઢી આસો માસ સુધી છલકાઈ જાય છે, તેમ જો ગુજરાતના સાહિત્યકારો પોતાના કહેવાતાં સુખસગવડવાળાં પરિસરોમાંથી નીકળીને માત્ર થોડા હિવસ પૂરતા સાહિત્ય-યાત્રા નિમિત્તે પ્રકૃતિને ખોળે પહોંચે તો સિમગ્ર સૃષ્ટિનો વિષય અને વાડીમાંથી અવશ્ય નીપજે અને વાંક્સિ અને સૃષ્ટિનું સુસંવાદી સંગીત જંક્ટ થઈ ઉઠે.

હજુ તો સાહિત્ય યાત્રાનું પહેલું સત્ર પણ અર્ધા જેટલું પૂરું થયું છે, ત્યાં એનું આયોજન કરનાર પરિષદ્ધને એના રોકડા લાભો જાણાઈ ચૂક્યા છે. ‘પરિષદ અમારે અંગડો’વાળો ગુજરાતી પ્રજાનો ઉમળજીભર્યો આવકાર પરિષદ સારુ એ અર્થમાં આશીર્વાદદુર્દુર બની જાય છે કે નવાજૂના સાહિત્યકારોનો ઉમળજી શતાબ્દી વયવી ચૂકેલી પરિષદમાં નવો પ્રાણ પૂરે છે. સ્વધૂળ દસ્તિએ જોઈએ તો યાત્રાના લગભગ દરેક મુકામે કેટકેટલું સાહિત્ય વેચાય છે! કેટકેટલાં સ્વીપુરુષોને પરિષદના સભ્ય બનવાની પ્રેરણ મળે છે! કેટકેટલાં સ્થળોએ નવી સાહિત્યિક પ્રવૃત્તિનાં મંડાણ થાય છે! ગુજરાતને ખૂણે- ખાંગચેરે પડેલા કેટલાક જાણીતા અને કેટલાક અજાણ્યા સાહિત્ય-રસિકોની ભાગીદારી જેમ એક બાજુ પરિષદમાં પ્રાણ પૂરે છે, તેમ બીજી બાજુ એને લીધી ગુજરાતી પ્રજા પ્રમાત્રિયાંથી માંડીને અછાંદસ સુધીના

સંસ્કારવારસાને જતનપૂર્વક જાળવે છે.

સાહિત્યાત્મા આમ જોઈએ તો આર્થિક રીતે આત્મનિર્ભર છે. એમાં ભજનારા સાહિત્યકારો પોતપોતાનો પ્રવાસખર્ચ બોગવે છે. તમામ ભોજન વ્યવસ્થા સ્થાનિક આયોજકો ખૂબ હોંશે હોંશે કરે છે. સાહિત્યાત્મા સાથે ચાલતા વાહનનું ખર્ચ પુસ્તકવેચાણના કમિશનમાંથી સહેજે નીકળી જાય છે.

અત્યાર સુધીની સાહિત્યાત્મામાં બે રાજેન્ડ્રાએ આપેલા ફણાની નોંધ લેતા પહેલાં તેમની સમ્મતિ નહીં લઉં. કારણ એ બંને એવી સમ્મતિ આપે નહીં એવી બીક છે. રાજેન્ડ્ર પટેલ એમ તો છે પરિષદ્ધના કોણાધ્યક્ષ પણ સાહિત્યાત્માના તેઓ પીર, બબર્યા, મિસ્તી બધું જ છે. આર્થિક ક્ષેત્ર ઉપરાંત ઘડી બધી બાબતોની એમની શક્તિ સાહિત્યાત્માને મુકામે મુકામે જગ્ઝાઈ આવે છે. તેઓ અતિથિ અને યજમાન બંને તરફના લોકો સાથે સાવ સહજ રીતે ભજી જઈ જાય ત્યાં ઉત્સાહ અને સ્નેહ સીધ્યતા જાય છે. કવિ રાજેન્ડ્ર શુક્લ કેદારાથી ગજલ સુધીનો વારસો એમની જટા દાઢીથી શોભતા વ્યક્તિત્વમાં સમાવે છે. સભાઓમાં વક્તા તરીકે બોલવા ઉભા થતા મેં એમને ભાજ્યે જ જોયા છે. એમનું નામ લેવાય છે ત્યાં લોકો એમની ગજલો અને ગીતો સાંભળવા ઉત્સુક હોય છે, અને કોઈને તેઓ નિરાશ કરતા નથી. કેટકેટલાં સ્વરચિત કાચ્યો, ગીતો, ગજલો એમને મોઢે હોય. એમની ઉપસ્થિતિ યાત્રાને ગજલ જેવી ચોટદાર બનાવે છે. એમનો કાચ્યપાઠ યાત્રાની ઘડીખરી સાંજને રમણીય બનાવી દે છે. હું હોંશભેર વાટ જોઈ રહ્યો હું કર્ય તથા મધ્ય ગુજરાતના કાર્યક્રમોની તથા આગલાં વર્ષોની સાહિત્યાત્મામાં ઊગનાર એવી જ રમણીય સવારોની.

ગાંધીકથા નિમિતે થયેલી હંગેન્ડની મુસાફરીમાં આ વખતે શેક્સપિયર, વર્ક્ઝવર્થ અને જહોન રસ્કિનનાં જન્મસ્થાનોની તીર્થયાત્રા કરી કોઈ રજા, તહેવાર કે ઉત્સવના દિવસો નહોતા છતાં આખો દિવસ યાત્રાળુઓનો જાણે કે મેળો જ જમેલો લાગે. સાહિત્યકારોની ગુણવત્તા અને ક્રીતિ ઉપરાંત આની પાછળ ત્યાંની પ્રજાનો સાહિત્ય અંગોનો રસ પણ જગ્ઝાઈ આવતો હતો. આપણા લોકમેળાઓ પાછળ પણ આવો જ સંસ્કારવારસો છે. એ વારસો અમુક અંશે ભુલાયો છે, અમુક અંશે વિકૃત કે શિથિલ થયો છે. એ અંજિન ઉપર જે રૂખ પડી છે તેને ફૂકીને પુનઃ પ્રજવાનિત કરવાનું કામ આપણું છે. આપણે ત્યાં પણ આવા સાહિત્યમેળાઓ થશે.

નારાયણ દેસાઈ

### લેખકોને વિનંતી

તંત્રીશ્રી યોગેશ જોખી વિદેશપ્રવાસે હોવાથી એમના ઘરના સરનામે કૃતિ ન મોકલવા લેખકોને વિનંતી.

## કવિતા

પત્નીવિરહ (સ્ટોનેટ ગુરુછ) | ભગવતીકુમાર શર્મા

### ૧. સ્તબ્ધ સમય

(મંદાકાન્તા)

બાંગ્યાતૂટ્યા કષસથી ભર્યા શબ્દ કે સંભળપત્તા  
દોડ્યો એની નિકટ તરયા જે પલંગે સૂતેલી;  
‘ચિતા છીડો; અવ ટીક જ છે’ હોઠ ત્યાં બુદ્ધબુદ્ધાયા;  
પાછો આપ્યો નિજ શયન પે ત્યાં વળી ઊંડકારા  
પીડાધેર્યા; ફરી નિકટ કૈ સાવ ઢંઢોળી નાખી  
કિંન્તુ શબ્દો નદી-જણ સમા ઓટમાં લુપ્ત પૂરા !

દોડ્યો, દેગે કંઈ ચકરડાં ફોન કેરાં ધુમાવ્યાં :  
‘આવી હ્યોંચો તુરત અર્હીઅા સર્વ – શીદ્ધાતીરીદ્ધ !’  
હું બારીએ પળ-વિપળમાં ને વળી દ્વાર પાસે;  
કડા ભાલે, ઉર-ધબક પે, નાડીએ હાથ મૂકું;  
ડોકાઉં હું વિજન પથ પે : કેમ કોઈ ન આવે ?  
ભૌતે ટાંગા ઘડી ટકટક પૂર્ણ તાટસ્થ્યભાવે :  
શીદ્ધે આવ્યાં સ્વજન; યુગ શી લાગતી એ ક્ષણોયે;  
ત્યારે થંબ્યો સમય હજ્યે એમ ને એમ, સ્તબ્ધ !

### ૨. પુનર્નિર્માણ

(મંદાકાન્તા)

છોડી આપ્યો ઘર : ખુરશીઓ, બારીએ, બારણાંઓ,  
મેજો જૂનાં કલમ-ખડિયા, પુસ્તકોનાં કબાટો,  
જૂની જાંખી કંઈક અભીઓ, બીત લૂણો બરેલી,  
પડ્ઝો સૂકાં, અપૂજ પડવાની હવે મૂર્તિઓ તે,  
જ્યાં બેસીને કદીક પીધીંતી સાથમાં ચાની ઘાલી  
હિંડોળો એ પવન અડતાં જૂલતો ખાલી ખાલી.

ખુશ્બૂ આછી હજ ફરફરે શાસની છીલવેલી;  
માચાયાં જ્યાં નયન હજ એ ખાટલો સ્તબ્ધ લાગે;  
સુક્કા હાથે ખનખન થતી બંગડીનો ઝુરાપો;

પાસે મૂક્યા જલસભર કો પાત્ર પે અંગુહિની  
જીછી છાપો, ભરચક પડી ઓષ્ઠિની શીર્ષીઓ;  
સૌ પોકારે કણસી કણસી : ‘હું ય સાથે તમારી.’  
છોરી આવ્યો ઘર ભર્યું ભર્યું જૂનું ઝાંખું ટીટેરી,  
કિન્તુ મારા અણુ અણુ વિશે એ ફરીથી રચાતું.

૮-૧-૨૦૦૮

### ૩. અપૂર્જ

(વસંતતિલક)

પાણાણ, કાષ, અવ ધાતુની મૂર્તિઓ કેં;  
સંખ્યા ઘણી, વિવિધતા વળી કેં અપાર;  
લિંચી, પહોળી, ચપટી, ચમકત, ગંખી;  
થોડી છબી તિલક ને રજ્યી ભરેલી.  
વાગા જૂના, સુખણનીય મહેક આછી.  
સૈકા તણાં પટ વીધી પ્રસરે હવામાં.  
  
દેવારતી જહણતી હતી - ઓલવાઈ;  
ધંય તણી રણક થંબી ગઈ પ્રપૂરી;  
કિડી પ્રસાદ-કણ શોધતી કેં ફરે છે;  
માળા અને ભજન-ચોપડી અસ્તવ્યસ્ત;  
શ્લોકો શમ્યા, પ્રતિધ્વનિ ચૂપ મંત્ર કેરા;  
કુલો બધાં વહી ગયાં નિરમાળ સાથે.  
  
અસ્થિકૂલોય સરિતા-જળમાં વળાંતાં,  
છે ત્યારથી અપૂર્જ દેવગવાસ સૂનો !

૨૬-૫-૨૦૦૮

### ૪. પત્ર

(વસંતતિલક)

છે યાદ મેં પ્રજ્ઞાયપત્ર લાખ્યો હતો રે  
ફેલો - સગાઈ પછી જે તુજને લખેલો ?  
સંકોચ, ક્ષોભ, ભય, મૂઽાવણો ભરેલો;  
રુઢિ - નિર્ધેદ ત્યજ ઉર્મિ વડે રસેલો.  
બીડેલ કણજી કરી પરબીડિયામાં;  
પ્રેમેભર્યો તદપિ સંયમથી સજેલો.

પરબ્ર. v ઓંગસ્ટ, 2009

ને આદરી દીધી'તી ઉત્તરની પ્રતીક્ષા -  
રોમાંચથી સભર, સ્વન વડે મહેલી.  
કિન્તુ ન પત્ર, નહિ શબ્દ, બધુંય વંધ્ય !  
નૈરાશ્ય તો પ્રખર ગ્રીભ સમું ધીખેલું;  
આવી પહોંચી સ્વયમેવ પરિજ્ઞાયે તું -  
પ્રત્યક્ષ ઉત્તર થઈ ખતનો સુરમ્ય.  
  
આજેય હું લખું છું પત્ર તને અસંખ્ય,  
સર્નામું તારું જઈ પૂછું હું કોની પાસે ?

૧૭-૬-૨૦૦૮

### ૫. પિતૃગૃહે

(પૃથ્વી)

પિયેર ગઈ તું હશે : હજ્ય એવું લાગી રહ્યું;  
નિશાળ થઈ બંધ ને પછી પ્રલંબ છૂટી અહો !  
લઈ તરત બાળકો પિયર-વાટ આવી લીધી;  
કરી ન દરકાર કેં પ્રખર ગ્રીભના તાપની.  
વિદ્યા કરી ટ્રેઈનમાં અવશ લિન પાટા સમો  
ઉભો જ રહું કેં કષ્ણો વિજન લાગતા સ્ટેશને.

કષ્ણો પર કષ્ણો વીતે, કઠિન ચાત્ર-દા'ડા વીતે;  
ગુજરાતી શક્તો લાખી પ્રજ્ઞાયપત્ર ઉર્મિભર્યા;  
વળી કવનપંક્તિઓ નીપજ આવતી લેખણો  
ભળીગળી જતો વિખાદ વિરહ-અભિનાંશમાં;  
કદી ધૂસર હૈ જતું નભ, થતાં અમીછાંટણાં;  
અને પ્રથમ વૃષ્ટિ શી પિયરથી તું પાછી ફરે.

પરંતુ પળી આ સમે સહૃથી જ્યેષ પિતૃગૃહે  
નહીં ફરી શકે કદી જ્યહીંથી પાછી તું પૃથ્વી પે.

૮-૬-૨૦૦૮

## ૬. નિકુટાર

(શિખરિણી)

‘અરે ! પૌત્રે કેવી સરસ કરી છે પ્રાપ્ત ફૂવરી !  
‘ગુણો-રૂપે પૂરી, સરળ, મધુરી, કાર્યકુશલા;  
‘તમે ન્યાણી એને દગ્સભર સંતુષ્ટ થઈ ને ?  
‘ચાલો, આટોપાયું પગલું ઢળતી આપડી વયે...  
  
‘સુતાઓ કેવી તો હરભાર આવી મળી ગઈ !  
‘બીજાં બચ્ચાં-કર્ચાં ઉપર વરસ્યાં બ્હાલથી તમે,  
‘તમે તો સંસારે તસુની નરવી છાંયથી સમાં;  
‘તમારી આ મીકી ગમતી ભૂમિકા બેહદ મને.  
  
‘અરે, દેખો ! દેખો ! મુજ ગણલનો સંગ્રહ નવો !  
‘ચિત્તારાએ દીયું સરસ નવલું આવરણ યે;  
‘દગ્નોનું મારું આ વધતું જતું દીબલ્ય નીરખી  
‘તમે ચિંતા સેવો સતત - બધી યે જાણ જ મને.’  
  
અરે ! આ તે કેવું નિબિદ ધર્યું છે મૌન જ તમે ?!  
ભૂલી જાઉં છું કે સકળ અવ નિર્વાક અહીંયાં....

૨૨-૫-૨૦૦૮

## કૃતૂહલ | ચન્દકાન્ત ટોપીવાળા

(હરિણી સોનેટ)

નહીં નહીં મને સહેજ યે તે રહે ડર મૃત્યુનો  
રહી રહી મને જાગે એનું અપાર કૃતૂહલ !  
કઈ ગમથી એ આવી પહોંચે કયા અણાસારથી ?  
કઈ ગતિથી ને કેવી ચાલે કયા વળી વેશથી ?  
  
ખબર નથી કે બિલ્લી પેઠે દલે પગ આવશે ?  
ખબર નથી કે ત્રાડો પાડી તરાપ જ મારશે ?  
ખબર નથી કે ઊંઘાવાતે બધું ય ધુણાવશે ?  
ખબર નથી કે વરી રહેશે સર્કપ પતંગિયાં ?  
  
નખણિઅ હશે હેવારે એ બરાબર સજજન ?  
કતલ કરતું આતંકિનું ધ્યું મહોરું હશે ?  
પશુ બની ગયા ટોળાનું એ ઝનૂન બતાવશે ?  
વસૂલ કરશે નીચોવીને અક્કેક ડિસાબને ?  
  
ખબર કરીને આવે તો તો હજુ કઈ ઠીક છે !  
ખબર ન કરે ને આવે તો ? મજા કંઈ ઓર છે !

## તાજ | ચન્દકાન્ત ટોપીવાળા

હુમલાખોર આવશે એ વાત નકી છે.  
જલમાર્ણ જમીન માર્ણ કે આકાશમાર્ણ એ નકી નથી.  
બધું સાબદુ કરી દીધું છે.  
પણ ગુપ્તચર વિલાગ ન તો દૂરનું જોઈ શકે છે  
ન તો પૂરું સંભાળી શકે છે.  
હમણાં હમણાં તો કશાની એમને ગંધ પણ આવતી નથી.  
એમને જાણો કે કાંઈ સ્પર્શટું જ નથી.  
કોઈ ગુપ્ત બાતમીનો એમને સ્વાદ જ નથી રહ્યો.  
અને રશકટુકડીઓ યે આમ તો ખડી કરી દીધી છે.  
પણ એમનો રીથરેહાલ ગણાવેશ છે  
એમની પાસે જૂનાપુરાણાં શસત્રો છે  
એમની પાસે કટાયેલી તાલીમ છે  
ટયાર ઊભા રહેવાનું કે હોશિયાર રહેવાનું  
પણ ભૂલી ગયા છે.

તોયે, મરણિયા થઈ તાજ તો બચાવવો છે  
 બીજુ બાજુ કહેવાય છે કે  
 હુમલાખોર તનતોડ મહેનત સાથે આવવાનો છે  
 નિશાને નિશાને બધું ફૂકી મારવાનો છે  
 આ વખતે હુમલાખોર ફાટી જશે ?  
 તાજ હાથથી જરો ?

### વિલાપ | ચન્દ્રકાન્ત ટોપીવાળા

ફેલતું વૃક્ષ, લહેરતું વૃક્ષ  
 મહેકતું વૃક્ષ, ટહેકતું વૃક્ષ  
 ઘા...  
 શોખાતું વૃક્ષ, વિલાતું વૃક્ષ  
 સુકાતું વૃક્ષ, મૂંગું વૃક્ષ  
 ઘા...  
 નમતું વૃક્ષ, ગૂકતું વૃક્ષ  
 પડતું વૃક્ષ, પછાતું વૃક્ષ  
 ઘા...  
 છેદાતું વૃક્ષ, કપાતું વૃક્ષ  
 હેરાતું વૃક્ષ વેરાતું વૃક્ષ  
 વૃક્ષ હવે ચારેકોર ઢીમગાઓમાં.  
 જરાક પવન આવે છે, ત્યારે  
 એનાં જ સૂક્ષ્માં પાન  
 વૃક્ષને આવી આવીને વળાગે છે  
 હેવાયું પખી પણ આવે છે  
 ભૂલું પડવું હોય એમ ઘાંઘું થતું  
 એકાદ ઢીમયે બેસે છે, તોક ફેરવે છે  
 આમતેમ જુઓ છે, ચાંચ ખોલે છે  
 ચૂપચાપ બંધ કરે છે, ને ઉંડે છે  
 મૂકી જાય છે પાછળ ઘેઘૂર સન્નાટો.

### અમદાવાદ ઠર્યો | ચન્દ્રકાન્ત ટોપીવાળા

અમદાવાદમાં વસ્યો.  
 મકાન કર્યું  
 મકાન બહાર નિસર્યો ને લથડચો,  
 તો  
 રડીખડી દેખાતી કો નારિયેળીની  
 અંગળી આલી લીધી.  
 નારિયેળીએ પહોંચાડચો સમુદ્ર પાસે  
 સમુદ્રે પહોંચાડચો મુંબઈ.  
 મુંબઈએ ફેરવ્યો ગાલી ગાલી  
 ગાલી ગાલીમાં ઘૂઘ્યો  
 પણ એ મારો વિસ્તાર કર્યાં ?  
 એ મારું ઘર કર્યાં ?  
 ઘર શોધું, લથડું  
 સમુદ્રને વળગું  
 સમુદ્રે પહોંચાડચો પાછો નારિયેળી પાસે  
 નારિયેળીએ પહોંચાડચો મકાન પાસે  
 મકાનમાં પ્રવેશું  
 જોઉં તો  
 મકાનમાં બેદુ ઘર મારી રાહ જુએ.  
 અમદાવાદ ઠર્યો.

(સુરેન્દ્ર ચૌધરીની FTIIમાં બનેલી ટૂકી ફિલ્મ 'વિલાપ'નું પ્રસારણ 'લોકસભા' ટીવી પરથી 'ફર્સ્ટ  
 કટ' જોયા બાદ લખાયેલું કાય્ય)

## એક મૌલિક અનુસરણ ધાને ગજલના ને મારા જન્માકાર | લાલિત નિવેદી

(દીર્ઘ ગજલ)

કરો સમસ્તીકરણ કે પૃથક્કરણ એનું  
જુદા જ જ્ઞામાં થયું છે રૂપાંતરણ એનું.  
પહાડ જેવું અટલ છે પ્રખર રટણ એનું  
વહી રહ્યું છે અસ્થિમાં પરમ જરણ એનું.  
છે એક નામ લખેલું હરેક કણ એનું  
બચાવી લીધું છે ઓણે દટણપટણ એનું.  
એ ખુશભૂષો... એ બગીચા... અને બમણ એનું  
સમેટી લીધું પલાંઠીમાં પર્દણ એનું.  
ભલ્યું થશે પ્રલ્યુ ! સ્વીકારી લે તું પણ એનું  
તને દાખાડશે નહિતર કઠોર ઝણ એનું.  
થયું છે ધરમાં ને ધરમાં જ અપહરણ એનું  
જે તો શોધી લાવો કોઈ બાળપણ એનું.  
થયું'તું તે જ પ્રસંગે ખણું મરણ એનું  
ખરા પ્રસંગે થયું નહિ અતિકમણ એનું.  
શરીર ઊજવે છે નવ્ય સંસ્કરણ એનું  
સ્મરણ કરે ને કરે નિત્ય જાગરણ એનું.  
ઊધાર્યું હોય કમળ એમ ઊધારે છે ગજલ...  
અને છે શબ્દના તંતુઓ આભરણ એનું.  
પૂજા ને આરતીની ખુશભૂ પ્રગટે એમાંથી  
તમે એ વાંચીને પામી શકો નમણ એનું.  
ખુમાર દીવડાના તેજનો તને શું કહું -  
અમે તો જીવી જશું આલીને કિરણ એનું !  
કદાચ આ જ હશે ફળ મારી તપસ્યાનું  
સુવર્ણસૌસરું દેખાય છે હરણ એનું.  
રણક સંભળાય છે આલરની ઔર ઔર હવે  
શમી રહ્યાં છે અસ્થિઓ અને ખણણ એનું.

કહી શકતી હશે કોને આસુરી વેળા ?  
ને ક્યારે ક્યારે એ મૂકી શકે ચરણ એનું ?

પ્રણામજોગ છે આ સાત સાત અચો પણ  
વહન કરે છે તેજ કયાંથી ક્યાં લગણ એનું.

ન એનું સ્થાન ખરો છે... ન ધ્યાન તૂટે છે...  
થતો ભૂક્કપ લદે કે ખરે પરણ એનું.

આ ગાડ પાન ધરા આસમાન ચૌદ ભુવન  
આ પંખીડાં ય છે એનાં અને છે ચણ એનું.

હિસાબ ને કિતાબો સૌ રહી ગયા અધવચ  
મેં મંત્રમુંગ થૈ માણ્યુ વશીકરણ એનું.

પરોવી મોતીડાં શું કરશું આપણો, ભક્તો !  
કે બસ છે આપણો માટે તો રણજણણ એનું.

તને ખબર ન પડે તે સહજ ઉગારી લ્યે  
અને ન પીટશો ઢંઢેરો શાણપણ એનું.

ઘણીય રાત પછી ભરણું પડજું છે પગલું  
રખે તું માનતો કે છે હદ્ય કઠણ એનું.

ફરીથી કોઈ સમાધાન રાત લાવી છે  
ફરીથી ખોટું પડવાનું સમીકરણ એનું.

અવાજ વાતના વાસણ અને વિચારોના  
ને રાત આખી ખખડતું સતત શ્રવણ એનું.

સુખેદુઃખે તે ભળી જ્યા છે એકબીજામાં  
તો કેમ એક અલગ ને અકળ વલણ એનું ?

ગણીગણીને લેશુંદેશું તોય શું વળશો ?  
સવાર કોની પડવા થૈ છે આકમણ એનું ?

સરળ ઉકેલ અહીં કોઈ કામ નહિ લાગે  
જુદા જ અન્નપાણીમાં છે મેળવણ એનું !

ગળા સુધી હવે તો ધસમસી ગયાં પાણી  
હવે તો આવશો કોઈ નિરાકરણ એનું.

ન સર્ગે હાથ જલાવત એ આમ પોતાને  
કદાચ આમ પૂરું થૈ ગયું જમજા એનું.  
જુઓ કે આપણામાંથી જ કોઈ હોઈ શકે  
એ શખ્સ પરથી હટાવી દો આવરણ એનું.  
શું બંધોબસ્ત છે કોઈ યા કોઈ દહેશત છે ?  
હેરેક જજા ન બને આમ ઓણિંગજા એનું !  
અતાંય કેવું કે ક્યાયે ન એનું નામ આવે  
સમગ્ર શહેર છે એનું ને છે ચલણ એનું.  
સવારે બે મિનિટનું હું મૈન પાળું છું  
થઈ નહી જે મુરાદો કદી પૂરણ એનું.  
કાંઈ ફુભાસિયો ય તરજુમો કરી ન શકે  
અને બની ન શકે રાનિઓ શરણ એનું.  
આ કાંગરા જ ફક્ત ખરતાં હોય એવું નથી  
જવું ને આવવું ય થૈ ગયું કિરણ એનું.  
ગુજરા અરણ્ય તમસ કલ્યાણ ત્વચાઓના  
રમતરમતમાં ક્યાંથી ક્યાં થયું રમજા એનું.  
પછી ઉધ્યાનમાં સૂર્યાસ્ત કે સભાઓમાં  
ને રાત આખી ઘરે જાગે છે જૂરણ એનું.  
અદા કરું તો શી રીતે હું ઝણ કમરાનું  
ભુલાય ક્યાંથી, ખાંધુંપીધું છે લવણ એનું.  
જુઓ છે જ્યારથી એ ઉડતો ઉડતો માળામાં  
બની ગયું છે સીમિત ત્યારથી ઉડણ એનું.  
મેં સાચવીને મૂકેલું છે એક સંદૂકમાં  
અણીને વખતે મદદગાર એ સ્મરણ એનું.  
હૂલી જવાયું એવું જાતની પળોજણમાં  
કે થૈ ગયું હતું સાચે જ વિસ્તરણ એનું.  
હું જ્યારે જ્યારે નિદાણું છું આ બગીચાને  
તો ફૂલછોડને લાગે છે જજા અભજા એનું !

શિશુ પદિતજીની ભીતે કરે છે ચિત્તરામજા  
ને એક આગવું શિખવાડે વ્યક્તરણ એનું !  
કલમ ને દાંત કખાયેલા શું લખી શકશે –  
– અલડ ને મીઠુ રમતિયાળ બાળપજા એનું !  
ભલું એ બાળનું થાજો મને રૂડો રાખે !  
ભલું એ આંખડીમાંથી અમીઝજા એનું !  
લીલી ને લાલ પીળી ચૂંદાણી ઘૂમે ગરબે...  
અભીલ ગુલાલ કરું ચોખા છે વરણ એનું !  
નવો જ સૂર્ય ઊગ્યો છે લઈ નવી સમજજા  
નવી જ સુરણિ... ખુશબૂ... ખુશબૂ... ચિત્તરણ એનું !  
સુગંધ રંગ ઝતુ ક્યાં હવે પીડાઓમાં  
ઉતારું ક્યાં જઈને શુષ્ક અવતરણ એનું.  
કોઈની પાછળ એ સરતો હો એવું લાગે છે  
છતાં જુઓ કે છે મૌલિક અનુસરણ એનું.  
સુગંધ હૂલબૂ લઈ આવવાને નીકળ્યા છિ...  
કલમ ને શાહી ને કાગળ છે ઉપકરણ એનું !  
ગુંધે છે વેલ બુઢા મોર કોરા કાગળ પર  
ભરે છે ખુશબૂ ગળજાની ભરતગૂથણ એનું !  
મળી ગયા છે ગળજાના ને મારા જન્માકસર  
મળી ગયું છે ગળજાને ય ગમરું જજા એનું !

અર્પણ - મિત્ર અરવિંદ ભણને

## શગને સંકોરો | ગિરીશ ભટ

છોડવો અમે બાળપણનો દેશ;  
વેલ્યુથી ઉત્તરાવો, મારા સાંખ્યબા !

જળહળ જળહળ છે રામણ-દીવડો,  
જળહળ ફળિયા ને પરસ્સાણ;  
થનગન નાચંતો મનનો ઓરડો,  
ઉબરેથી હૈનું ભરતું ફળ !

ઉભી છૂ છૂ લજામજ્જી વેલ;  
શરમુને છોડવો, મારા સાંખ્યબા !

પાડે ચાંદરડાં કમખલ આભલાં,  
જબકીને જાગે ચારે ભીત્ય;  
અચરજમાં દૂલેલા બે ટોડલા,  
કયાં જાણો, જગાની કેવી રીત્ય ?

સાંવ રે અધૂકડા, બેય કમાડ;  
હળવેથી સંચરજો, મારા સાંખ્યબા !

સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,  
ઓશિકે ઓરતાના વંન;  
ખનકે કડલાં ને દાંગી કાંબીધું  
એથીયે અદેકનું ખનકે મંન.

ધૂઘટ ખૂલવાની આવી રેળ;  
શગને સંકોરો, મારા સાંખ્યબા !

r

## વાર્તા

### કાઢું વરહ કલ્પેશ પટેલ

બસના ખખડાટે ભાગોળની શાંતિને ખોરવી નાખી. ઓટલા પર બેઠેલા બે-ચાર વડીલો જરા સળવયા. બસમાંથી ત્રણ મુસાફર ઊતર્યો. દરવાજે વાસી કંડકરે તરત જ ઘંટડી મારી દીધી. આવી હતી એ માર્ગ બસ પાછી વળી ગઈ...

- ‘ઓહોં, લીલાબુન ! ઘડો દને આયાં ને કાંય !’ બસમાંથી ઊતરનાર સ્ત્રીને વડીલોએ ઓળખી આવકાર આપ્યો.

- ઓવ કાકા ! નવરી પડું ત્યારે આવું ને !

- અમે તો તાણાં નવરાધૂપ છીએં. કાકા વરહમાં ઓટલા તોડીએ છીએં... આવેદ વયના પુરુષે નિસાસો નાખવા જેવું કર્યું.

- તોએ તમારે ભેજોંમાં તો કંકેય હારું છ કાકા ! અમારી બાજુ તો લોક પાલી જ્યં બિચારું !

- ‘બુનની વાત હાચી છ’ ત્યારનો ચૂપ હતો એવો એક પુરુષ બોલ્યો : ‘આપડા બોર તો એટલા ઊંડા નંદી. મોટરેય ઓછા પાવરની જોવે. જ્યારે બુન ઈયાંની મેર તો લાખ રૂપિયા હોય તાણાં બોર થાય. અનું એય કરમાં પોંડી ના હોય તો રહીએ કોરા ધાકોર !’

- કાકા વરહમાં હઉંને કાઢું છ, ભા ! ઉપર પોંઝી હોય કે ઊંડ, મૂળે વહરાત જ ના આવ પછી કરોએ જ શુ ? શેરીમાં શાર ના આવ અકાંદુ ધંધા-રોજગારવાળાય નવરા જ થઈ જેંય ને ! પરાંતીની બજાર પેલાં ચેવી ધમધમતી’તી. અતારે જઈને જુઓં તો મોંખો મારું છ વેપારીઓય !

- લૈ એ તો કુવામાં હોય તો અવાડામાં આવે. કેવતમાં કીધું જ છ નં ! કષાબી પૂંઠે કરોડ, કષાબી કોઈની પૂંઠે નંદી !

વડીલો કાકા વરહની ચર્ચામાં પડી ગયા પણ આગંતુક બહેનને ઊતાવળ હતી એટલે કહે : ‘મુંયે ચાર (ધાસ) માટે જ આઈ છું, કાકા ! કીધું કે, હવાર-હવારમાં જૈને ભેગી થતી આવું... એકાંદ ટ્રેક્ટર ચાર આવં તો હાલ પૂરતું તો ગાડું ગબડે !

- ઓવસ્ટો, ભા ! બુન છ તે ભઈની કને જ આશા રાખે ને !

- બુનને તો આલીએ એટલું ઓછું, ભા !

- આલવાનો જીવેય જોવે, હોં કે .... એક ડોસાએ ખાંસી ખાઈ લઈને ઉમેર્યુઃ ‘બાકી ઘણાંને તો હોય તોય આલતાં જોર આવે !

- ના હોં, અમારે રણછોડલૈ તો હારા છં. ખોટું શું કોંમ બોલું ? ભાઈનું ઉપરાણું લઈ બહેન આગળ ચાલ્યો. એને તરસ લાગી હતી. સવારે રકાબી ચા પીઈને એ ઘરેથી નીકળેલી. રસ્તામાં કશેય પાણી પીવાય નહોતી ઊતરી. સવાર-સવારમાં ભાઈને મળી લઈ ચારની વાત કરી લેવાય તો એના જીવને ટાક થાય એમ હતી. બને તો બપોર પહેલાં

s ભેજો = ભેજવાળો પ્રદેશ.

જ પાણં વળી જવાની એની ગણતરી હતી. ભાઈને ત્યાં ‘મહેમાનગતિ’ નહોંતી કરવી એને. નાહક બારે શું કામ પડીએ ? ધી એટલું મોંધું છું આજકાલ ? ભાબી કાઢી નાખવા જેવી તો નથી પણ બળતરાવાળી તો ખરી જ ! ભઈ તો દિલનો દિલાવર છું નકર ! ભાબી તો ગમે એમ પણ પારકી. ભઈને બળે એટલું એને ઓછું બળે ? ઈમ તો ટ્રેક્ટર ચાર આલતાંથી એને કાઢું જ પડવાનું... પણ, ભઈ આગળ ઈનું હેડે નંદી એટલે... હશે... લોક કરતાં હાંસું છું તોયે... એમ વિચારતી લીલા વાસની દિશામાં વળી. બે-ચાર ઘર મૂકીને જ ભાઈનું ઘર હતું. એણે છેઠેથી જ નજર કરી. ભાબી વાંકી વળીને અંગણું વાળતી હતી. નજાં સામે નજર કરી વઈનેય એ જાવરણો ફેરવતી રહી.

– અયમ, ભાબી ? લીલાએ જ પહેલ કરી.

– આવો બુન ! ખાટલો નમાવીને બેહાં ! આવું છું, અબધારી ! લીલાએ ઓશરીમાંનો ખાટલો થાળો. હાશ કરતીકને બેઠી. પછી તરત જ ઉભી થઈ અંદર જઈ પાણી પી આવી.

– ભઈ નથી ?

– શેમમાં જ્યા.

– મગફળી કાઢી તે ?

– ના.

– હારી અશીં, નંદી ?... ભાબી તરત સજાગ થઈ ગઈ : ‘હમજ્યા જેવું... ખરચો નેકળ ! ઉણ તો વાઈ એવામાં મોટર બળી જઈતી. એટલે એક પોણીની તૂટ પડી. શું કરીએં પણ ! વાઈ એકાદ્યું લેવી તો પડે કે નંદી....’

લીલા થોડીએક વાર મૌન જ રહી. બોલવા માટેના શબ્દો શોધતી હોય એમ... ભાબી પક્કી છે એમ તો. મોર્ય-મોર્યથી આડ બાંધતી હશે. એના મનથી એમ કે, બુન આયાં છું તે કંંક ને કંંક માગવા જ આયાં હશીં ! માગવા આવી હોઈશ તોય ભઈના ઘેર આઈ છું. કોય તરદી (પારકા)ના ઘેર નથી આઈ, હા ! પિયોરમાં તો હક્ક છે છોડીનો.... ભાબીને કુણા કે’ પણ ? આંય ભરી પથારી ઉપર બેશી જ્યાં છું એકાદ્યું ! બાપના ઘેર તો હાંલ્યાં કુસ્તી કરું છું ! અમે તો તેણપણમાં મજૂરી કૂટી-કૂટીને મરી જ્યાં છીએં. તાણ તો ઘર અધ્યર આયું છું ! મારો ભઈ તાણ તો નખ જેવડો અતો !....

ગઢી પાસે હાથ ધોઈ ભાબી ચોપાડમાં આવી. પાલવથી હાથ લૂછતાં કહે : ‘ચા મેલું લીલાબુન થોડી ?

– મરવા ધાં ને ભાબી !

– અયમ ઈમ ? ચા તો તમોને બઉં વા’લી ! થોડી પીજો !

– હાંસું તાણ મેલાં. પણ, રકાબી જ હો !... ભાબી બોલ્યા-ચાલ્યા વિના રસોડામાં ગઈ.

– દૂંગણું છું ?

– એક દો’વા દે છું વળી ! બે તો ઉતચી (વસૂકી) જઈ. એક વેરી દીધી તમારા ભઈએ !

– અયમ ઈમ ?

– ચારની રોમાયેણ. કાઢા વરહમાં નથી પોંકતી ! શું કરીએં ? દીવાલની આડશ

હતી પણ વાતો ચાલતી રહી. પોતપોતાને સાચાં ઠેરવવા સામસામી દલીલો થતી રહી.

– તોય ભાબી ! તમારે તો ઓછા ખરચની શેતી. અમારે તો શીતરુંય ફરી જાય છું ઓવ્ય !

– ઓછું ખરચ તો કેવાનું બુન ! ઠેરનું ઠેર છું બધું ! અમારે ભેજામાં પોણી ઉપર ખરાં. પણ જમીન તો રેતવી (રેતાળ) નંદી ? તમારે તો ચીકાશવાળી – ઉપજાઉ !

લીલાએ નિઃશાસ નાખ્યો. ભાબીનો સુન્વાળો ખૂશો શોધવા લાગી. બહાર જબરો તડકો ચડી આવ્યો હતો. એક કૂતુરું છાંયડા પાસે આવી ભીની મારી ઉસરડીને બેસી ગંધું. લીલા એને ઉઠાડવા માગતી હતી. પણ પછી, ‘હોં બેટું’ એમ ધારી મૌન રહી.

એકાએક યાદ આવતાં પૂછયું : ‘દીપક ચાં જ્યો ?

– રમતા હશી ચાંક !

– બણ્યું. વાટમાં ચાંય તીબા રહેવાનોય વેત ના પડ્યો. આવશે એવો ‘શીંગલ્યુંજિયાં’ હુંભાળીને નેહાકો નાખશે !

– નેહાકો તો શનો નાખાં ? રોજ ઉઠીને દહની નોટ વાપરં છું કુવોર ! બોલતી ભાબી સ્ત્રીલના કપમાં ચા લઈને આવી.

– તમે નંદી પીવો તે ?

– મું ચાં પીઉં છું કો’ય દન ?

– ભાઈ માટે રાખી ?

– ઈમને ચાની બઉં હાડાબારી નંદી. હવારે જોવે બસ !... લીલાએ ચા પીવા માંડી. પસંદ ન પડીએ... આ તે કોંય ચા છું ? દૂધ તો નાખવા ખાતર નાખ્યું છું. ભાબીનો જીવ જ એવો ટૂંકો, બીજું શું ? બુન તો નકર કુના ઘેર આખ્યા ? અમારે આવાશે તો બુનને ભાલીને ગાંડા ગણતર થઈ જોય.... હશે... આપડે તો ઘડી-ને ઘડી માટે આવીએં....

– ભાઈ કયા ખેતરમાં જ્યા છું ? દૂકડા કે આધા ? લીલાએ પૂછયું.

– ‘આધે જ્યા છું.’ ભાબીની અંખમાં ચમકારો ઉઠચો ન ઉઠચો ને અદશ્ય થઈ ગયો : ‘દૂકડે તો શું લેવા જોય ? લીલી ચાર વાઈતી તે વે’લી ખવરાઈ મેલી !’

– ઈમ ?

– હાસ્તો ! ભાબીએ કંબું : ઉણ પડી એટલી વપત (વિપત્તિ) તો દશમનનેય ના પડજો....

– હાચમાચ એવું કાઢું છું, ભાબી ?... બેનના દિલમાં તરત જ ભાઈની ચિત્તા વસી. સ્વાર્થ થોડોક છેટો ગયો જરાવાર...

– ત્યારે શું મું ખોટું કે’તી હોઈશ ?.... ભાબીએ લહેકો કર્યો. એંટાં વાસણ રસોડામાં લઈ જતાં બોલી – ‘તમતમારે નિરાંતે બેસો. મું જૈડુકું લઈ આવું !’

– જૈડુકું શું કોંમ ?

– શીરો કરવા. અયમ તે !

– પણ... મું ખાવા રોકાવાની નથી.

– અયમ ઈમ ? પિયોરને તો હમૂલગું ભૂતી જ જ્યાં !

– આઈશું પછી. ઘણા દન છું આખ્યાના ! આજે તો જવા જ ધાં પણ !

- આ રીતે રઘવામાં અવાય ?

- શું કરું ? આયા વગર ચાલે એવું જ ન'તું ભાબી !.... લીલાથી ઢીલાં થઈ જવાનું. ગરીબડા સરે બોલી : 'ઘરમાં ચારના નોમે તખબુંય નથી. એકાદ્ય મનં થ્યુ, ભઈને ભેગી થતી આવું... ઢોરાનાં ઓશિયાળાં મુઢાં જોવાતાં નથી, ભાબી ! એકાદા ટ્રેક્ટરનો જોગ થાય તોય ઉનાળો ટૂંકો થાય. આગળ ઉપર તો જોંધું જરોં પછી ! મીં તમારા નણદોઈને કીંધું કે, ભઈને ફીન કરો. પણ ઈમની તો ખબર જ છું ન ? સાણાને કે'તાં મૂળ નેચી પડી જાય તો ? એકાદ્ય પછી મારે જ આવવું પડું... ભાબી રસોડામાંથી ખાલી ડબ્બો લઈ આવીને બોલી : 'જીવ તો ઘણો બળં છું, બુન ! પણ, ચારનું તો એવું છું કં... ના કીંધું ? ઉણ તો અમારું જ કાઢું છું. પછી તમને તો ચેયે રીતે આલી શકીએં ? તોયે તમારા ભઈને પૂછજો... તમારી ભઈ-બુનની વાતમાં મું મોંથું નંદી મારું !'

- મું તો ચેયટલી આશા લઈને આઈંતી ભાબી !.... લીલાને તો રોવાનું જ બાકી હતું. મનમાં તો અનેક વિચારો આવી ગયા. ચારનો વેત નંદી પડે તો એવાએ (પતિ) તો ઊંધું જ બોલવાના. કે'શી, પિયોર-પિયોર કરતી મોય ઉપાડે જઈંતી ને ! આઈ ને હથ ડિલોળતી પાછી ? તારો ભાઈ કશું પરખાવે એમ નથી. તું નાહક એને માટે જીવ બાળે છું...

- અંઝે ઢીલાં વેંશ થઈ જ્યા વગર બયાકા શમારો હેડાં ! ચાલશીં કે લીલું શાક લઈ આવું ? ગોંમાં બળી આ શાકની તો નિત જીઠીને લોળી !

- મારે તો જે અર્થે એ ચાલશેં, ભાબી ! શીરોય મરવા ધાં મું તો કઉ છું !

- મરવા દેવાતો અર્થે ? તમારા ભાઈ જોયા છું ? ચાંબડું ઉતારી નાખે ઓવ !.... કહેતી ભાબી અંદરથી બયાય ને ચાપું લઈ આવી.

- 'લ્યો ! મું આવું અબધી !'... ભાબી જ્યાટે ગઈ. લીલા રસોડામાંથી તાંસણું લઈ આવી. બયાય ધોઈ નાખ્યા. સમારવા બેઠી. ગણગણાટ તો ચાલુ જ હતો : 'પાછાં કી 'છું, ભાઈ ચાંબડું ઉતારી લે. ભાઈ તો વિચારો ગરીબ ગાય જેવો છું. એટલે તો તમોને મોકળું મેદાન મળી જું છું. બાકી, એક ફેરો ચાર તે કોંય મોટી શોગાત કે'વાય ? એટલું ખહલું (ચાર) તો લોક અમથુંય લેજાઈ મેલ છું. અને આ તો માની જણી બેનને આલવાની છું. ઈમાં વળી હા-ના થાય ?

- 'ફીરું ! તમે ચ્યાણં આયાં ? દીપક દોડતો આવ્યો.

- અભ્યાં હાલ બેટા ! ચાં જઈ આયો તું ?

- શેતરમાં.

- એકલો ?

- ના. પણ્ણાં બે.

- આધે કે ઢૂકડે.

- ઢૂકડે.

- તારા પણ્ણ તો આધે નથી જ્યા ?

- ના. કાલે જ્યાતા. બે દંન તો ઢૂકડે જ જવાનું. મફક્ષણીઓ લેવાઈ જાય ને !

- ગાંધાં. ઢૂકડે વળી મફક્ષણી જ ચાં વાઈ છું ?

- બેયે ખેતરમાં વાઈ છું. પણ ફીરું ! શીંગ ભૂજિયાં ના લાયાં મારી ઓદે ?

- લાખબાની જ અતી, બેટા ! પણ, એશ.ટી. ઉભી જ ના રહી. લે, મું પરીશા આવું તે તું લઈ આય ! લીલાએ પાકિટમાંથી પૈસા કાઢીને આયા. છોકરો દોટ મારતો ગયો. લીલાની આંખમાં જળજળિયાં આવી ગયાં : 'મેર મૂર્ખ ! તું તો ભાબી છું કં ગયા જલમની વેરવી. સંગી નાંદાંદ આગળ જૂઠ ? ના આલવી હોય તો મુઢામુઢ ના પાડવી'તી... પાછી, મને કે', લીલી ચાર વાઈંતી. જૂઠ કો'યનું છૂંપું રહ્યું છું તે તારું રેશો ? પાપ તો છાપે ચયાને પોકારે... લીલા ઉભી થઈ. શાકનું તાંસણું અંદર મૂકી આવી. મનમાં તો એવી નફરત ઉઠી કે, અબી હાલ પાછી જતી રહે. નથી ખાવો તમારો શીરો. આવાં જુછાં લોક સાથે તો સંબંધ હોય કે ના હોય બધું સરણું... પણ, ભાઈ ? ભાઈ જોંશે તો ઈને ચેટલું દુઃખ થાય ? શેર લોહી બળી જ્યા બિચારાનું... ભલે ને બળે... અનેય ખબર તો પડે કે – હળગી બુનના નેંડાકા લે એ ચાલે કાંઈ ? તમારે તો કાઢા વરહમાં બુનને ટેકો કરવાનો હોય એને કેંકાણો આવી રમત રમો એ ચાલે ? મનમાં અનેક વિચારો ચાલતા રહ્યા તોય લીલાએ શાક વધારવાની તૈયારી કરી લીધી. ભાબીએ જૈડકું લઈ આવી ગઈ.

- તમે શું કોમ રસોડામાં પેઠાં ? મું નથી કરનારી ? પંખા હેઠે બેહાં નિરાતે...!

- મેં કું નવરી બેશી રઉં ઈના કરતાં એકાઢું કોમ કરું તો તમારે એટલી ઓછી ધમાલાં...

- ઈમાં શાની ધમાલ ? છોડીઓ તો કુના વેર આબ્બા ? કહેતી ભાબી શીરાની તજવીજમાં પડી.

- બુન – બુન ! મું શીંગ-ભૂજિયાં લાયો ! છોકરાએ દોડતા આવીને કથું.

- કુણે લઈ આલ્યાં ?

- ફીરુંએ.

- તમનેય શું કે'વું લીલાબુન ! છોકરાને બગાડી મેલશાં.

- કાંય બગાડી જતાં નથી. ફીરું કાંય રોજ આવીને બેશી રેચાની અતી ? લીલા બોલી. મનમાં તો બીજા જ શબ્દો ઊગ્યા – 'બગાડશોં તો તમે. જૂઢું બોલતાં શિખવાઈને !....

- તમતમારે બેહાં. મું કરું છું હળવે – હળવે... લીલા વળી ખાટલામાં બેઠી. ગરમી વધી ગઈ હતી. એણે નિસારો નાખ્યો : 'ચેવો તથ્યો છું ! બે મર્દના કાઢવા જબરા કાઠા ! કુણ જોંશે શુંયે થશેં ? ઓછામાં પૂરાં આપવાં કાળજાબૈણાં (કાળજું બળી નાખે એવાં) વરહ. રોમ જોંશે અય કરીને જિવારો ?' લીલાએ ફરીથી નિસારો નાખવા જેવું કર્યું. એટલામાં રણાછોડ આય્યો. દૂરથી જ બેનને જોઈ. સુક્કા રણ જેવા એના ચહેરા પર લીલારો ફરી વળ્યો : 'ઓહોહો ! લીલાબુન આયાં છું ! આવોં બુન આવોં ! હાજાંનરવાં તો ખરાં ને ?'

- અમને તે શું થવાનું હતું, બે ?

- તે એકલાં જ આયાં ? ભાંશિયાને ના લાયાં ?

- ઈનું ભાષતર ના બગાડાય ને ! આ તો મારે આયા વિના ચાલે એવું નો'તું એટલે થયું કે, જઈ આવું ઉભાઓબ !

- એવું તે શું કોમ અતું બુન ?... રણાછોડ બોલીય નહોતો રહ્યો ને રસોડામાંથી બૂમ પડી : 'કઉં છું... ખાંડનો ડબ્બો ઉતારી આલજો !'

- તમારાં ભાભીનું આ જ હુંખ. સખેથી બેસવા જ ના દે ! ભઈ-બુન બે ઘડી નિરાંતવાં બેઠાં તને ના જિરવાણાં ?

- પોંકતી નથી. નંદી તો તમોને ના કહું !

- હા ભઈ હા ! આ ઊભો થો લે. રણાધોડ ઊભો થઈ રસોડા ભણી ગયો. લીલાએ યાદ કરાવ્યું : ‘પણ ભાભી ! ખાંડનો ઝેણો ડબ્બો તો ભરેલો છું !’

- ખાંડ ચ્યાં, મુંય ભૂલકણી છું બુન ! એ તો ચોખા ઉત્તારવાતા ! રણાધોડના અંદર ગયા પણી ઘૂસપૂસ જેવું સંભળાયું. રણાધોડ બહાર પણ તરત આવ્યો. લીલાએ એનો ચહેરો વાંચવાનો પ્રયાસ કર્યો. પણ ખાસ કશું વાંચી ન શકી.

- બાકી બધું ચ્યામ છું બુન, કે’ ?

- કીધાજોગું નથી લૈ ! એટલે તો આઈ છું ! લીલા પાછી ઢીલી થઈ ગઈ.

- ઢીલી થઈ ચ્યા વગર કે’, વાત શી છું ?

- કે’વા બેશીએ તો... રોમાયણ છું આખી ! પણ, ઈમ તો મું કુની છોડી છું ! કપાઈ જાઉ પણ નમું નંદી હા ! પણ, આ તો ચારના વખે આઈ છું. ગમે તે કરો પણ એકાંક્ષા ચારનો હાંધો પાડી આવો લૈ !

- તેમેય ખરોં છોં બુન ! ચાર નો’તી તો વે’લાં ના કહીએ ? તૈણ ટેલર ચાર નેકળ ઈમ છું. બે ટેલર તો મારે પોતાને રાખવી પડશે. બાકી, એક ટેલર નરશંગને આલવાનું છું... હવે એ રહ્યો આપડો ભાગિયો. આખા વરહથી કહી મેલ્યું હોય ને આપણે ના પાડીએં તોયે ખોટું પડે. આજે તો પાછો બો’નું આવી જ્યો. આ રહ્યા જો બસો રૂપિયા !

- ત્યારે તો મારે ધરમ-ધક્કો જ ને ?

- પણ, લીલાબુન તમે એટલાં કાચાં તો ખરાં જ. એક ફોન ના કરી દેવાય ? દિલાની દુકોંને ? હલાય્યા વિના દાઢે તે ઓંનું નોંમ !

રસોડામાંથી અવાજ આવ્યો : ‘તે બો’નું પાણું આવી દ્યાં. નરશંગને પઈશા ખરચીને જ લેવાનું હોય તો બીજેથી દેશો. બુનને નેહાકો પડે એવું કરાય ?

- બધીય વાત હારી પણ જુલોનની કિમતનું શું ? બોલીને ફરી જતાં મને તો ન જીએ !

લીલા મુંગી રહી. મગનું નામ મરી ન પાડ્યું એણે. થોડી વાર આડીઅવળી વાતો ચાલી. પણ ખાસ કાંઈ જામ્યું નહિ. ‘ચાર’ની વાતનું ભારણ રહ્યા કર્યું...

- લ્યો હેડાં બુન ! હાથ ધોઈ લ્યો !... પરણે ઊઠી હોય એમ લીલા ઊઠી. હાથ ધોઈ આવી. આંખ સામે ભેસોનાં ગરીબડાં મોઢાં વલવલતાં હોય એમાં શીરો તે ગળે ઊતરે ? બાહુ ખાવું નહોંતું તોય ભાઈ-ભાભીએ મનવર કરી-કરીને ખવરાવ્યું. બધાંના ખાઈ લીધા પછી વાસણ ઊટકવામાંય લીલાએ ભાભીને મદદ કરી.

- ઘડીક આડાં પડોં, બુન !

- મારે તો નેકળવું પડશે.

- આવા તાપમાં જવાતું એણે ?

- તાપને ગણકાર્યો ઓછું ચાલશે ? બીજે ચ્યાંક ચારની તપાસ કરાવું ને ! તમારા બનેવી તો વિશ્વામાં રૂયા હશે ને ?

- મનમાં ઓછું ના આણતાં બુન ! કાઠા વરહમાં દશા જ એવી છું કુણ કુને મદદ કરે ? જેમ-તેમ કરી ચોમાહા ભેગા થઈ જઈએ એકાંક્ષ નિરાંત !

- હાંસું ત્યારે મું નેકળું !

- નેકળવું જ છું બુન ? રણાધોડ ઢીલાફસ અવાજે બોલ્યો -

‘આ તે કાંય આયું કે’વાય, બુન ?’

- ‘તે મું ચ્યાં મેમાનગતિ કરવા આઈ’તી વૈ તે રોકાઉં ? વળી, પાછો એનો એ આકરો સવાલ !

- હાંસું ત્યારે બુન ! આવજો. બનેવીને રામ રામ કે’જો મારા વતી. ભૌંણિયાને પરીક્ષા પતે એટલે રે’વા મોકલજો ! મેલી જરૂર ભાગોળ લગી ?

- ના.... ના ! તમતમારે આરોમ કરોં. હું તો જતી રહીશ. ચ્યાં અજોણું હતું ?

- રો’ બુન !.... ભાભી દોરીને આવી : ‘ચ્યાં જઈ થેલી ?’

- આ રહી ચ્યામ ?

- કાચી કેરીઓ છું, લઈ જાઓ થોડી ! અનં... કારેલાં આવું ? શેઢ- પાડોશીના ત્યાંથી આયાં છું...

- પૂછવાનું હોંસું અશેં ? છોનીમોંની લઈ આય !... રણાધોડ છાણિયું જ કર્યું. ભાભી દોરીને કારેલાંય લઈ આવી. લીલાની થેલી ભરાઈ ગઈ. એના ચહેરા પર પહેલી જ વાર સંતોષ જણકી ઊંઠો : ‘ચ્યાં જ્યો દીપક ?’

- ટી.વી. જોવા જ્યો અશેં, બાજુમાં. લીલાએ પાકિટ કાઢ્યું.

- રે’વા દ્યાં શું કરોં છોં, બુન ?

- ભત્રીજો તો માગ નં !

- કાંય આલવા નથી હેડાં !... લીલાએ પરાજેય દશ રૂપિયાની નોટ ખાટલામાં મૂકી : ‘જાઉ તાણ લૈ ! બાઉ સિંતા ના કરતા. શું ? એ તો થઈ પડશે !’ કહેતી પીઠ ફરી ગઈ. રણાધોડ પણ તરત અવળો ફરી ગયો. શું કરે ? આંખોમાં પાણી વહેવા માંડચાં હતાં પણી... પત્ની જોઈ કે જાય તો આંખ કાઢે પાછી ! ચુપચાપ અંદરના ઓરડામાં જતો રહ્યો એ. ખાટલામાં પડતું નાખ્યું : જાહ રે જાહ રણાધોડિયા ! બુન જેવી બુન આગળ જૂઠ ! કીડા પડશેં નેનદિયા કીડા ! વહરાત આવતો હશેં તોય આંધો જશેં ! કાઢું વરહ તો હૂઈ જયું પણ છપનાનેય ભુલવાડે એવો કાળ પડશેં !... મુંય શું કરું પણ ? હા પાંડું તો બેનું કકળાટ કરે. બાકી, કુંવાશનીને બે ગાલ્યાં ચાર આલાયમાં આપણે કાંઈ બિખારી ઓછા થઈ જવાના હતા ?.... રણાધોડ આંખો મીચીને પડયો રહ્યો. એની આંખ સામે ભૂતકાળ વળ ખાઈને બેઠો થયો. આ જ બેન પોતે ભૂખી રહી મને ખવરાવતી ! બળિયાબાપે બાધા કરવા જતાં ત્યારે ઢીચણસમાણી રેતમાં કેડચ પર બેસાડી લઈ જતી. મારે માટે થઈને આખા મહોલ્લા સાથે કજિયા કરતી. હું રિસાતો ત્યારે કેટકેટલાં વાનાં કરતી ! એ જ બેને માગી માગીને શું માગ્યું આજે ? ચાર જેવી વસની શી શોગાત ? ...અને છતાંય.... બેશની બીજ રાખીને ચ્યાં લગી જીવીશ રણાધોડ ?

- ઘેનાઈ ગયા કે શું, શીરો ખાઈને ?

- ઊંઘ તે કાંય વાટમાં પડી છું ?

- અયમ ઈમ ? આડા દંન તો ઘડીમાં નસકોરાં બોવાવોં છો !  
પત્નીના અવાજાંનું સુંવાળાશ હતી એટલે રણથીડનો રોષ કાંઈક ઘટ્યો : ‘કઉં છું !’  
- શું છું ? રણથીડ અણગમાથી પૂછ્યું.  
- મન નથી લાગતું ને ?... રણથીડ મુંગો રહ્યો : ‘મનંયે નથી સોરવતું... તમે જરૂરિયા થાઓને !

- અયમ ?

- લીલાબુન હજુ ટેશને જ બેઠાં હથો; ભવું હથોં તો ! કે'તા આવોં કે ચારની ચિંતા ન કરે. કે'જો કે, એક ફેરો ચાર અમારામાં આઈ જઈ. મહણીઓ લેવાઈ જાય એકાય જાતે આઈને નાખી જઈશું...

રણથીડ ગળગળો થઈ ગયો. એને તો વિશ્વાસ જ ન આવ્યો -

- ‘અરેખર ?’

- ત્યારે ખોટું કહેતી હોઈશ ? લ્યો, હેંડાં... મોટું કર્યા વગર, ઊપડાં !

હાથે ચંદ્યું એ પહેરણ પહેરી રણથીડ હતી કાઢી. સામો મળનારો તો નવાઈ પામ્યા વિના નહિ રહ્યો હોય : ‘થાકો હેમ રણથીડ આજે આટલો રઘવાયો કેમ ?’ રણથીડનું મન રણથીડ જાણતો હતો પણ ! દોડતી વખતે એનું મન તો વળી ઘોડાની પેઠ જ દોડતું હતું : ‘ના, ના ! દીપલાની મા ઉપર ઉપરથી કઠાટ લાગે એટલું જ. બાકી હાવ કાઢી નાખ્યા જેવી તો નથી જ. એ તો અસ્તરી માત્ર જેણા જીવની તો હોય... શું છું ક, સંસાર ઈને જ ચલાવવાનો ને ! આપણો તો શું ? જીબ હલાઈને ધૂટા ! ગમે એમ પણ છેવટે જતાં એની એ જ પલળી ને !

રણથીડ ભાગોળમાં પહોંચ્યો ત્યારે સૂનકાર હતો. માત્ર બે નવરા માણસો લીંબડા હેઠળના બંકડા પર બેસી પતાં ટીચતા હતા. પૂછ્યતાં જવાબ મળ્યો : ‘બૂનને તો અબી હાલ રઝીકની જીપમાં બેખાડ્યાં અમે !’

એકદમ તો રણથીડ દીલો થઈ ગયો. બિચ્ચારી ! લૂંખ લાગે એવા તાપમાં જીવ બાળતી જઈ, તારા પાપે રણથીડિયા ! ...પણ, તરત જ એણે મન વળી લીધું : ‘જઈ તો શું વાંધો છું ? હંજના દિલાની દુકાનથી ઝીન રમરમાવું એટલી વાર ! ચારની ચિંતા ન કરતા બનેવી ! કાઢું વરહ હથોં તો શું શું ? તમારો હાળો પાંચ વરહનો બેઠો છું !... ને પછી પતાં રમનારાઓ પાસે આવી બોલ્યો : ‘જગા કરોં લ્યા, મારી ! દો-તીન-પાંચ રમી નાખીએ !...’

### ‘પ્રશ્ન ?’ | ડૉ. નીદેશ રાજા

ચન્દ્રિના લગભગ પોણાબારનો સમય, ચંદ્રે બગાસું ખાતા વાદળની ચાદર ખેંચી. મેડિકલ જર્નલનો આર્ટિકલ પૂરો કરી, મેગેજિન બાજુમાં મૂરી, લાયબ્રેરીની લાઈટ ઓફ કરી રાકેશ બેડરુમમાં આવ્યો. નાઈટ ગાઉનમાં સજજ થઈ બેડમાં લંબાવું. ક્ષાણાર્દી પછી પડાયું ફેરવી પાયલને આવિંગનમાં લેવા હથ...

આ સુખદ ઘડીની ઈર્ષા કરતો ઝીન તુર્ત જ રણકી ઉઠ્યો. પથારીમાં બેઠા થઈ, રિસીવર હથમાં ઉઠાવી એ ધીમા સ્વરે બોલ્યો, ‘હલ્લો...’  
પાયલે રીસભર્યા ચદ્રે પડયું ફરી જતાં આંખો ફરી બંધ કરી લીધી. સારપ જેવી સરી જતી ક્ષાણને અનુભવતાં અંધકાર થરથરી ઉઠ્યો.

‘ડોક્ટર...’

‘યસ...’

‘આઈ ઓમ રાલ્ફ...’

‘યસ...’

‘માય વાઈફ...’

‘યસ...’

રાકેશની બાજુમાં હોવા છતાં જાણે પોતે નથી-નો અહેસાસ એને અકળાવી ગયો. પત્ની તરીકેનો સંપૂર્ણ સંતોષ હોય એનું નહોતું. પણ રોમાન્સની પળોમાં ઝીનના અટકચાળાથી એ કંટાણી. અને એમાંથી છેલ્લાં ચાર વીકસ્થી આ ઝીન સાવ નિર્વજજ બની ગયો હતો. દુનિયા માટે રાકેશ ભલેને ડોક્ટર હોય પણ પહેલાં એ પોતાનો પતિ... આંખો ભલે બંધ હતી પણ કાન રાકેશ તરફ તાકી રહ્યા હતા.

‘આજે નેન્સીએ ફરી પાછું ધર માથે લીધું છે. લાવા કરે છે. તોઝાને ચઢી છે.’

મિતાકશરી ઉત્તર ત્યજતા ડોક્ટર રાકેશને હવે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી.

‘રાલ્ફ, મેં તને મેડિસિન આપી હતી.’

‘એની અસર હવે થતી નથી.’

અંધકારમાં પાયલને જોવાનો પ્રયત્ન કરતાં રાકેશે પોતાનો જમણોહાથ પાયલના ખભા પર મૂકતા બોલ્યો, ‘આઈ સી, નો વન્ડર...’

‘ડોક્ટર, પ્લીઝ હેલ્પ...’

‘બાર વાગ્યે જ ઝીન કરવાનો ટાઇમ મળ્યો’ વાક્યનું જભેથી એબોર્શન કરતા સહાનુભૂતિ સ્વરે રાકેશે કહ્યું, ‘રાલ્ફ, મેં તને પહેલાં જ વૌનિંગ આપી હતી.’

‘આઈ નો... આઈ નો...’ રાલ્ફનો ગળગળો સ્વર...

‘હવે બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, યુ નો.’

‘મારી સન અને એની વાઈફ પણ દબાણ કરી રહ્યા છે.’

‘મારી એડવાઈઝ તું જાણે છે.’

‘હું જાણું છું’ રાલ્ફના અવાજાં હતાશાની વીણાનો ઝંકાર રાકેશથી છાનો ન રહ્યો.

‘તે છતાંથી...’

‘અમારા મેરેજને છેતાવીસ વર્ષ થશે.’

‘રાલ્ફ, રીયાલિટીનું એક જ સ્વરૂપ હોય છે, સમજ્યો ?

રીયાલિટી ઈજ રીયલ, યુ મસ્ટ ફેઝસ ઈટ.’ સહેજ અકળાતા રાકેશને સાફ સાફ કહેવું પડ્યું.

‘આઈ ઓમ સોરી. પણ મારું મન નથી માનતું.’

‘આઈ એમ ઓલ્સો સોરી, આઈ વિશ હું તારા જીવનનું સમીક્ષણ તારી પસંદગી મુજબ બદલી શકું.’

સામે છેડ અવાજને હંફ ચઢી હોય એમ અટકી ગયો.

‘રાફ્ફ, ઈટ્ટસ અ ડેડ એન્ડ, અત્યારે નેન્સીને સ્લીપિંગ પિલ આપી દે. સવારે હું એને નર્સિંગહોમમાં એડમિટ કરાવી દઈશ. ગુડનાઈટ !’

શૈન કટ કરી, પથારીમાં લંબાવતાં, પાયલના આછા નસ્કોરાની સરગમ સાંભળી. રાકેશો પાંપણો બીડી. પણ પાંપણની પરસાળમાં નિદ્રાદેવી કે સપનાંઓ ગોઝિ કરવા આતુર નહોતાં. રાફ્ફ અને નેન્સી દસ વર્ષથી એનાં પેશન્ટ, બનેનો એકબીજા પ્રત્યે અપાર સેહ જોતાં રાકેશને પણ અચરજ થતું, એકની સાથે બીજો પણ બીમાર થઈ જાય. વધતી જતી ઉમરની સાથે અલજાઈમરની બીમારીના રાક્ષસે નેન્સી તરફ હાથ લંબાવ્યા. શરૂઆતમાં દવાએ પ્રતાપ બતાવતાં આશા જગ્યા. પણ આરતીનો દીવો ધીમે ધીમે બુઝતાં શ્રદ્ધા પાંગળી બનતી ગઈ. છેવટે અલજાઈમરે વિજયની પતકા ફરકાવતા પોતાના સાંઘાજ્યમાં એક વધુ ગુલામની ભરતી કરી દીધી. રાફ્ફની જદ ‘Till death do us apart’ સુધી નેન્સીની સંભાળ લેવી. રાકેશ ડોક્ટર હોવા છતાંય લાચાર –

છેલ્લાં ચાર અઠવાડિયાંથી શૈનની રિંગ સાથે ‘રાફ્ફ’ શબ્દની રાકેશના જ્ઞાન કૂટત્વી કૂપળ અને આંખોમાં પાનખર ભરી લેતી પાયલ...

ડોક્ટરની બિજી લાઈફ સ્ટાઇલને પાયલે સમજશ્શેરૂવક ધીરજથી પોતાના જીવનમાં વણી લીધી હતી. ધરમાં શૈન રાફ્ફનું જ ‘જો તારોજ હશે’ કહેવાની રુટિનતાથી એ ટેવાઈ ગઈ હતી. જાણતી હતી. રાકેશ પતિ તરીકે પોતાનો છે તો ડોક્ટર તરીકે બાકી સૌનો. પણ રોમાન્સની ક્ષણો જ્યારે અચાનક વિધવા બની જતી ત્યારે અચૂક ગુસ્સો આવતો. પોતે ફરિયાદ કરે તો કયા ડોક્ટર પાસે ?

ચમત્કાર થયો. છેલ્લાં ચાર હિવસથી શૈને જાણે રાફ્ફના નામનું પાણી મૂકી દીધું. અને રાકેશ પણ શાંત.

શનિવારની સાંજે દાળફોકળીનો સ્વાદ માણી, મોફામાં મુખવાસ ઓરી પ્રેસિડન્ટ ઈલેક્ટ ઓબામાની ટી.વીમાં સ્પીચ સાંભળતાં રાકેશને પાયલે પૂછ્યું.

‘તારા પેલા પેશન્ટનું શું થયું ?’

આજે અચાનક પોતાના પેશન્ટમાં પાયલને ઇન્ટરેસ્ટ લેતી જોઈ અચરજમાં ડૂબેલા રાકેશો સામો પ્રશ્ન કર્યો. ‘કયો પેશન્ટ ?’

‘જવા દે...’ સહેજ છણકો.

‘ના....ના... બોલ... બોલ... છેડવાનો ભાવ...’

‘કુંઈ નહિ’... થોડી માયુરી, ગુસ્સો....

‘બોલ તો ખરી...’

‘હું રાફ્ફ વિશે...’

‘કેમ એ યાદ આવ્યો ?’ મશકરીની માત્રામાં વધારો....

‘ફરગેટ ઈટ...’

‘નો....નો... ગો અહેડ...’

‘છેલ્લા ચાર હિવસથી એનો ઝોન...’

‘ઓહ ! સમજ્યો, તું એને મિસ કરે છે...’ ખડખડાટ હાસ્ય અને પહોળી થતી આંખો....

‘મને એમ કે તું એને મિસ કરે છે.’

‘હું...’ તરડાતો અવાજ... ‘નોટ એટોલ.’

‘શ્યોર ?’

‘ઓફિસર્સ... તને એમ કેમ લાગ્યું ?’ સ્વસ્થતાની ટેકણાનો સહારો શોધતો અવાજ...

‘તને શાંત... તને પૂછ્યું જ નકારું...’ પ્રગટતો અણગમો....

‘સોરી, સોરી.... ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે.’

‘રીયલી...!’ જાણવાની આતુરતા પ્રગટી.

‘રાફ્ફને પણ નર્સિંગ હોમમાં દાખલ કરવો પડ્યો છે.’

‘શું વાત કરે છે. યુ આર પુલિંગ માય લેગ, હું નથી માનતી.’

‘નેન્સીને દાખલ કર્યો બાદ બીજે હિવસે નેન્સીના દીકરાનો ઝોન આવ્યો. ‘નાવ ફાધર હેઠ ગોન કેળી.’

મને તાજુબી થઈ કે સાજોનરવો રાફ્ફ અચાનક મેન્ટલ બેલેન્સ ગુમાવી બેઠો. વાઈફના સેપરેશનને ખાતર એક્સ્યુટ ડિપ્રેશનનું સાઈકિયાટ્રિસ્ટે નિદાન કર્યું અને ટ્રીટમેન્ટ માટે એની વાઈફના નર્સિંગ હોમમાં જ દાખલ કર્યો છે. નાવ યુ નો.’ રાકેશને જાણે વાત કરવામાં મજા આવી રહી છે એમ પાયલને લાગ્યું.

‘વોટ અ ટ્રેજડી.... પણ તું કેમ શાંત થઈ ગયો હતો ?’ રાકેશના ખાલે હાથ મૂકૃતા એ આગળ બોલી. ‘યુ આર અ ગુડ ડોક્ટર.’

‘થેંક યુ ફોર યોર કોન્ફિડન્સ.’

ઉભયની વાતચીતમાં ભાગ લેવા માટે ઝોનથી રાફ્ફન્યા વગર રહેવાયું નહિ. એ સાથે જ રાકેશની મશકરી કરવા પાયલ તરથી બોલી બીજી, ‘લે તારા રાફ્ફનો ઝોન આવી ગયો. હે ખુશ !’

રાકેશો રિસીવર કાને ધર્યું. પછી માઉથ પીસ પર હાથ મૂકતાં ધીરેથી બોલ્યો, ‘હની, યુ આર રાઈટ ઓન ધ મની.’ અને તરત જ દ્વિધાના આવિંગનથી ખરડાયેલા અવાજે જોરથી બોલ્યો, ‘રાફ્ફ ઈંજ ધેટ યુ ?’

‘યસ ડોક્ટર...’

‘રાફ્ફ...’ અસમંજસતામાં ડૂબી રહેલા રાકેશને પાયલ અનિમેષ નિહાળી રહી.

‘સોરી ડોક્ટર...’

રાકેશ.... સાયલન્સ....

‘આઈ એમ નોટ કેળી...’

‘આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ...’ વિસ્મયતામાં ગુંગળાતો રાકેશ આભો બની ગયો.

‘મારી વાઈફ સાથે રહેવાનો ચાન્સ આપવા બદલ થેંક્યુ, અને ડ્રામા બદલ સોરી...’

‘ડ્રામા...’ રાકેશની ચીસે પાયલને ચમકાવી દીધી.

‘લીલ ફરગિવ મી... આઈ એમ સોરી...’ અવાજ સામે છેડ શાંત પડી ગયો.

રાકેશના ચહેરા પર અકળામજા, નારાજગી અને ગુસ્સાની રેખાઓના ચિત્રરામણને

જોતાં પાયલથી પ્રશ્ન પૂછ્યા વગર ન રહેવાયું... ‘શું થયું તારા રાફને ?’  
થોડી શાંત પળો બાદ ‘રાફને નહિ, પૂછ મને શું થયું છે ?’ જિજાતાં એ આગળ બોલ્યો, ‘મારી સાથે બનાવત ?’ હોઠો ભીસતાં રાક્ષણ આંટા મારવા લાગ્યો.  
‘મને વાત તો કર... ગુસ્સો થુંકી નાંખ.’

રાકેશની વાત સાંભળ્યા બાદ -

‘દેરી સ્માર્ટ ગાય...’

‘મારી સાથે બનાવત કરી, ધેટ્સ નોટ રાઈટ...’ રાક્ષણ માથે હાથ દબાવતાં બોલ્યો.  
કિચનમાં જઈ કોઝી કપમાં ભરતાં પાયલે કહ્યું, ‘રાઈટ અને રોંગ પર બધા નિર્જાય નથી દેવતા.’  
‘આઈ નો ધેટ, પણ મારી સાથે....’ હતાશ થતાં રાકેશે ધેટ્સ રોંગ’ ત્રણ વાર રિપીટ કર્યું.

રાકેશના હાથમાં કોઝીનો કપ થમાવતાં પાયલે સલાહ આપી, ‘ડિઅર, થોડી વાર ડૉક્ટર થવાનું છોડી, રાફની પરિસ્થિતિમાં ખુદને મૂકી જો.’

કોઝીના કપને હાથમાં રમાડતાં રાક્ષણ શાંત થવાનો પ્રયત્ન કરતાં બોલ્યો, ‘થુ નો પાયલ, થુ આર રાઈટ.’

બેં તો માત્ર મારો ઓપિનિયન આપ્યો છે. પ્લીઝ ડોન્ટ માઈન્ડ.’ બોલતાં પાયલ રાકેશની બાજુમાં બેઠી.

‘ઓન થ ગુડ સાઈટ, આજથી એનો ફોન આપણને નહિ સત્તાવે.’ ફિક્કા હાસ્યની આભા માંડ માંડ રાકેશના નાખુશ ચહેરા પર ફરકી. જાણે એ પરાણે બોલી રહ્યો છે એમ પાયલને લાગ્યું.

વાતાવરણની ગંભીરતાને હળવી કરવાની ઈચ્છાથી પાયલે કહ્યું, ‘એટલું તારે જરૂર માનવું પડશે, ધેર લવ ફોર ઈચ્છ અધર ઈઝ કાબિલેદાદ, ખરું ને ?’

રાકેશો પ્રતિભાવમાં ગરદન હલાવી.

‘તું મારા માટે આમ કરે ખરું ?’

કોઝીની લેવાતી ચૂસુકીઓમાં અવાજ ઓગળી ગયો. પાયલ મનમાં હસી પડી.

રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય. અચાનક પાયલની આંખો ખૂલ્યી ગઈ. એણે પંપણો ચોળી જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારે નાઈટ લોમ્પના આણા અજવાસમાં બેડમાં બેસી ટેલિઝોનને તાકતા રાકેશને જોતાં એ...

r

## વંગ-વિનોદ

## જ્ઞાનસત્રમાં ગડમથલ

નટવર પંડ્યા

સુરતના સીમાએ ક્રિમમાં સા.પ.ના જ્ઞાનસત્રમાં પહોંચ્યો.

આમ તો આવા કાર્યક્રમો નિર્ધારિત સમય કરતાં વશલખ્યા નિયમ મુજબ મોડા જ શરૂ થતા હોય છે. વળી લખેલા કરતાં વશલખ્યા નિયમો વધુ અસરકારક હોય છે. આવા કાર્યક્રમોમાં પધારનારા મહાનુભાવોની મોટાઈ જેટલી વધુ તેટલા તેઓ વધુ મોડા. આમ મોડા પડવા માટે મોટા બનવું પડે. પણ અહીં નારાયણાદા સમયપાલનના ચુસ્ત આગ્રહી હોવાથી આયોજકો અગાઉથી ચૌદ બ્રાંસિંગનો ભાર મૂકી-મૂકીને વારંવાર જાહેરત કરતા હતા કે કાર્યક્રમ નિર્ધારિત સમયે જ શરૂ થશે જેણી નોંધ લેવા વિનંતી. અને પહેલા દિવસે એમ જ થયું ! આ જોઈને મને સિતાંશુજીની કવિતા ‘એમ થયું કેમ થયું’ યાદ આવી ગઈ. પણ બીજા દિવસે એમ ન થયું ! કાર્યક્રમ લગભગ વીસ મિનિટ મોડો શરૂ થયો. ત્યારે બધાને થયું કે ‘ધુ..અ, હવે કંઈક કાર્યક્રમ જેવું લાગે છે.’ તેથી ત્યાર પદ્ધિની સભામાં જેમ પહેલા જ દિવસે શાળાએ જવા માટે ઉત્સાહી બાળક પેરી-દસ્તર લઈને સૌથી વહેલું પહોંચી જાય એમ નારાયણાદા પોતાની ચરખાપેટી લઈને સૌથી પહેલાં આવી ગયા. તેથી બધા તેમની પાછળ જેચાયા. નારાયણાદા ચરખો ચલાવીને સૂતર કાંતતાં-કાંતતાં વક્તાનાં વક્તાન્નો સંભાળતા હતા. વધુ સંચાર લાગે તો ગરાનો શોભાનીને પણ ગ્રાંસાળી લેતાં. પણ જેવી પીજાણ શરૂ થતી કે તેઓ કાંતવા માંડતા.

જ્ઞાનસત્રમાં ત્યાં સ્થાનિક કક્ષાએ સર્વોત્તમ ગણાતા એક અકારણ તેજબી વક્તાએ બીજાની ઘણી મિનિટો પચાવી પારી હતી. જેમ ચણાયેલી ઈમારત તેના નકશામાં નથી હોતી. એ જ રીતે કેટલાક વક્તાઓ પણ સમયના ચોકઠામાં નથી હોતા. ચોમાસામાં અરબી સમુદ્રમાં ઊઠેલું વાવાજોડું જેમ અણાધારી દિશામાં ફિટાય તેમ રેમનું વક્તાવ્ય સાહિત્યમાંથી શૌર્ય તરફ ફિટાઈ રહ્યું હતું. પોતાના લાંબા વક્તાવ્યના અંતમાં કહ્યું કે આમ તો હું ભાવુક વક્તા હું. એટાં ઘણી વાર બોલવા ઊભો થાઉં છું. ત્યારે જે કહેવાનું હોય તે રહી જાય છે. અને બીજું ઘણુંબધું કહેવાઈ જાય છે. છતાં વિરમું છું. અને જે બાકી રહી ગયું છે તે હું હવે પદ્ધિ કહીશ. આ સાંભળી શ્રોતાઓ વગર ઠીકીએ થથરી ઊઠ્યા !

આ જ્ઞાનસત્રમાં કેટલાક ભાવકોને શાળાના વર્ણિંદોમાં જ ગાદલાં-તક્કિયા. નાખીને ઉતારો આપવામાં આવ્યો હતો. તે દશ્ય જોઈને સુરતમાં આવેલા પૂરની યાદ તાજી થઈ. ભાવકો પૂર-નીડિતોની માફક પડ્યા હતા. જો કે તેમની ચિંતા જરા જુદી હતી. કેટલાક પ્રાધ્યાપકો તથા ભાવકોને એ બાબતની સાંજથી જ ખબર પડી ગઈ હતી કે ભાવકોના પ્રમાણમાં બાથરૂમ-ટોયલેટની સંખ્યા ઘણી ઓછી છે તેથી સાંજથી જ તેમને ગુજરાતી સાહિત્યની ચિંતા કરતાંથી બાથરૂમ-ટોયલેટની ચિંતા વિશેષ હતી. તેમાં પણ કેટલાક પ્રાધ્યાપકોએ બાથરૂમ કરતાં ટોયલેટની ચિંતા પર ખાસ ભાર મૂક્યો હતો. સાંજે જ એક પ્રાધ્યાપકે કરુણ સ્વરે કહ્યું, ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?’ વળી આ મુદે

વિષાદગ્રસ્ત બની તેમણે કહ્યું, ‘શહેર તરફની આંધળી દોટમાં આપણે ગ્રામ સંસ્કૃતિનો કુદરતી આનંદ ગુમાવી બેઠા છીએ.’ સાંજે જ બારી બહાર દેખાતાં જેતરો તરફ નજર કરી તેમણે મિત્રો સમક્ષ સવારમાં વગડામાં વિહાર કરવાનો વિચાર વહેતો મૂક્યો. વિશેષમાં કહ્યું કે ભવે અહીંથી જરા અધરું લાગે પણ શોધ કરતાં કોલંબસની જેમ સાનુકૂળ સ્થળ મળી આવશે. સવાલ પ્રયત્નનો છે. વળી સમય અને શક્તિનો બચાવ થશે. આમ છતાં તેમની દરખાસ્તને કોઈએ મજબૂત ટેકો જાહેર ન કર્યો. તેથી તેમણે ‘ગણ્યું જે ખારાએ અતિ ખારું ગણી લેજેની જેમ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. ચિંતાને કારણે તેઓ રાતભર ઊંઘી શક્યા નહિ. સવારે લાઈનમાં ઊભાં ઊભા ફરીથી તેમણે ગ્રામીણ સંસ્કૃતિને યાદ કરતાં પેલો શેર જરા જુદી વથામાં કખ્યો...’

**અપને ખેતો સે બિછદને કી સજા પાતા હું,  
અબ મૈં ટોયલેટ કી કત્તરો મેં નજર આતા હું.**

ભાવકોનું સવારની સભામાં મોડા પડવાનું એક કારણ આ પણ હતું.

આમ છતાં વક્તવ્યોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ભવિષ્ય વિશે વારંવાર ચિંતાએ બક્ત થતી હતી. ઉપરાંત દરેક વક્તાએ એક બાબત પર ભાર મૂક્યો કે ‘હજુ કશુંક ખૂટે છે.’ પછી ભોજનસમારંભ વખતે લાઈનમાં ઊભેલી એક ભાવિકાએ તેના ભાવક પતિને હળવેથી કહ્યું, ‘પેલા લોકો વારંવાર કહેતા’તા ને કે ‘કશુંક ખૂટે છે.’ એ ખરી વાત છે. જુઓને કાંઝૂકતરી અને અડદ્યા નથી.

શાનસત્રમાં હોશે હોશે પદ્ધારેલા મારા મિત્ર સાથે પ્રાધ્યાપકોનું ‘ઝુંડ’ હતું. (અહીં ‘ઝુંડ’ અને ‘જૂદુ’ વચ્ચે ભેડ ન જાણવો.) તે બધા ખુશખુશાલ હતા. તેથી મેં મિત્રને કહ્યું, ‘જો આ લોકો શાનસત્રમાં આવીને કેટલાં ખુશ છે !’ ત્યારે મિત્રે કહ્યું, ‘ખુશાલીનું કારણ શાનસત્ર નહિ, છહું પગારપંચ છે. છહું પગારપંચને કારણે ઘણાંનાં ડાયાલીટીસ અને બી.પી. વગર દવાએ નોર્મલ થઈ ગયાં છે. આવડી આવીએ ઉમરે પણ તેમની પત્તીઓને પતિઓમાં ‘દેવ’નાં દર્શન થવા લાગ્યાં છે.’

કોલેજના ઘણાં યુવક-યુવતીઓ પણ શાન મેળવવા આવ્યા હતા. તેઓ સતત ડાયરી અને પેન ખોલીને બેઠાં હતાં, પણ શું ટપકાવવું તે સમજાતું નહોતું. કેટલાકે અતિ વિક્તાભર્યાં ભાષણ કર્યા ત્યારે એક યુવતીએ તેના સખાને પૂછ્યું, ‘આમાંથી શું ટપકાવવું?’ સખાએ કહ્યું, ‘વક્તાને જ ટપકાવવા જોઈએ.’ મારી પાછળ બેઠેલી બે યુવતીઓ ચર્ચા કરતી હતી. એક કહેતી હતી, ‘પેલા સહેદ વળવાળા દાદા છે તે સાહિત્ય પરિષદના પ્રમુખ છે ?’ ત્યારે બીજીએ કહ્યું, ‘ના, ના. પ્રમુખ તેમની બાજુમાં બેઠા તે છે.’ એટલે પહેલી યુવતીએ પૂછ્યું, ‘એવું તું કિંદ રીતે કહે છે ?’ સખીએ જવાબ આપ્યો, ‘જો ને, એમના માથા પર તો વળ પણ નથી. ગુજરાતી સાહિત્યની ચિંતામાં તેમના વાળ પણ ખરી પડ્યા છે.’ મંચ પર અતિથિઓ અને અતિથિવિશેષને જોઈને યુવતીઓની ચર્ચા આગળ વધી. પહેલીએ સખીને પૂછ્યું, ‘અતિથિ અને અતિથિવિશેષમાં શું તંશાવત ?’

સખીએ કહ્યું, ‘તું તો સાવ બુધ્ય છો. જોતી નથી, જે જાતે હરીફરી શકે છે તે બધા અતિથિ કહેવાય. અને જેમને ટેકો આપવા એક વિશેષ માણસની જરૂર પડે તે ‘અતિથિ-વિશેષ’ કહેવાય. ‘વિશેષમાં તેણે કહ્યું કે થોડાં વર્ષો પછી પેલા અતિથિઓ પણ અતિથિ-

વિશેષ બની જશો.’ આમ શાનસત્રમાં યુવક- યુવતીઓ ઉપરાંત બહેનોની સંખ્યા પણ સારી એવી હતી. બહેનો પાસે પણ ડાયરી અને પેન હતી જ. કોઈ વક્તાએ જ્યારે કહ્યું કે હવે આપણે ગુજરાતી સાહિત્યની સૌંદર્યલક્ષી બાબતોની ચર્ચા કરીશું ત્યારે દરેક બહેનો અગત્યના મુદે ટપકાવવા તૈયાર થઈ ગઈ.

આવાં શાનસત્રમાં શાન લેનારા કરતાં આપનારા વધુ હોય છે. આપણાને મંચ પરના વક્તા તરફથી અને આપણા બાજુવાળા એમ બંને તરફથી શાન મળતું રહે છે. મારી બાજુવાળો પણ મને શાન આપવાની એક પણ તક ચૂકતો નહોતો. તેણે મને શાન આપતાં કહ્યું, ‘જુઓ પેલા રવીન્દ્ર પારેબ છે. એમની નવવક્તા ‘સાત બગવાં આકાશમાં’ તમે વાંચી છે ? વિશેષમાં જણાયું કે પેલાં પલ્લવીબહેન પરચુરણવાલાનું કાલ્ય ‘પ્રિયતમના પોકેટમાં શબ્દોના સિક્કા’ તો વારંવાર માણસું ગમે તેવું છે. અને પ્રોફેસર પટેલસાહેબની નવવક્તા ‘જેતરને શેડે’ કેટલી કસદાર અને રસાળ !

આ બધી જ બાબતોમાં મારી ‘હા’ને કારણે તે ઔર ખીલી ઉઠતા બોલ્યો, ‘આપણા ગુજરાતમાં તો ભૂતકાળમાં પણ ભક્તકવિષે કેવી અદ્ભુત રચનાઓ આપી છે. નરસિંહ મહેતાના ‘હાઈકુ’, મીરાના ‘સોનેટ’ અને ગંગાસતીની ગજલો આજે ગલીએ ગલીએ ગવાય છે.

હવે હું ઘટનાસ્થળ છોડી જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેનો મોબાઇલ ફોન વાગ્યો તે બહાર ગયો અને એ તકનો લાભ લઈ હું ત્યાંથી ડિજિટ કરી ગયો. આ રીતે મારો મોકા થયો.

આવી પરિસ્થિતિમાં વાતાવરણને જીવંત બનાવવા અધિવર્યે એક યુવાન હાર્મોનિયમ સાથે આવ્યો અને તેણે કોઈ પણ પ્રકારના આરોહ-અવરોહની ઝંઝટમાં પડ્યા વિના એકદમ પ્રવાહી શૈલીમાં ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.’ ગાયું, ગાયકી જોતાં તે મને કસુંબીનો રંગ કરતાં ‘મોસંબીના રસ’ જેવું વધારે લાગ્યું. બાજુમાં બેઠેલા મારા મિત્ર મને પૂછ્યું, ‘તેને આ કસુંબીનો રંગ કેવો લાગ્યો ?’ મેં કહ્યું, ‘જરા વસમો લાગ્યો.’ તેમ છતાં વાતાવરણ જીવંત થતું લાગ્યું. પણ પછીથી ખબર પડી કે ચાના કારણે હતું. આ ઉપરાંત મોબાઇલ ફોનના રિંગટોન, ઉધરસ અને ખોંખારા વાતાવરણને જીવંત બનાવતા હતા. બાય ધ વે, ઉધરસ અને ખોંખારા વચ્ચે પાતળી બેદેખેબા છે. ઉધરસ એક દર્દ છે, જ્યારે ખોંખારો એક અભિવ્યક્તિ છે. અને નિઃશુલ્ક ખાઈ શકાય છે. એટલે જ કાઠિયાવાડમાં ઠાકુરો કસુંબા-પાણી લેતી વખતે ખોંખારા ખાતા. આમ એકધારા કસુંબા-પાણીને કારણે કસુંબા ક્યારે પાણી થઈ ગયા. અને ખોંખારા ક્યારે ઉધરસમાં ફેરવાઈ ગયા.... ખબર જ ન રહી !

ત્યાર પછીના વક્તવ્યમાં એક વક્તાએ કહ્યું કે સાહિત્યનાં આપણાં ફૂડાળાં નાનાં થતાં જાય છે તે વિસ્તારવાં જોઈએ. ત્યારે મને વિચાર આવ્યો કે નાનાં કે મોંટ કરવાની જરૂર જ ન પડે તે માટે આપણે પહેલેથી કોઈ ફૂડાળું જ ન બનાવીએ તો ! અગાઉ આવા પ્રશ્નો ઓછા હતા કારણ કે ત્યારે ‘સાહિત્યવર્તુલો’ હતાં, આજે ‘ફૂડાળાં’ છે. આમ અહીં આશા કરતાં ચિંતાએ વધુ વ્યક્ત થઈ. જોકે ભરપોર જમ્યા પછી તે બધી જ ચિંતાએ હજમ થઈ જતી હતી. વિશેષમાં ભાવકો માટે પુસ્તક પ્રદર્શન અને વેચાણ પણ રાખવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારનાં ઘણાં પુસ્તકો હતાં. પુસ્તકો જોઈને મને એક વાત યાદ આવી

ગઈ કે આજકાલ પ્રકાશકોમાં સસ્તી ડિમ્પે પુસ્તકો વેચવા કરતાં ‘સસ્તાં’ પુસ્તકો વેચવાનો ઉત્સાહ વધારે છે. ‘વંચાય’ તેના કરતાં ‘વેચાય’ એવાં પુસ્તકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હોય છે. પ્રકાશકોનું કહેવું છે કે તેથી પુસ્તકોનું વેચાણ વધ્યું છે. પણ આજકાલ સસ્તાં પુસ્તકો કરતાંય સાહિત્યકારોનું વેચાણ વધ્યું છે. મારીક, મંચ કે મોભો પ્રાપ્ત કરવા માટે તેઓ (અપવાદ બાદ !) સસ્તાં પુસ્તક નહિ પણ પસ્તીના ભાવે વેચાઈ જાય છે. આ મુદ્રે ચોવીસ કલાક ચિંતા કરી શકાય એવો મજબૂત છે.

પુસ્તકપ્રદર્શન પછીના વક્તવ્યમાં એક મૂર્ખન્ય સાહિત્યકારે કહ્યું કે આટલી બહોળી સંખ્યામાં યુવક-યુવતીઓને જોઈને મારી આંખ ઠરે છે. વિશેષમાં તેમણે જણાયું કે હવે આપણે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે ખલેખભા મિલાવીને કામ કરવું પડશે. આ સર્જેશન પછી ‘જ્યાં જ્યાં નજર મારી અને બીજાની ઠરે.’ એ સિવાયનાં સ્થળોએ યુવક-યુવતીઓએ તે કાશથી જ સૂચનનો અમલ શરૂ કરી દીધો હતો.

ગુજરાતી સાહિત્ય માટે આ રીતે સક્રિય થયેલી યુવા પેઢીને જોઈને મને આશા છે કે ભવિષ્યમાં આ યુવા પેઢી દ્વારા ગુજરાતી સાહિત્યને જરૂર કંઈક વધુ સાંપડશે. માટે ચિંતા છોડી અંતમાં આશાવાદી બનીએ.

r

### પ્રક્રિયા

(૨૭૪) રેશનાલિઝમના રંગ : (રમણ પાઠક ‘વાચસ્પતિ’ના ચિંતનાત્મક લેખો) સંપા. સુનીલ શાહ, ૨૦૦૮, માનસ પ્રદૂષણ નિવારણ કેન્દ્ર, જોશોવરનગર, પૃ. ૨૦+૧૮૮, રૂ. ૧૦૦/- (૨૭૫) રમણ પાઠકનાં પ્રેમકાચ્યો : પ્રેમપત્રો : સંપા. જમનાદાસ કોટેયા, ૨૦૦૮, માનસ પ્રદૂષણ નિવારણ કેન્દ્ર, જોશોવરનગર, પૃ. ૧૧૮, રૂ. ૬૦/- (૨૭૬) અવસર આનંદનો : જયવતી કાજી, ૨૦૦૮, નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, પૃ. ૧૨+૧૭૧, રૂ. ૧૨૫/- (૨૭૭) સિંહુ સ્વાતંત્ર્યવીરો : જયંત રેલવાણી, ૨૦૦૮, ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ, પૃ. ૧૧૨, રૂ. ૭૭/- (૨૭૮) રાજ બહરમ : જયંત રેલવાણી, બીજી-૨૦૦૮, ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ, પૃ. ૮૬, રૂ. ૬૬/- (૨૭૯) અલખના ઓટલે સંતોને સંગ : જયંત રેલવાણી, ૨૦૦૮, ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ, પૃ. ૧૨૮, રૂ. ૮૮/- (૨૮૦) આપણું ઘર : જયંત રેલવાણી, ૨૦૦૮, ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ, પૃ. ૧૨૮, રૂ. ૮૮/- (૨૮૧) બાર્ટન પુસ્તકાલયમાં સંગ્રહિત હસ્તપતોની સૂચિ : સંપા. ડૉ. રશિમકાન્ત મહેતા, ૨૦૦૮, બાર્ટન પુસ્તકાલય, ભાવનગર, પૃ. ૮૦, રૂ. ૪૦/- (૨૮૨) ન્રિદલ : ડૉ. રશિમકાન્ત મહેતા, ૨૦૦૮, ડૉ. આર. પી. મહેતા, ૭૭૧/૧, મધુરમ ફ્લેટ, સેક્ટર-૨૧, ગાંધીનગર, પૃ. ૪+૧૩૮, રૂ. ૬૫/-

### ભારતીય કવિતા

વર્ષાના અંકુર (તેલુગુ કવિતા) | એન. ગોપી, અનુ. રમણીક સોમેશ્વર

વરસે છે જ્યારે વરસાદ  
ત્યારે ભીજાઈ જાય છે લથબથ  
મનનાં વસ્ત્રો.  
લૂંસી નાખીએ તો પણ  
ગંગા નીકળે છે વિચારો પાછા ઘાસની જેમ  
માછલીની જેમ ખૂલ્લી હોય આંખો  
તેથી શું ?  
દિલને જે સ્પર્શે એ જ ખરું દશ્ય !

દશ્ય ઓટલે  
આકાશ ખોઈ બેઠેલી સ્નીઓનો  
ધરતીને ધૂજાવતો ચિત્કાર  
લીની ક્ષિતિજ-રેખા પર

લર્મલસ રિન્ન ચાલતા લોકો  
માંડે છે પગલું આશાની ઉખા માટે  
હાથ હલાવતી નાળિયેશીની કાંટેમાં  
મહેકી ઊઠે છે અજવાણું  
દોઢી દોડીને  
કાગળ પર જીવેલી વર્ષા  
પ્રસરી જાય છે અંકુરોમાં  
તૂરી જાય છે જ્યારે  
સ્વાનોની દીવાલો પર દંગેલા અરીના  
ત્યારે ખુલ્લાં પડી જાય છે સત્યો  
વાસ્તવમાં આ વરસાદ  
છે આંસુની એવી ચાદર  
જેને ઓઢીને હું  
પામું હું રક્ષણ કંઈથી !

(મૂળ તેલુગુના હિન્દી અનુવાદ પરથી)



## કોંકણી ભાષાના સર્જકને ભારતીય જ્ઞાનપીઠ સન્માન : ૨૦૦૬ | નવનીત જાની

કોંકણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર, ભાષાશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની શ્રી રવીન્દ્ર કેલેકરને વર્ષ ૨૦૦૬નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની ઘોષણા થઈ છે. એમને આ પુરસ્કાર સંસ્કૃતના પ્રભર વિદ્ધાન - સર્જક શ્રી સત્યવ્રત શાસ્ત્રી સાથે સંયુક્ત રૂપે આપવામાં આવનાર છે. બંને સર્જકને આ ક્ષણે અભિનંદન. ઉલ્લેખનીય છે કે ભારતીય જ્ઞાનપીઠ સૌપ્રથમ વાર આ બંને ભાષાઓને પુરસ્કૃત કરી રહી છે ! અહીં રવીન્દ્ર કેલેકરનો સાહિત્યિક પરિચય આપવાની નેમ છે.

રવીન્દ્ર કેલેકરનો જન્મ દક્ષિણ ગોવાના કનકીલિમ નગરમાં તા. ૭-૩-૧૯૮૨ પના રોજ થયો હતો. પિતા ધંધાર્થ દીવમાં રહેતા હોવાથી કેલેકરનું પ્રાર્થિક શિક્ષણ ગુજરાતી ભાષામાં થયું. લગ્ભગ ૧૪ વર્ષ તેઓ ગુજરાતી ભાષાના ધનિષ સંપર્કમાં રહ્યા. (પોતાના અનુવાદકાર્યમાં તેઓ ગુજરાતી ભાષાના અધ્યયનને પણ પરિશામસ્વરૂપ ગણે છે.) એમણે ઉચ્ચ શિક્ષણ પૂર્તગાળી ભાષામાં મેળવ્યું હતું. ભાષાવિકાસનો મુદ્રો એમને મન ઘડી અગત્ય ધરાવે છે. આ મુદ્રાને ચર્ચાની એરણ ઉપર લઈ એમણે ‘આમચી ભાષ કોંકણીચ’, ‘શારેત કોંકણી કિલ્યક’, ‘બહુભાષિક ભારતાંત ભાષેંચે’ અને ‘ધ પોલિટિક્સ ઓફ કોંકણી’ જેવાં પુસ્તકો લખ્યાં છે. સમજ વિચારીને એમણે માતૃભાષા કોંકણીમાં લખવાનો નિશ્ચય કર્યો. એ માને છે કે કોઈ પણ વ્યક્તિની ઉર્મિન્-પ્રગટભત્તા એની પોતાની ભાષામાં જ ઉત્તમ રીતે પ્રગટ થઈ શકે છે.

એમણે ભારતીય તેમજ ગોવા સ્વાતંત્ર્ય સંગ્રહમાં સક્રિયતા દાખવી હતી. ૧૯૬૨ રમાં ગોવામાં કોંકણી ભાષામંડળની સ્થાપના માટેય આગળ આવ્યા હતા. શરૂઆતમાં માર્ક્સિસથી પ્રભાવિત હતા, બાદમાં ગાંધીદર્શને આકર્ષાયા. પોતાના પર ગાંધીવિચારનો પ્રભાવ સ્વીકારતાં તેઓ કહે છે, “મારા રોમે-રોમમાં ગાંધીજીની વિચારધારા પ્રવાહિત છે. એ મારા પ્રાણમાં સમાપેલી છે. મેં અન્ય વિચારધારાઓનું અધ્યયન કર્યું પણ ખબર નહીં કેમ એ મારા મનોનુકૂલ ન રહી.”

લેખક ગાંધીજી ઉપરોત કાકાસાહેબ કાલેકર, સ્વામી વિવેકાનંદ, રામમનોહર લોહિયા અને રવીન્દ્રનાથ યાગોરથી પણ પ્રભાવિત થયાનું સ્વીકારે છે. મહત્વાની ગાંધીને કેન્દ્રમાં રાખીને ‘સત્યાગ્રહ’ અને ‘અશો અશીલે ગાંધીજી’ (ઇ ભાગ)નું લેખન વિશેષતઃ ગાંધીનું દ્વોતક છે. એમણે કોંકણીમાં કેટલાક ગાંધીગ્રંથોના અનુવાદ પણ કર્યા છે.

નિબંધકારના રૂપમાં રવીન્દ્ર કેલેકરને અત્યંત ઝ્યાતી મળી છે. ‘તથાગત’ અને ‘આમારે’ (સાંજની વેળા) નિબંધસંગ્રહોમાં એમની જીવનસમીક્ષક દસ્તિ પમાય છે. એમના ‘ઓથાબે’ (પાનખરમાં ખરતાં પાન)ને તો રવીન્દ્રાપાનિષદ જ કહી શકાય ! એક નિબંધકાર તરીકેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહે છે, ‘મેં અનુભવ્યું છે કે નિબધોના માધ્યમથી લેખક વિસ્તૃતપણે પોતાના મનોભાવોને, ચિંતનને વાચક સુધી પહોંચાડે છે. પરંતુ આ સ્વરૂપમાં બૃહદ વિચારધારા કે મનોભૂમિને સંક્ષેપમાં રજૂ કરવી એ એક કસોટી છે, એક કળા છે.’

એમણે ‘પાંથસ્ય’ (પથિક)માં આત્મકથનાત્મક શૈલીમાં ગોવા મુક્તિ સંગ્રહ સાથે

વૈયક્તિક જીવનાનુભવોનું ભાથું પીરસ્યું છે. ઉપરાંત ‘તુલસી’ (લઘુનવલ), સ્વાતંત્ર્ય સંગ્રહ નિમિત્ત જેલવાસ દરમિયાન ‘મહાભારત’નું અનુસર્જન - ‘મહાભારત’, ‘સર્જકારી આંતરકથા’, ‘ઉજવાડા કે સૂર્ય’ (ઉજાસનો સૂર્ય), ‘સાંગાથી’, ‘જાનવ્યન ઘુસપિલ્લે પ્રશ્ન’ (જનોઈમાં સલવાયેલા સવાલો) જેવાં પુસ્તકો લખ્યાં છે. ‘જાપાન જ્યા દિસલા’ અને ‘હિમાલયાંત’ પ્રવાસગ્રંથોને ગોવા કલા અકાદમી અને સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારો પ્રાત થયા છે.

સત્યનિષ્ઠ, સ્વાજ્ઞતા અને સામાજિક સરોકાર ધરાવતા રવીન્દ્રજીએ ગોવા પ્રાંતના ઉત્થાનને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. તેઓ ધાર્મિક ચિંતનથી વિશેષ સાંસ્કૃતિક ઉત્થાનના માધ્યમથી દેશની પ્રગતિ વાંછે છે. વ્યક્તિચેતનાને ઢંઢોળે એવા સાહિત્યની જિકર કરતાં એ કહે છે, ‘માત્ર યથાર્થવાદી લેખનથી શું થવાનું ? શું એવા સાહિત્યમાં લોકોને પ્રેરવાની શક્તિ છે ? આજે આપણને ફરીવાર એવા સાહિત્યની આવશ્યકતા છે જેનાથી લોકોમાં ચેતના ઉત્પન્ન થાય.’

આ મુદ્ર સાંપ્રદાત લેખકો વિશે જ્ઞાવે છે કે, “આજકાલ લેખક મોટેભાગો લોકપ્રિયતા પાછળ ભાગે છે. એમણે ધ્યાન રાખવું જોઈએ કે સસ્તી અને ભર્તી કૃતિઓ કણજીવી નથી બની શકતી.”

મીડિયાનો વધતો પ્રભાવ લખતાં-વાંચતાં સાહિત્યની આડે નહીં આવે એવું એમનું માનવું છે. સત્તવશીલ સાહિત્ય મીડિયાની આધીમાંય ઊભું રહી શકે છે. તેઓ આ બાબતે ઈયતાની અપેક્ષાએ ગુણવત્તા ઉપર ભાર મૂકે છે. “બદે વર્ષમાં ઓછાં પુસ્તકો પ્રગટ થાય પણ એ મૂલ્યવાન અને ઉત્તમ હોવાં જોઈએ.” એમનું માનવું છે કે પ્રકાશક દૂરગામી દસ્તિ રાખી સસ્તી અને ફાલતુ ચોપડીઓ ધાપવાનું નાપસંદ કરશે તો એવા વાતાવરણમાં લેખક પણ આલતુ-ફાલતુ કે કંઈનું કંઈ લખતાં ખચકાશે જ. સર્જનમાં ગુણવત્તા ત્યારે આવે છે જ્યારે સુવિચારણીય રીતે ગંભીરતાપૂર્વક લેખન થાય. લેખક હોવાના નાતે કોઈ પણ સર્જકની આ પ્રમુખ જવાબદારી ગણે છે.

આવા સત્તવશીલ, સામાજિક નિસબ્તને વરેલા અને વ્યક્તિચેતનાના હિમાયતી સર્જકને ભારતીય જ્ઞાનપીઠ સન્માન બદલ પુનઃ શુભેચ્છાવંદન.

(માહિતીસોત-સૌજન્ય : ‘સમકાળીન ભારતીય સાહિત્ય’, માર્ચ-એપ્રિલ ૨૦૦૮)

r

## વિદેશી સાહિત્ય

## નવલકથાકાર જેઈમ્સ જોય્સ

(૨જ ફેબ્રુઆરી ૧૮૮૨ - ૧૭મી જાન્યુઆરી, ૧૯૪૧)

સુરેશ શુક્રલ

જેઈમ્સનો જન્મ બ્રિગટન સ્ક્વેર રા'ગર, ડબ્લીનમાં થયો હતો. જોય્સે અને મેરી મોરા કુટુંબની જંજાળમાં કોર્કસીટીમાં પૂર્વજો તરફથી મળેલી સ્થાવર મિલકતને સાચવી શક્યા નહિ. જેઈમ્સને માતા તરફથી ગળથૂથીમાં ડેથલિક ધર્મનું રસપાન કરાવવા પ્રયત્ન કરેલો, શિક્ષણ પણ જેસ્યુટ્સ પાસે લીધેલું એટલે શાળા-કોલેજના શિક્ષકો માનતા કે આ મહાનુભાવ એક પાદરી તરીકે ઈશ્વરા ઉપરદેશનો પ્રચારક બનશે. સમય જતાં 'ઓમસ એક્ઝિનસ સોસાયટી પ્રત્યેનો જે કાંઈ સદ્ગુર્ભાવ હતો, તે ઓસરી ગયો. તેણે ઉચ્ચતર અભ્યાસ કલોંગ્વીસ કોલેજ અને બેલ્વેડર કોલેજમાં પૂરો કરી, ઈ.સ. ૧૯૦૨માં સ્નાતકની પદ્ધતી મેળવી. આ સમય દરમિયાન યુરોપિયન સાહિત્યનો પ્રભાવ પહોંચ... સવિશેષ દાન્તે, ઈસ્ટન, અને ફ્રોબર્ટ. થોડો સમય તે તેના પિતાની માફક 'પારનેલાઈટ આઈરીશ' રાષ્ટ્રીય સંઘમાં જોડાયો પણ ત્યાં બેદ્ભાવ ભરેલી નીતિના કડવા અનુભવ થતાં સેવચાએ ઈ.સ. ૧૯૦૪માં 'દેશનિકાલ'ની સજ્જ ભોગવાળાનું પસંદ કર્યું અને યુરોપમાં ટ્રિઅસ્ટ, રોમ, પોલા અને જુરિકમાં રહેવાનું પસંદ કર્યું. નેશનલ લાયબ્રેરીમાંથી 'દ્વિમન પર્સનાલિટી એન્ડ ઈટ્સ' 'સરવાઈલ' આફ્ટર બોડિલિ ડેથના સધન વાચનથી તે ખૂબ જ પ્રભાવિત થયા. આ સમયમાં જોય્સને અનેક રખાતેલ યુવતીઓનો પરિચય થયો પણ નોરા બોરનેકલ તેમના જીવનમાં એક પ્રેરણામૂર્તિ બની. તેમના પેરિસના ટ્રૂક રોકાણ દરમિયાન મેડિકલ કોલેજ ('ઈકોલ મેડિસન')માં દાખલ થઈને ડોક્ટર બનવા પણ પ્રયત્ન કરેલો કારણ કે બાળપણથી જ વિશ્વાન અને ગણિતમાં સાચી રૂચિ હતી. અને વિશ્વસાહિત્યનો સરળતાથી અભ્યાસ કરવા માટે ઓલીવર ગેગોરી પાસેથી ગ્રીક, મિસ્ટર લુપ પાસેથી ઠથલિયન, ફાધર રિયાન પાસેથી ફેચ્ય અને રેવ હેરી પાસેથી લેટિન અને જર્મન ભાષા શીખી લીધી હતી. પણ તબિયત થોડી નાજૂક હતી. મોટી ઉપરે આંખો વધું નબળી બની અને દાંતની પીડા વધી હતી. જેઈમ્સે યુરોપમાં રખાડપણી કરીને લોકોના વેર જઈને અંગેજ શીખવીને કુટુંબનું ભરણપોષણ કર્યું.

જેઈમ્સે સાહિત્યકાર તરીકેની કારકિર્દી કવિ, નિબંધકાર, નાટકકાર, વાર્તાકાર અને નવલકથાકાર તરીકે શરૂ કરી. શરૂઆતમાં 'કલેક્ટર પોઅમ્સ' (૧૯૩૬) કાવ્યસંગ્રહમાં 'ચેમ્બર મ્યુલિક'નો પણ સમાવેશ થાય છે 'પોઅમ્સ પેની ઈચ' (૧૯૨૭) અને 'ઈબસન્સ ન્યુ ડ્રામ' વિવેચનાત્મક સંગ્રહ છે, અને વાર્તાસંગ્રહ 'ડબ્લીનર્સ'માં ડબ્લીનીર્સ વ્યથા, બ્રિટિશ સામ્રાજ્યનો પ્રભાવ, નીચે આઈરીશ પ્રજાની દેશદાની ભાવના મહદુદ અંશે ઘટી, લોકો ચાર્ચ પારનેલ અને તેના સાથીદારોની શહાદતને વિસારે પાડી હોય એમ લાગતું, વાર્તાકારે એક રંગબેંગી સૃષ્ટિ ઊભી કરી સામાન્ય ઘટનાને પણ રસપ્રદ બનાવી છે. જોય્સે આપેલાં શબ્દચિત્રોમાં આઈરીશ સમાજમાં જીવનની કુનિમતા અને દંભનું દર્શન થાય છે. આ પ્રકારના

સામાજિક બંધનથી તેમણે મુક્ત રહેવાનું પસંદ કરેલું, ડબ્લીનથી દૂર જઈને, યુરોપમાં રખાડપણી કરી પણ તેમના મનની આંખ આગળથી ડબ્લીન ક્યારે પણ દૂર ન રહ્યું. પહેલા વિશ્વયુદ્ધ પણ અંગેજ સાહિત્યમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે. ટી. એસ. એલિયટ અને જેઈમ્સ જોય્સને વિશ્વયુદ્ધ સાથે કોઈ નિસ્બત નહોતી, તેઓને લશકરી કામગારીનો કોઈ અનુભવ નહોતો. એલિયટ અમેરિકન હોવા છતાં બ્રિટિશ નાગરિકત્વ સ્વીકારેલું અને જોય્સે આઈરીશ હોવા છતાં રોમ, ટ્રિયેસ્ટ અને ઝુરિકમાં રહેવાનું પસંદ કરેલું. આ સમય "અ પોટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ એઝ અ યંગમેન" (૧૯૧૬)

આ નવલકથાનું શરૂઆતમાં શીર્ષક 'સ્ટીફન લીરો' આપેલું. નવલકથાનું સ્વરૂપ આપવીતી જેવું છે. વાસ્તવમાં લેખકે પૂર્વે કરેલા ગુના અંગેનો બેદ વ્યક્ત કર્યો હોય એમ લાગે છે. યુવાનીનાં કડવાંમાંઠાં સંસ્મરણશીંની વિગત પૂર્ણ નોંધ આપતા ક્યારેક ભારેખમ વસ્તુવિષયની ચર્ચાની શરૂઆત કરે છે તે જોઈએ :

.... "Beauty expressed by the artist cannot awaken in us an emotion that is Kinetic of a sensation which is purely physical. It awakens or ought to awaken, or induces, or ought to induce, an aesthetic stasis, an ideal pity on terror, a stasis called forth, prolonged, and at last dissolved by what I call the rhythm of beauty."

"What is that exactly ?" asked Lynch 'Rhythm', said Stephen, 'is the first formal aesthetic relation of part to part in any aesthetic whole of an aesthetic whole to its part or parts or of any part to the aesthetic whole of which it is part.'

જોય્સની સૌંદર્યદર્શિ એમના લેખોમાં સર્વવ્યાપી છે એમ ન કહી શકાય, આમ છતાં સુજ્ઞવાચકને ઉપર જાણાવેલાં વિધાનો ક્યારેક સૌંદર્યવિહાર એમ તો અચ્યુક લાગે. વિન્ડહેમ લૂઈસના મંત્ર્ય પ્રમાણે જોય્સની શૈલીમાં ક્યારેક ભારે ઉતોજના જોવા મળે છે. આ કથા કાંઈક અડધીથી શરૂ થાય છે. સ્ટીફન ડેડબય નેશનલ યુનિવર્સિટીનો સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી છે. મનની વધુ પડતી ચ્યાળતાને કારણે એ વર્ગની શિસ્તને સાચવી શકતો નથી. જો કોઈ મનુષ્ય જીવનમાં વધુ પડતી ગોપનીયતા જાળવે તો ક્યારેક દુષ્કર પરિણામ આવે. પ્રો. બટ અંગેજ વિભાગના નિષ્ઠાવાન પ્રાધ્યાપક હોવાથી તે ક્યારેક શીડિંગ કલબ સમક્ષ અટપટી ભાષામાં શેકસ્પીયર ઉપર ભાષણો આપે છે. શેકસ્પીયર રોમન ડેથોલિક હતો કે નહિ તે અંગેની ચર્ચા ક્યારેક કંયાળજનક બનતી. સ્ટીફનની કળા પ્રત્યેનો લગાવ ઉપરચોટિયો નહોતો. સ્ટીફનને જૂના વચનામૃતો માટે જરા પણ માન નહોતું. ચર્ચનું સર્વોપરીપણું તે જીવનમાં ક્યારેય નહિ સ્વીકારે એવો દઢ સંકલ્પ તેણે કરેલો. અહીંથી સ્ટીફનના પિતા

સાયમન ડેલસે જીવનમાં કેવા કપરા દિવસો અનુભવેલા તેની વિગત છે. એકદરે પિતા-પુત્ર વચ્ચેનો સુમેળ જ્ઞાપાતો નથી. અંગેજ સાહિત્યસમૃદ્ધિનાં કારણો ચીવથી તપાસીએ તો લાગે છે કે એક જ અર્થપિંડની બિન બિન ધ્યાઓને વ્યક્ત કરનારા અનેક શબ્દો, પર્યાયો સહજ રીતે જ્ઞાપો.

### **‘દ્રિનેગન્સ વેઈક’ :**

‘દ્રિનેગન્સ વેઈક’નો નાયક આધીડ વયનો સ્કેન્ડિનેવિયન છે, ઉછેર કદાચ પ્રોટેસ્ટટ કુટુંબમાં થયેલો; તેની પત્ની રશિયન. પોર્ટર તેની પત્ની, પુત્રો કેવીન અને જેરી અને તેની દીકરી સુખી છે. દર શનિવારે ડબ્લીનના પીઠામાં અકલ્ય ધસારો હોય. લેખક સૌ વાચકને પોર્ટર કુટુંબના સત્યોમાં વાચકને ભાગીદાર બનાવે છે. કાળચિકનાં પૈડાં સાથે દરેક માનવીની ગતિ મૃત્યુ સમીપ જઈ રહી છે. અમુક અંશે લેખક માનવજીવન કેવું ક્ષાણભંગુર છે તે સમજાવે છે. વૃક્ષો ઉપર પીઠાં પાંદડાંની લગ્નોલગ કૂપળો ઝૂટે એ રીતે પિતાની વૃદ્ધાવસ્થા અને પુત્રની થનગાનતી યુવાનનો કમ આપણો સૌ સ્વીકારીએ છીએ. અચાનક પોર્ટરની આંખ ઊઘડે છે અને સહશયનની ઈચ્છાથી પત્નીને ઢંઢોળે છે પણ તે કાંઈ ધ્યાન આપતી નથી. મનુષ્ય ઉતેજનાને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ જાય ત્યારે તેનું વર્તન પશુથી પણ વધુ વિક્રિત બને ! આ પ્રકારના શરબચિત્રને ‘હુમ્ય ઓફ રેફસ્યુલ નિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પુસ્તક ચાર વિભાગમાં છે. અહીંથી વ્યુસી ક્ષાયર, એડમ, ન્યૂટન અને હમ્પટી ડમ્પટીના આફિતના દિવસોની વાત છે. હમ્પટી રિમ્યુ ઈયરવીકર – ડબ્લીન ઈન કીપર અને તેના નાના કુટુંબની વાત કરી છે. આ કથા જીઓવા બેટિસ્ટા વિકેનું ‘બા સાયન્ઝાન્કેવા’ પર નજર રાખીને તૈયાર કર્યું હોય એમ વિવેચકોનું મંત્રય છે. અહીંથી એનન્થી બરજીસના શબ્દોમાં કહીએ તો....

‘O baffling expedition into the dream history for which he devised a “night language” composed of scenes of languages super imposed on a Hiberno-English base.’

(લેખક યુક્તિપૂર્વકનું આચોજન કરીને સૌ વાચકોને મૂલ્યાંત્રી નાંખે એવી યુરોપની અનેક ભાષાનું ભારણ મૂકીને વિશેષ પ્રકારની સ્વભાવોકની મુસાફરી કરાવતી વસ્તુકથાને ડિલાઇન બનાવી છે.)

### **યુલીસીઝ (૧૯૨૨)**

જેઇસ જોય્સે ઘણાં વર્ષોની મહાનવલ ‘યુલીસીઝ’ તૈયાર કરી. આયર્લેન્ડથી દૂર રહીને પણ આઈરીશ પ્રજા ગુલામીની ધૂસરી ફૂગાવી દે એ માટેના ‘મુક્તિ મોરચા’ને જોય્સે પરોક્ષ રીતે સાથ આપ્યો. શાળાના વિદ્યાર્થી તરીકે ‘માય ફેવરિટ હિરો’માં ‘યુલીસીઝ’ વિષે નિબંધ લખીને શાળાના શિક્ષકગણને આશ્રયચકિત કરેલા. આ મહાનવલની કથાવસ્તુ કાંઈક આ પ્રમાણે છે :

સ્વીફન ડેલસ પેરિસમાં થોડો સમય રોકાઈને ડબ્લીન પાછો ફરે છે. બીમાર માની આખરી દમ સુધી સારી સંભાળ નથી લઈ શક્યો એ બદલ બ્લુમને મનમાં દુઃખ છે. આ વિશમાં સૌ કોઈ વધતા-ઓછા અંશે દંબ કરે છે. પેલા ‘માટેલાઉ’ ટાવરમાં યુવાનો ઢંગધડા

વગરની કવિતા કરે છે અને માને છે તેઓ ‘ભેટાફિલ્લિકલ’ આત્મતત્ત્વ જેવા ગંભીર વિષયને ધ્યાનમાં રાખીને કાલ્યો કરે છે માટે તેઓ અચૂક વિશ્વવિષ્યાત બનશે. ક્યારે તેઓ શેકસ્પિયરના હેમલેટ, કિંગલિયર, ઓથેલો અને શીલસ્ટાફની પણ ચર્ચા કરે છે. લિયોપોલ્ડ બ્લુમના પૂર્વજી કદાચ હંગેરીના હતા પણ આજકાલ તેઓ આઈરીશ – યહુદી તરીકે ઓળખાતા. તેની પત્ની મૌલી તેના કરતાં ચાર વર્ષ નાની છે, મિલી ચૌદેક વર્ષની છે, દીકરો રૂડી નાની વયે ચુગ્જી ગયો. બ્લુમે ઉચ્યતેર શિક્ષણ નથી લીધું પણ તેની નિરીક્ષણશક્તિ અદ્ભુત છે, ઈકલસ સ્ક્રીટ ડબ્લીનમાં તેનું કાયમી રહેઠાણ છે અને સ્થાનિક દૈનિક માટે જાહેરાતના એજન્ટ તરીકે કામ કરે છે.

૧૬ મી જૂન, ૧૯૦૪ લિયોપોલ્ડ બ્લુમના જીવનમાં એક અનેરી ઘટના બને છે. આ મહાનવલમાં ઘટનાકમનો સમય સવારના આઈ વાગ્યાથી બીજા દિવસની બપોર છે. બ્લુમ વિચારોના વમળોમાં ફસાય છે, એ ‘યુલીસીઝ’ની કથા વસ્તુના દોર છે... બ્લુમ વિચારયાત્રાની આશા-નિરાશામાં સમતોલપણું જાળે છે. તે પત્નીને શયનખંડમાં સવારનો નાસ્તો આપે છે અને બીજી તરફ તે પ્રેમિકાને પત્ર પણ લખે છે, ક્યારેક તેને સ્વજનના નિધનના સમાચાર સાંભળીને કબ્રસ્તાન સુધી જવું પડે છે, તો ક્યારેક દાડના પીઠામાં કોઈ નશાખોર તેનું અપમાન કરે છે તો ક્યારેક દરિયાકિનારે કોઈ યુવતીને અંગપ્રદર્શિત કરતી જોઈને અકલ્ય એવી ઉતેજનાનો અનુભવ કરે છે તો ક્યારેક સ્ત્રીમિત્રની ખબરઅંતર પૂછવા માટે જનના હોસ્પિટલમાં જાય છે. અચાનક દીકરા સ્વીફનનો મેળાપ થાય છે. સદ્ભાંયે બ્લુમ, સ્વીફનને નગરવધૂઓના દલાલોથી અને પોલીસની કાર્યવાહીથી બચાવી લે છે. આ રીતે લિયોપોલ્ડ બ્લુમને પતનમાંથી પૂર્વસ્થિતિ પ્રાપ્ત કરવાણો, કુશાગ્ર બુદ્ધિ, ધૈર્ય અને સમતાવાળો કહી શકાય. યુલીસીઝ... એટે કે બ્લુમનું પાછા ફરવું એ હારેલા રાજાનું ફરી એક વાર રાજ્યારોહણ થયું એમ કહી શકાય. બ્લુમે દાવકાઈથી પ્રતિસ્પર્ધિઓને હંસ્યવ્યા, ખોવાયેલો દીકરો મળ્યો, જોય્સે નાની-મોરી અસંખ્ય ઘટનાની ગુંથણી આ મહાનવલમાં કરી છે.

યુલીસીઝના છેલ્લાં છેલ્લાંલીસ પાનામાં મૌલીની સ્વગતોક્તિ છે, મૌલીનો જન્મ... ઉછેર જિબાલ્ટરામાં, તેની માતા સ્પેનિશ અને પિતા અંગેજ મિલિટરી ઔફિસર. યુવાવસ્થામાં વસવાટ કર્યો. મૌલી સ્વભાવે થોડી સંકૃતિ મનની, સ્પષ્ટવક્તા, સંગીતજ્ઞ, પણ તેને મન નીતિઅનીતિમાં કોઈ બેદ નહોતો તેથી જ એક વિચિત્ર સમયે તેણે બોલીન સાથે વ્યબિચાર કરવામાં જરાપણ ક્ષોભ નહોતો અનુભવ્યો. પતિ માટે અનહંદ પ્રેમ પણ તેના મનસ્વી સ્વભાવને કારણે પતિને નારાજ કરવામાં તેને ક્યારેય દુઃખ નહોતું લાગ્યું. લેખક મૌલીને ઠીક ઠીક પ્રમાણમાં દૂર રાખી છે પણ બ્લુમના મનની આંખ આગળ તે સતત તરવરતી રહે છે એ તેના સુષુપ્ત મનોભાવથી સમજી શકાય છે.

મહાનવલના કન્દ્રમાં લિયોપોલ્ડ બ્લુમ, સ્વીફન અને મૌલીને ૧૬ મી જૂન ૧૯૦૪ના સવારના આઈ વાગ્યાથી બીજા દિવસની બપોર સુધી જે કાંઈ જાયું, જાણ્યું, જે કાંઈ કર્યું તેની જીણામાં જીણી વિગતની નોંધની રજૂઆત મિસ્ટર હન્ટ પાસે કરવામાં આવી છે. આ સાથે હોમરની ઓડીસીના નાયકની કલ્યાણનું ઉમેરણ કર્યું છે. આ ઉપરાંત કાઈસ્ટના જીવનના પ્રસંગોની સાથે પેલા રખડુ જુના (વોન-ડરિંગ જુ) અંશો લેખકે લીધા છે. ‘યુલીસીઝ’ તૈયાર કરવામાં જોય્સે અનોખું વિશ્વ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મહાનવલ હોમરના

મહાકાવ્ય ઓડીસીને સમાંતરે ચાલે છે. આમ છતાં કેટલીક ઘટનાને જોયુસે દૂર રાખી છે... હોમરના ઓડીસી ટ્રોયની ફુર્દુશા કરીને સિકોનીયનનું નવસર્જન કરતાં પહેલાં એ શહેરના પુરુષોનો ખાત્મો બોલાવી અને એ શહેરની સ્ત્રીઓ પર અકલ્ય અત્યાચાર કરવાનો પોતાના સાથીઓને આદેશ આપે છે. જોયુસે આ ઘટનાને તેમની મહાનવલમાં કોઈ અગત્ય આપી નથી. એકાશી સાયકલોસ યુલીસીઝનો આત્મીય ભાવે સત્કાર કરીને આફ્તમાં મૂકે છે, એ વસ્તુને જોયુસે રાખ્યેથ ચળવળિયાઓએ સામાન્ય પ્રજા માટે ઊભા કરેલા અવરોધોની રીતે બતાવવા પ્રયત્ન કર્યો છે. હોમરિક તત્ત્વોમાં સર્વ (ચૂઢેલ) જે રીતે મનુષ્યને નિભન્ન કોટીનાં પશુઓમાં રૂપાંતર કરે છે એ રીતે જોયુસે સ્ટીફન અને બ્લુમને નગરવધૂના રહેઠાણ પારેની ઘટનાનો ‘નાઈટ ટાઉન’ તરીકે ઉલ્લેખ કર્યો છે. જોયુસે નવલકથાના સ્વરૂપને કાંઈક અનોખો ઓપ આપીને એક કાંતિ જર્ઝ છે. હોમરે ઓડીસીને અનેક જ્યાએ રખડપણી કરતો બતાવ્યો છે એ પ્રમાણે લિયોપોલ બ્લુમને ઓડીસીનો ‘યુલીસીઝ’ કહી શકાય, જોયુસના ‘યુલીસીઝ’ને હેઢી ફિલ્ડીગના જોસેફ એન્ફ્રાયુઝ, લોરેન્સસ્ટનના ‘ટ્રિસ્ટમશોન્ડી’ અને સર્વેન્ટનાં ‘ડેન કિલોટે’ની માફક ‘મોક એપિક’ કહી શકાય. આ મહાનવલમાં અનેક ગ્રંથોના સંદર્ભ છે. જોયુસે સ્વિફ્ટાઝર્લેંડમાં રહીને ‘યુલીસીઝ’ તૈયાર કર્યું એ સમય દરમિયાન માનસશાસ્ત્રનો ખૂબ જ ઊંડો અભ્યાસ થઈ રહ્યો હતો એ જોયુસના અભિગમમાં પ્રો. જેંગની અસર સ્પષ્ટ જણાય છે.

‘યુલીસીઝ’ની મેન્યુસ્કિપ લઈને જોયુસે યુરોપના શહેરમાં લાંબો સમય સુધી રખડપણી કરેલી.... (૧૯૧૫થી ૧૯૨૧) આ સમયગાળામાં તેઓ મૂળ ડ્રાફ્ટમાં કાંઈક ને કાંઈક ઉમેરો કરતા રહ્યા. આજ સુધી જોયુસના વિશેચકો આ મહાનવલના સર્જનમાં જે કાંઈક ગ્રંથાણી રહી છે તે વિશે કુટૂહલ સેવી રહ્યા છે. આજે તો ડબલીન તદ્દન બદલાઈ ગયું છે. પેલો ‘ભોટેલ્યો’ યવર સેન્ટીકોવ જોયુસ યવર તરીકે ઓળખાય છે. જોયુસના સ્મરણાર્થે એક નાનું સંગ્રહસ્થાન ઊંબું કરવામાં આવ્યું છે. આ સંગ્રહસ્થાનમાં જોયુસની બંડી, ચશમાં, લાકડી, ફર્નિચર, હસ્તપ્રતો અને પુસ્તકો રાખ્યાં છે. સમયનાં વહેણોએ કાંઈક નવો ઓપ આપ્યો છે. આજે બ્રીંટન સ્ક્વેરમાં પ્રાચીન વિશેષતાઓ જણાવાઈ રહી છે. આઈરીશ પ્રજા જોયુસને જીવનકાળ દરમિયાન સમજી ન શકી તે આજે તેના પ્રત્યે માન અને સદ્ભાવ રાખે છે એ સ્તુત્ય છે.

r

## પ્રકીષ્ણ

## એક માણસના વૃક્ષ બનવાની ખબર

જગદીય સ્માર્ટ

૧૯૮૨-૮૩ની વાત છે. સુરતથી વહેલી સવારની લોકલ દ્વારા અમે બીવીમોરા સ્ટેશન પર ઉત્તરીએ છીએ. વર્દ્દાવાઈલ ફેના અધિકારીઓ અમને સ્ટેશન પર લેવા આવે છે. વાંસદા-વધુના જંગલમાં ઉનાળું સમયમાં યોધ્યેલા ‘નેચર-કેમ્પ’ના ઉપક્રમે અમારે નાટક ભજવવાનું છે. મેં પસંદગી કરી શ્રી લાભશંકર ઠકરના ‘વૃક્ષ’ નાટકની. નેચર-કેમ્પનો હેતુ જળવાય જેમાં બાળકોને ફુદરતની નજીદીક લાવવાનાં હોય. આવો ચોટદાર વિષય હોય તો, બાળકોને સ્પર્શો ને અમને પણ કરવાની મજા આવે.

અમે અહીંથી નાટકની રીતે, પરંતુ પપેટ શો દ્વારા આ વાર્તા-નાટક ભજવવાનો વિચાર કર્યો. વડોદરા ક્ષાઈન-આર્ટ્સના ફેયરમાં અમે પપેટ-શો ભજવતા. સાથે પાઇળથી S.N.D.T. કોલેજમાં કાફિ ભાષાવતી વખતે, વિદ્યાર્થીઓને શીર્ષખવવા મેં પપેટ-પ્લે સમજાવેલું અને પપેટસ તૈયાર કરાવડાવેલા. ફેન્ટસીનું અદ્ભુત તત્ત્વ આ માધ્યમમાં છે, એમ મેં અનુભવેલું.

અમારી યાત્રા મહિના પહેલાં શરૂ થઈ ગયેલી. શ્રી લાભશંકરભાઈ પાસે મેં એની ભજવણી કરવાની પરવાનગી માંગેલી ને એમણે બહુ પ્રેમથી એ આપેલી. જંગલની પરિસ્થિતિ એટલે કેટલાને સાથે લઈ જવા, પાત્રોની ભજવણી અને મુખ્ય કામ તો પપેટસ તૈયાર કરવાનું. આ પ્રોટોસ્ટ્રેન માર્ગદર્શિકા એટલે જલવ પોર્ટમ - આપણી રાજુલણાની બ્રાન્શી, દીરથી બધાયેલી નહીં, એટલે મુવમેન્ટ્સ થોડી મર્યાદિત. S.N.D.T. વાતે અંધેર નગરીને ગંડુ રાજા’ પપેટસ સ્વરૂપે ભજવેલું એટલે એનાં પાત્રો તૈયાર હતાં. તેથી પહેલા પપેટ શોમાં નેચર-કેમ્પમાં ‘વૃક્ષ’ ભજવેલું ને પાછળથી બાળકોને હસાવવા ‘ગંડુરાજા’ ભજવવું એમ નક્કી કર્યું. અંધેર નગરીનાં કેટલાંક પાત્રોનો પહેલાં ‘વૃક્ષ’માં ઉપયોગ કરેલો. પરંતુ દાદાજી - ચકુડી - ચંપક વગેરે પાત્રો, મુખ્ય પાત્રો વધારે વ્યવસ્થિત રીતે સર્જેલાં. ચંપકનું મુખ્ય પાત્ર રોડ-પપેટમાં બનાવેલું જેથી વૃક્ષ બની જાય. પછી બે હાથ પહોળા કરી સ્થિર બની, ઊભો રહે અથવા એ પપેટ ઊભું રહી શકે એ માટે, બાકીના બધા જલવ પપેટસમાં, જે હાથમાં પહેરીને ભજવવાના.

‘વૃક્ષ’ના વાર્તાકથનથી ભાગ્યે જ ગુજરાતના સાહિત્ય-નાટ્યરસિકો અજાયા છે. અનેક કોલેજોમાંથી ત્યારે એકાંકી સ્વરૂપે ‘વૃક્ષ’ ભજવાયું હતું. હજુય મને યાદ છે જ્યોતિષ જાનીના ‘સંશા’માં એ પ્રથમ વાર છાપાયું હતું અને શ્રી ગુલામમહેમદ શેખે ‘વૃક્ષ’નું ચિત્ર-રેખાંકન આવેલેલું ને છાપાયેલું. ચંપક નામનો માણસ પોતાની વખાલી દીકરી ચકુડી સાથે વરસાદમાં રમતાં એકાંકે વૃક્ષ - લાકડામાં રૂપાંતરિત થાય છે. પહેલો આધ્યાત્મ પણ એ પિતાને લાગે છે. પરંતુ દીકરી તો વૃક્ષને પણ પિતા સ્વરૂપે જ સ્વીકારે છે અને પ્રેમમય સંવાદ કરે છે. પિતા અને પત્ની શરૂઆતમાં વૃક્ષમાંથી પાછા માણસ બનાવવા સંઘન પ્રયત્ન કરે છે પરંતુ નિષ્ણળ. ડોક્ટર, ભૂત-ભૂવા, માનતા પણ, તેઓ ચંપક વ્યક્તિ હોવાના સંવેદનથી દૂર નીકળી જાય છે. ચકુડી માટે તો ‘આ મારા પણ્ણા છે.’ પછી તો આ વાત જગમાં ફેલાય

છે ને પદ્ધતિસ્થિતિ ને પૈસાનો વરસાદ થાય છે. ખૂબ પૈસા મળતાં, ઘરને નવેસરથી બાંધવાની વાત વિચારાય, આઇટેક અને એન્જિનિયર આવે, ખાન મુકાય, નકશો બને પણ આ માણસસ્પે વૃક્ષ વચ્ચે આવે. છેલ્લા દશમાં પત્ની નિષ્ઠુર બની કહે, આ જાડેને કાપી નાંખો. વૃક્ષ ઉર્ફ ચંપકનું અસ્તિત્વ ધરાશાયી થઈ જાય. સૌથી મોટો આધાત ચકુડીને લાગે છે. દાદાજી એને પકડીને દૂર લઈ જાય છે. એક વિક્તિ કપાઈ જાય છે, ભૂસાઈ જાય છે.

અમદાવાદ 'લીલાનાટ્વ'ના વર્ક્ષોપ દરમિયાન લેખક શ્રી લાભશંકર ઠાકરે આ નાટક લખ્યું. સુરતમાં જ્યારે આ પ્રયોગ લીલાનાટ્વમાં ભજવાયા ૧૯૭૫-૭૬ માં ત્યારે મેં જોયું. ત્યારથી જ મનમાં વસી ગયેલું, શ્રી કેલાસભાઈ, દામનીબહેન, શ્રી બાલકૃષ્ણ પેટેલનો અદ્ભુત અભિનય, આ લીલાનાટક દરમિયાન જોવા મળેલો. શ્રી લા. ડા. એ સર્જનપ્રક્રિયાની વાત કરતાં કહેલું કે શ્રી બાલકૃષ્ણ પેટેલ - બાવમાર્ઝ બે હાથ ઊંચા કરી, વર્ક્ષોપ દરમિયાન ઊભા હતા ને એકાએક 'વૃક્ષ'ની કલ્યાના થયેલી, માણસ વૃક્ષ બન્યો. જેના પરથી અમે આ પેપેટ શોની કલ્યાના કરી.

પેપેટ્સ આકર્ષક બનાવવા અનાં વિવિધ કપડાં શોધવા નીતા બજારમાં નીકળી પડે. પછી એને સીવા-ચીતરવાનું કામ. જેમાં પ્રક્ષા, ઇલીજા, બિંદુ, માધવી, પારુલ મારી વિદ્યાર્થીનીઓ જોતરાઈ. નેકમાં કામ કરતા શંકરભાઈ પણ આવી ચડ્યા ને સર્જનપ્રક્રિયામાં જોડાયા. પેપેટ્સમાં એક વૃક્ષ બનાવ્યું. રંગબેંગી કપડા દ્વારા પાન બનાવી, વસ્તંતરી જેમ શાશગાર્યું. ઉપર પક્ષી પૂંડાનાં બેસાડ્યાં. ચંપકની ફિની પર એક પીપળાનું પાન કાપી ચોટાડ્યું ને શાખા ચીતરી, બે હાથ લાંબા વિસ્તરતા, રોડ-સણિયા જોડે બાંધ્યા. દાદાજીની લાકડી, ચશમાં શોધવા શનિવારી હાટની મુલાકાત લીધી. ગંડુરાજાના શિષ્યની અંબોડી છોડી ભૂવાના પાત્રમાં રૂપાંતર કર્યું. ચકુડી ફરાક પહેરાવી મોટી આંખોએ તૈયાર. મા, ડેશીમા, ડોક્ટર, મજૂર બધાં જ ધીમે ધીમે તૈયાર થતાં ગયાં. પ્રોપર્ટી વધતી ચાલી. ચશમાં, બેટરી, લાકડી, રેમકડાનો કેમેરો, ભૂવાને ધૂણાવવા - લોબાનધૂપ ને બીજો અસબાબ. વૃક્ષ બન્યા પછી જ્યારે ચકુડી પાપાને જુદે, પ્રેમ કરે ત્યારે પાછળ પંખી બેઠેલું - વસ્તંતવાળું વૃક્ષ પાછળ ધીમે ધીમે ઊગે, જે દશથી છોકરાઓએ તાળીઓ વરસાવેલી. બેકગ્રાઉન્ડમાં ટેપેરેકાર્ડ પર. કોલ આંદોલની સવારની ધૂન ને પહાડી વાગે. જેંગલ મધ્યમથી ઊંચ્યું. ભૂવાની એન્ફ્રી પર, શંકરભાઈનું ધૂણવું ને લોબાન-ધૂપથી જાહુઈ અસર... બધા ભેદી નજેરે આટલું દશ્ય નિધાળે ને પાણ હસતાં જાય - પણ એ તો બજવણી વખતની વાત. બજારમાંથી એક પતરાની પેરી ખરીદી પેપેટ્સ મૂડી સૂરત્ધાર ચાલ્યો જીજે ગામ ખેલ બજવવા.

બીલીમોરા સ્ટેશન પર અમે વહેલી સવારે ઊતર્યાં, ને જીપમાં 'મહાલ'ના નેચર-કેમ્પ જેંગલમાં પહોંચ્યાં. વધઈથી ઘનઘોર જેંગલ આવે. આહવાથી ફોરેસ્ટ એરિયાનું 'સ્ટોપ' પાટિયું ખસેડી અમારી જીપ કેમ્પ એરિયામાં પ્રવેશી. કેમ્પમાં નાનાં ટાબરિયાને સ્વયંસેવકો અમારી રાહ જોતાં હતાં.

આ જેંગલમાં દીપડા, ચિત્તા ને બીજાં અનેક જેંગલી જાનવરો. શરૂઆતમાં અમે નાનકડા છાપરી જેવા રૂમમાં સામાન મૂક્યો. લીપણવાળો અવાવરું રૂમ, એક ખૂણામાં ગુણની કોણીઓ પડેલી, જે થોડી થોડી વારે જાતે જ સખડ-ઉખળ થતી. એક જણ કહી ગયો અડકશો નહીં. આમાં નાગ-કોણા, કેમ્પ દરમિયાન પકડેલા તે ભરેલા છે. પારુલ જરા

હિંમતવાન એટલે તે ગુણને સ્વર્ણ કરવા ગઈ, ઇલીજા-માધવી ડરે છે. અમારો પેપેટનો પદ્ધતિ આ કોણાઓ સાથે મુકાયો. નદીમાં નાંદીને થાક ઉતારી પાછાં ફર્યા. ટેન્ટ અમને નાનકડો ફણવી દવાયો. બપોરે બામળીયા દાળ-ભાત-વેગણ-બયકાના શાકની રોડમ જલસો કરાવી ગઈ. જમીને જાડ નીચે આરામ ફરમાવ્યો. સ્કિપ્ટ રીડિંગ ઘરે જ પહેલાં કરી દીધેલું. પેપેટ્સ તો અમારે છ ફૂટની જગ્યામાં જ ભજવવાનું હતું. શો અમારે રાત્રે કરવાનો હતો. જેંગલમાં મસ્ત અપકીની ઊંઘ આવી ગઈ. ત્રાણેક વાગે પ્રેસિંગનાં રીહર્સલ શરૂ કર્યા.

માધવી ચકુડીનો રોલ કરી રહી છે ને હમણાં પ્રેમમાંથી પસાર થાય છે તેથી એના અભિનયમાં ભીનાશ છે. પારુલ થોડીક મોટી ઘડાયેલી એટલે એ માના રોલમાં, મારા ભાગે દાદાજી, શંકરભાઈ, ડોક્ટર, આર્ટિસ્ટ એટલે ભૂલો, ડોક્ટર, એન્જિનિયર, મજૂરની આવનજાવન ભજવે. પહેલાં તેઓ ચંપકનો સંવાદ 'હું વૃક્ષ છું' બોલી - ભજવી વૃક્ષ થઈ ખસી જાય. નીતા પડા પાછળ જોઈતી વસ્તુઓ અને પેપેટ્સ પહેરાવવાની - લાવવાની જવાબદારી નિભાવે, સાથે એકાદ પાત્ર પણ ના. ઈલીજા પરદેશી પત્રકાર ને ટેપેરેકાર પર સંગીત ઊંચ્યું-નીચ્યું કરે. આમ અમારી મંડળીએ નાટકની તૈયારી - રીહર્સલ કરવા માંડી. એક હાથમાં સ્કિપ્ટ અને એક હાથમાં જલવ પેપેટ્સ.

કેટલાંક સંવેદનાત્મક દશ્યોનું રીડિંગ પહેલાં કરી લીધું. ખાસ કરીને નિશાળેથી આવેલી ચકુડી, પણાની (વૃક્ષા) પાસે લેસન કરવા બેસે છે. પણા જીણું જીણું ગાય છે. વૃક્ષમાંથી બિંઠા સંગીતના સ્વર, વૃક્ષ પર દાદાજીનું ધોતિયું સૂક્વવં. માનું પાણી લોયથી પિવડાવં.

રીહર્સલ વખતે જ અમે કેટલીય સંવેદનક્ષણોનો અનુભવ કરીએ છીએ. નદીને કિનારે, ઉભડાબાડ ટેકરી, ગાઢ જેંગલમાં રીહર્સલ. માધવી-ચકુડી વૃક્ષને પ્રેમ કરતાં. ચકુડીના રોલ-સંવાદ બરાબર સ્કિપ્ટમાંથી વાંચતી હતી. શંકરભાઈ વૃક્ષમાંથી ખસી ગયા ને ચંપકનું પેપેટ જમીન પર સૂંઠું હતું. માધવી હવે ખરેખરા વૃક્ષને હાથ ફેરવી સંવાદ બોલવા લાગ્યો. 'આ મારા પાપા છે, જીણું જીણું ગાય છે.' તે વખતે હું રોમાંચિત, મારી પર્સિવનેસ, એકદમ જાગ્રત. વધઈનું વૃક્ષ અમારું પાત્ર બની ગયું. માધવીના સ્વર્ણથી મહેંકી ઉઠ્યું, અંત તરફ ગતિ કરતા. અમારી આંખોના ખૂણા સજણ છલકાયા. દૂર બેકગ્રાઉન્ડમાં નદીનો ખળખળ વહેવાનો અવાજ. ત્રાણેક કલાકના રીહર્સલમાં બધું ગોઠવાયું. અમે બધાંએ નાટક બરાબર સંઘન રીતે પસિવ કર્યું.

સંધ્યાકાળે નદીકિનારે પગ બોળી, કેમ્પમાં પાછાં ફર્યા. ને ચાત્રી શોની તૈયારી... બે સારીના છેડા ભેડા કરી પદ્ધતી બનાવ્યો. જલવ પેપેટ્સમાં અમે પાછળ, પેપેટ્સ બધા રોલ પ્રમાણે ઘાસ પર. શેતરંજી પર પાથરી દીધા. પટારામાંથી પ્રોપર્ટી, સરસામાન બેકસ્ટેજમાંથી બધાર આવ્યો. બધાંના હાથમાં વૃક્ષની સ્કિપ્ટ, પડદાના ઉપરના ભાગમાં ૫૦૦૦નો બલબ લટકાવી દીધો. એક નર્વસનેસ તો હતી જ, ભજવવાની. આગળ ટેકરી, નદી તરફ બાળકો આવીને બેસી ગયાં. અમે જેંગલ તરફ, સેજની પાછળ. ને પેપેટ શો શરૂ થયો.

આગણા ભાગમાં દોઢસો જેટલાં બાળકો, નાની નાની પરીઓ, કિશોર, ભૂલકાઓ બધાં જ આ જોવા બેઠાં ને જોવામાં એકદમ મશગૂલ. માધવી-ચકુડી બરાબર ચંગી હતી. ચંપકના વૃક્ષ બનવા સાથે બાળકોય સ્તરથી. થોડીક વાર પછીનું દશ્ય હતું. પત્ની પાણીનો લોટો વર્દીને વૃક્ષને પાણી પિવડાવવા આવે છે. અમે જ્યાં ભજવતા હતા તે સીમા, વાડ

હતી. પાછળ વિશાળ – ઘનધોર જંગલ. અમારાં બેગ, સામાન, પપેટ્સ પ્રોપર્ટી જંગલ તરફ. અચાનક પારુલ ને ઈલીજા, જગ્યા છોડી દોડતાં મારી પાસે આવ્યાં. સર... પાછળ દીપડો (કે ચિત્તો) હમ... હમ... હમના શિકારી સ્વરો જંગલના ઘનધોર પરિસરને ચીરતા હતા. નેચર-કેમ્પના સ્વયંસેવકોએ એ જગ્યાને કોઈન કરી, કોઈને પણ અવાજ ન કરવાની સૂચના આપી. બધું જ સ્તબ્ધ. સારેક મિનિટમાં બધું જ પાછું યથાવત્. દીપડો જંગલમાં સરી ગયો હતો. નદીનો બળખણ વહેવાનો અવાજ સંભળાવા લાગ્યો ને થોડી જ વારમાં ફીથી અમે શો શરૂ કર્યો. ડોક્ટર, ભૂવો, દાદાજી બધા જ ગતિમાન. અંત એકદમ પ્રભાવશાળી. લા. ડા.ના લેખનપ્રવાહ ‘છેલ્લો પંચ’ કાપી નાખો. ચકુડીનું રુદ્ધન ને કોદાળીના ઘાનો અવાજ. બાળકોમાં સન્નાંનો. એક વેરી અસર અમને બાળકો પર દેખાતી હતી. કેટલીક પ્રેક્ષકોમાં બેઠેલી ચકુડીઓ રડવા જેવી થઈ ગઈ.

૮૨-૮૩ની વાત છે. T.V. હજુ ઘરેઘર પહોંચ્યું નથી. નેચર-કેમ્પમાં મા-બાપથી દૂર જવાનો પણ કદાચ આ બાળકોનો પહેલો અનુભવ હતો? ભજવાતા-બોલાતા સંવાદો હૈયાસોસરવા. શો. પત્યા પછી અમે પરિચય માટે બહાર આવ્યા. બાળકોમાં એક સંવેદના પપેટ્સને સ્પર્શની જોવાની. પોતાના હાથમાં ચંપક-ચકુડી-દાદાજીને પામવાં હતાં. અમને આશ્રમ્ય હતું, આમાં જીવી રીતે આવી ગયો. પછી તો પોતાના હાથ જલવાં (પપેટ્સમાં) નામખતાં અમે બતાવ્યું. ને દીકરીઓ બોવવા મંડી.... ‘પણ્યા ઓ પણ્યા’. અમે અમને આ પ્રક્રિયામાંથી પસાર થવા દીધાં. ઠઠ વોઝ ફન્ટાસ્ટિક, વૃક્ષની અસરમાંથી હસાવવા, હલકાહુલકા કરવા. પછી અમે ‘અંધેર નગરી’ ભજયું. છોકરાઓ લોટપોટ, ગુરુચેલાને જોઈને, રાજાની મૂછનો તાવ ને ચંપાકલીનો મુજરો – ‘નજર લાગી રાજા, તોરે બંગલે પર’ જોતાં ટાબરિયાં ગબડી પડતાં, પારદર્શક પડા પાછળથી અમને દેખાતાં, વડોદરા ફાઠન-આદ્ર્સમાં ભણતા દર્પણના સુપ્રસિદ્ધ પેટીયર શ્રી મહેરબહેન કોન્ટ્રાક્ટરનો કેમ્પ એટેન્ડ કરેલો, ત્યારે મૂળ આ ભજવાયેલું. બાળકો ખુશખુશાલ. અમને પણ રંગત પરી ગયેલી.

‘વૃક્ષ’ ભજવણી તરીકે ઘણીબધી સર્જનાન્નક શક્યતાઓને વિસ્તારે છે. પપેટ્સમાં એ સાથે મર્યાદિત જગ્યાનાં, મર્યાદિત રીતે ભજવાય છે. ને બાળપ્રેક્ષકો સુધી પહોંચે છે. હાસ્ય, વિસ્મય, ભય, શોક, અનેક રસો એકસાથે જરે છે ને પછી એક હાઈટ પર આંખો ભીની કરે. ‘વૃક્ષ’ અનેક રીતે ભજવાયું. ‘વૃક્ષ’ અલગ અલગ રીતે ભજવાયું. પ્રથમ બાલભાઈ ઊભા રહ્યા, હાથ ઊંચા કરીને ત્યારે, પછી લા.ડા.એ. અનુભવ્યું અને લખ્યું. મારામાં જ્યારે ક્લેસભાઈ વૃક્ષ બનીને ઊભા રહ્યા ત્યારે, પછી અનેક હિંદુશર્ક-અભિનન્તાઓ દ્વારા અને અમે જંગલમાં ભજયું. માધવી જ્યારે સારયા વૃક્ષને સ્પર્શની રીહર્સલ કરતી હતી. રાત્રે ભજવાયા પછી બાળકોએ પોતાના હાથ જલવાં નાખી અનુભવ્યું, આ તો માત્ર મારી જ વાત કરી – જગત સમસ્તમાં વૃક્ષને ય ક્યાં ખબર છે, કે એ કેટલી વાર ભજવાય છે. આ વૈશ્વિક સંવેદનાની અભિવ્યક્તિ.

નેચર-કેમ્પમાં અમે કુલ ચાર શો કર્યા. પછી માત્ર એકાદ વાર સુરતમાં – પછી અમે બધાં કલાકારો વિભેદયાં અને અમારા જંગલમાં ખોવાયાં. આજે માધવીને બે ચકુડીઓ છે, ઈલીજાને એક, પારુલને બે દીકરા, પ્રશાને એક દીકરા, બિંદુને પણ દીકરા, શંકરભાઈ બેંકમાંથી રિયાયર થઈને નિવૃત્તિ જીવન કાઢે છે. નીતા ઓફિસેથી આવીને અમારી ચકુડી

સાથે ઊભી રહી રોળટપ્પા કરી, સાંજનું રંધી છે, દાદાજીનો રોલ ભજવનારો હું આરસીમાં નજર દીકરી, મારી દાદી કે માથાના સર્જેન થતા વાળ પર હાથ પસવારું છું, મારા સ્ટુડિયોમાં અલેર્ચાઈ પર પતરાની બેગમાં અંદર દાદાજી, ચકુડી, ચંપક સૂતાં છે, ધીમા ધીમા ચાસ લેતાં સૂતાં છે. વરસાદ... ગળતી જગ્યાએથી બેગ પવણે નહીં માટે ખસેડું છું.

કેમ્પમાં તે વખતે મેં સ્કેચબુક મારી સાથે રાખી હતી ને સવાર-સાંજ સમય મળતાં, વધઈના જંગલમાં સ્કેચ કરતો, વધઈ, વાંસદાના ટર્નિંગ પોઇન્ટ પર હું રોડનો લાંબો પસ્પેટ્ઝિટ વ્યૂ લઈને સ્કેચ કરું છું. જે તે મહલ-કેમ્પની મુલાકાતે આવેલા વાંસદાના મહારાજાને બતાવું છું તેઓ એકદમ સ્મૃતિમાં સરી પડે છે. તેઓ સ્કેચબુકની મધ્યમાં ચીતરેલા વૃક્ષને જોતાં કહે છે એક જમાનામાં મેં અહીંયાં વાધનો શિકાર કરેલો. એ જગ્યા મને તમારા સ્કેચમાં બરાબર દેખાય છે. તમે પાછા આવો... હું તમને જંગલની બીજી સરસ જગ્યા બતાવીશ. પરંતુ as usual હું ક્યારેય જઈ શકતો નથી.

વર્ષો પછી મારાં પપેટ્સ શ્રેષ્ઠીના ચિત્રોમાંથી એક ચિત્ર બનાવ્યું ‘Tiger in the jungle’. પપેટ શો દરમિયાન અધવચ્ચે ટપકી પડેલો વાધ – (દીપડો-ચિત્તો, જે હોય તે) મને પ્રેરિત કરી ગયો. તે સમયનો ‘ભય’ શિકાર, નૃત્ય, જંગલ... બીજું ઘણું મને અસર કરી ગયું. આજે એ ચિત્રથી મને વધઈનું જંગલ યાદ આવે છે. ચિત્રકાર તરીકે મારા કરેલા સ્કેચનું રૂપાંતર કરું છું, પપેટીયર તરીકે ‘વૃક્ષ’ ભજવું છું. જંગલમાં નોંધું છું. પપેટ્સને ક્યાં પોતાની ગંધ હોય છે કે નથી હોતો પોતાનો પરસેવો, નથી હોતાં પોતાનાં આંસુ. એના તો ચાસ પણ ઉધીના હોય છે, રખે છે જંગલ-જંગલ, સ્ટેશન-સ્ટેશન.

...યની રાહ જોઉં છું, નવો પપેટીયર આવે ને મારી પતરાની બેગ ખોલે અને જેલ



મ તો આ તો એક માણસના વૃક્ષ થવાની ખબર છે.

r

### કોશ

(૨૪૮) ગુજરાતી સાહિત્યકાર કોશ : સંપા. કિરીટ શુક્લ, ૨૦૦૮, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પૃ. ૮૪૦૮,

ર. ૨૫/- (૨૪૯) ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ : સંપા. કિરીટ શુક્લ, દ્વિતીય સંવાર્ષિત, ૨૦૦૮, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પૃ. ૬૪૦૭૫૮, ર. ૨૪૦/-

### આભ્યાસ

(૨૫૦) આભૂતગ્રંથ : ડૉ. નલિન પંડ્યા, ૨૦૦૮, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પૃ. ૮૫૫, ર. ૭૦/-

### ‘બારણો ટકોરા’ અને ‘મંકીળ પાવ’ – તુલનાદિષ્ટિએ | વિજય શાસ્ત્રી

ઉમાશંકરના ઈ. ૧૮૭૮માં પ્રગટ થયેલા એકંકીસંગહમાં ‘બારણો ટકોરા’ ગ્રંથથ્ય થયું છે એટલે તે પહેલાં રચાયું છે. એકંકીના પ્રારંભે મૂકાયેલી રંગમંચના દશયાનું વર્ણન કરતી વિગતો ગરીબ બ્રાહ્મણકુટુંબનું સૂચન કરે છે. નંદુ ગોરાણીના પતિ પરબુ ગોર અવસાન પામયા છે તેનું સૂચન નંદુ ગોરાણીએ કાળો સાડલો ઓઢેલો છે. મુંડાવેલું માથું અને આભૂષણ વિનાનો વેશ’ એ વીગતોથી થાય છે. તેમની ઉમર ચાણીસની અંદર છે છતાં બહુ ઘરડાં લાગે છે તેનું કારણ પતિના મરણનો આધાત છે. નંદુ ગોરાણીની માનસિક સ્થિતિ અસાધારણ બની ગઈ છે. સ્વસ્થતા લગભગ જુમાવી દીધી છે. ઉંઘે તો ઉંઘ્યા. જ કરે, સમયનું કશું ભાન રહેતું નથી. ચંચળ, જે કદાચ પડોશણ છે તે આવીને નંદુ ગોરાણીને જગાડ છે ત્યારે નંદુ ગોરાણી બોલે છે ‘તે આ તમે ન આવ્યાં હોત તો કોણ જાણો ક્યારે જાગત ! (નિસાસો મૂકીને) મારે તો દ્વિવસ ને રાત બધું એકાકાર થઈ ગયું છે.’<sup>૧</sup> નંદુ ગોરાણીની છીકણીની ડ્રી લેવા સહેજ ઉંચા થતાં પણ હંફ ચરી જાય છે એ જોઈ ચંચળ બોલે છે કે ‘જરી હંફ તો બેસવા દો’<sup>૨</sup> તે સાંભળી નંદુ ગોરાણી બોલે છે કે –

‘દા’ડામાં દોઢસો વાર ખડકી ઉઘાડવા જરું પડે. જરી પૂઠ વાળી કે કો’ક ને કો’ક આવીને ઊનું સ્તો !’<sup>૩</sup>

અહીં, આ વાક્ય સાંભળી ચંચળથી ઉકારો થઈ જાય છે. નાટકમાં અને ખાસ તો લઘુકંદ એકંકીમાં ઉકારો પણ કેટલો મહત્વનો બને છે તે ધ્યાનમાં લેવા જરું છે કેમ કે મહેમાનોની સતત થથી રહેતી અવરજવરથી ત્રાસી અને કંટાળી ગયેલી નંદુ ફરિયાદ જેનો સામે કરે છે એ ચંચળ પણ એક આગંતુક જ છે એટલે ચંચળને એમ લાગે છે કે નંદુ ગોરાણી આ બહાને મને જ સાંભળાવે છે. એટલે તેનાથી ઉકારો થઈ જાય છે. ચંચળનો ઉકારો સાંભળીને નંદુ ગોરાણી સમજ જાય છે કે તેને મારું લાગ્યું છે એટલે તરત જ બોલી ઉઠે છે કે – ‘જોઝો, બુન તમારા પર નથી.’<sup>૪</sup>

પણ ચંચળની રીસ અમે ઊતરે એવી નથી. અને માટે એકંકીકરે પ્રારંભમાં એક જ વાક્યમાં આપેલી ઓળખ યથાર્થ લાગે છે કે ‘ચંચળ ઘડાઈ ગયેલી બાઈ જણાય છે.’<sup>૫</sup> થોડી નાટકીયાણ પણ છે એટલે નંદુ ગોરાણીના આગંતુકોથી કંટાળી ગઈ હોવાનું જણાવતા ઉદ્ગારથી બહુ જ દુઃખ થયું હોય તેમ સાડલાના છેદાથી નાક લૂછે છે ને જાણો નંદુને લાગણીને લીધી મળવા આવી હોય તેમ ‘મારા મનમાં કે આજ ઘણા દનથી નંદુ ગોરાણીને મળી નથી તે મલતી આવું’ આ વાક્ય તેના આગમનને લાગણીપ્રેરિત ગણાવવા તે બોલે છે પણ તરત જ બીજું વાક્ય બોલે છે કે ‘પેલા પૂનમભાઈનો લોટો તમારે ત્યાં રહી ગયો છે ને ? – તે ઈયાંનો સંદેશો આવ્યો છે કે લેઈ આવજો તે મેં કુ લેતી આવું.’<sup>૬</sup> તેના આગમન પાછળાનું વ્યવહારિક પ્રયોજન વ્યક્ત કરે છે. બીજું વાક્ય પહેલા વાક્યનો છેદ ઉઠાડે છે. તેને પૂનમભાઈના લોયાની ફિકર છે પણ જાણો કર્દી પરવા ન હોય તેમ ‘ઈયાંનો સંદેશો

આવ્યો છે કે લેઈ આવજો’ પૂનમભાઈના કહેવાથી લોટો લેવા આવી હોવાનું નાટક કરે છે. નંદુ ગોરાણી કદાચ આ ચંચળને સારી રીતે ઓળખે છે. નંદુના મનમાં એવી પણ શંકા છે કે પૂનમભાઈના નામે લોટો ઉપાડી જઈ આ ચંચળ પોતે જ પચાવી તો નહીં પાડે ! નંદુ ગોરાણીનું પાત્ર ઉમાશંકરે કંઈક આખાબોલી સ્પીનું આવેખ્યું છે તે સામિપ્રાય લાગે છે. એક તો પતિના મરણનો આધાત, તજજન્ય ગરીબાઈ, શારીરિક અસ્વસ્થતા વગેરે કારણોના પરિણામે નંદુની વાંશી થોડી વક, આખાબોલી અને કંડુ બની ગઈ છે. આ જ પૂનમયંદ, પતિ પરબુ ગોરની હ્યાતીમાં આ ઘરમાં મહિનોમાસ રહી ગયો હતો અને ચંચળ કહે છે ‘મહિના લગણ તમારું ઘર ઝોલી ખાઈ જાય ને એક ટોયલી ખાતર મન બગાડે’ તેવો છે. એકંકીમાં ચંચળનું પાત્ર આમ, નંદુ ગોરાણીની બળતરા, વેદના વ્યક્ત થાય તે માટે જરૂરી બને છે. પૂનમભાઈના લોયાની વાતથી પ્રારંભાતી પરબુ ગોરની હ્યાતી દરમિયાનની ભૂતકણની વિગતો એક તરફ પરબુ ગોરની ઉદારતાનો તો બીજી તરફ એ ઉદારતાનો ગેરવાભ લેનારા લોકોનો સિલસિલાંધ આવેખ (અં. ગ્રાફ) દોરી આપે છે. જેની મુખ્ય વિગતો આ પ્રમાણે અપાઈ છે –

“મારી બાઈ, પણ પેલા મફનજી – અમારે નાવાનીય સગાઈ નહિ ને ‘મારા ગોરજાનું ઘર’ કરતા આયા. આયા ત્યાં લગણ તો કંદું ઠીક છે, પણ સવારે અંધારે અંધારે ઘેર જવા નીકળ્યા ને ઈયાંના હજાર થીગડાંવાળા કોટને બદલે મારા જંયતીનો નવો નોક પહેરીને થયા હીડતા તે આવજે ઘર હૂંકું ! કોણ પગેનું કાઢવા નવરું બેહુંતું.’’<sup>૭</sup>

“ને પેલો જગન્નાથ, હરિને લઈને મુખ્ય જતો’તો, તે અહીં રાતવાસો રહેલો ! સવારના મુખ્યાઈ જવાના કોડમાં બાઈજી કપડાંની પોટલી ભૂલી જ્યાં, પાછળથી તાર કર્યો કે પારસલથી પોટલી મોકલી આપજો. તે... બાઈ ઈને તો અંગાણે રૂપિયાનું ઝડ વાંદું હોય પણ મારે આ મેમાનગીરી ને ઉપરની દખણા કયાંથી આવતી ?”<sup>૮</sup>

નંદુ ગોરાણીને મુખે બોલાતા આ બે સંવાદોની કેટલીક લાક્ષણિકતાનો છે. એક તો એ કે એમાં સ્ત્રીચરિત્ર સૈણ સ્વભાવ પ્રગટ થાય છે. ઘર અને વરની પ્રતિષ્ઠાનાં ગુણગાન કરવાં એ ગૃહિણીનો સ્વભાવ છે. એક વિધવાના ભવ્ય ભૂતકણનું વર્ણન બે સ્તરે ચાલે છે. એક તો તે ભૂતકણની ભવ્યતા પ્રગટાવે છે અને બીજું વર્તમાનની નંદુ ગોરાણીના વૈધ્યની વેદના પણ પ્રગટાવે છે. અનેક મહેમાનોની અવરજવરના સ્મરણમાં કંઈક ગર્વ ભળેલો છે તો વર્તમાનમાં એ અભરે ભરી સૂચિનો અભાવ વેદના પ્રગટાવે છે. ભૂતકણની ભવ્યતા વર્તમાનની વેદનાની સમાંતરે ચાલે છે અને એટલે વર્તમાનની વેદનાને ઘાર પણ કાઢી આપે છે. ભૂત-વર્તમાનનાં વર્તુલોનું પરસ્પર છેદન – configuration આ એકંકીની અને નંદુ ગોરાણીના પત્રવિધાનની ટેકનિક તરીકે ધ્યાનમાં લેવાવી જરૂરી છે. Juxtaposition એટલે કે સનિવિકરણની આધુનિક યુગમાં આંગે ચારેલી પ્રયુક્તિ આધુનિક પૂર્વના ગંધીયુગમાં પણ આમ પ્રયોગાઈ ચૂકી હતી, તે તરફ સુશોનું ધ્યાન જવું જોઈએ.

આ જોતાં આ એકંકીના નંદુ ગોરાણીના ભૂત અને વર્તમાનના નોંધી શકાય એવો તસ્કવત ધરાવતા ચરિત્ર માટે જવાબદાર છે પરબુ ગોરના અવસાનની ઘટના. ભરતે મૃત્યુનું દશ રંગભૂમિ પર પ્રત્યક્ષ દર્શાવવાનો નિષેધ ફરમાયો છે પણ પરોક્ષ રીતે આ આંગું એકંકી પરબુ ગોરના મૃત્યુની ઘટના પર નિર્ભર છે. નંદુ ગોરની હ્યાતી એક જબરદસ્ત

Phenomena હતી. એમની હાજરીમાં કોઈ આવતુંજતું તે જગતાતું નહીં. પતિની હ્યાતી દરમિયાન નંદુ ગોરાણીને મહેમાનોની અવરજવરમાં થતું ખર્ચ કે ઉઠવેઠ જગતાતું નથી. પરભુ ગોરની હ્યાતી અને બિનહ્યાતીની સ્થિતિનાં ચિત્રો પણ ફરી એક વાર સંનિવિકરણની પ્રયુક્તિથી આવેખાયાં હોવાથી તરંતર્ગત Contrastથી તીવ્ર વેદનક્ષમ બન્યાં છે.

બે સ્ત્રીઓની વાતચીત દરમિયાન ભૂતકાળની એક એવી ઘટનાનું સ્મરણ નંદુ ગોરાણીના મુખે વર્ણવાયું છે કે ઘટના નાટકની પરાકાષ્ઠ બનતી અંતિમ ઘટનાના આરંભબિંદુ જેવી છે. નંદુ ગોરાણીના મુખે જ જોઈએ :

**નંદુ :** મેં એક દન સરાવણની મેઘલી રાતે એક વાટમારગુને બારણે આ'કારો નો દીધો ત્યારે એ મને વઢ્યા નહિ, પણ તાં જઈને મોટેથી ઈને સાંદ કર્યો. જમજમ વરસાદાં સાંભળ્યામાં ન આવ્યું કે શું પણ વીલે મોટે એ પાછા આયા : ને મને કહે કે તારે છે તે મારી આ આંખ્યો મીચાઈ જાય, તે હું કો'ક રંકને પેટ પડું ને કો'ક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડે ને ?

અહીં જમજમ વરસાદાં પડવાની ઘટનાને નાટ્યવિકાસ માટે કામે લગાડી છે. ભારે વરસાદને કારણે થતા ભારે અવાજને કારણે પરભુ ગોરની બૂમ આગંતુક સાંભળી શકતો નથી અને પરભુ ગોર 'વીલે મોટે' પાછા ફરે છે. જો વરસાદ ભારે ન હોત તો જે બન્યું છે તે કદાચ ન બન્યું હોત. એ જોતાં વરસાદી જોર જેવી આકસ્મિક અને નાનકડી ઘટનાને પણ ઉમાશકરે નાટ્યપ્રયોજન માટે વેખે લગાડી છે તેની નોંધ લેવી જોઈએ.

વળી પરભુ ગોરના 'હું કો'ક રંકને પેટ પડું ને કો'ક દી બારણું ઠોકું તો તું તો નો જ ઉઘાડે ને ? શબ્દો ભૂતકાળમાં જ્યારે બોલાયા ત્યારે બોલનાર પાત્રને અને સાંભળનાર (અન્ય પાત્ર અને પ્રેક્ષક)ને ખબર નથી કે ભવિષ્યમાં તે સાચા પડવાના છે (- પડે છે) એ જોતાં એક સમર્થ નાટ્યાત્મક વકીઝિત પણ બની રહે છે.

નંદુ ગોરાણીનું પાત્ર આ એકંકીનું ચાલક પાત્ર છે. તેને એક ભવમાં બે ભવ જોવાના થયા છે. પતિની હ્યાતી દરમિયાનની જહોજલાલી અને પતિના મરણ પછીની કારમી ગરીબી. વળી જહોજલાલી દરમિયાન પણ નંદુ ગોરાણીના સ્વભાવની કૃપણતા અવારનવાર પ્રગટ થતી રહી હોય તો ગરીબીની અવસ્થામાં તો તે પૂરેપૂરી પ્રગટી ઉઠે એ પણ સાવ સ્વાભાવિક છે. વળી ગોરાણી પોતાના સ્વભાવને ઓળખે છે 'મોઈનો મારો શભાવ જ આકરો' જેવા શબ્દો આ સંદર્ભે જોઈ શકાય. પોતે પતિને પગલે-પગલે ચાલી નથી શકતી તેનાથી પણ તે સાબાન છે અને તેથી મરનાર પતિના આત્માને દુઃખ થતું હશે એમ પણ એ કલ્પી શકે છે. ગોરાણીના શબ્દો....

'આજ દસ મહિનાથી શમશામાં એ આવે છે; એ વીલું મોહું ને હળવો ઠપકો ! ઈયાંનો જીવ મારે લીધે ઊંચો રહેતો લાગે છે !'

નંદુ ગોરાણીની આ ઉક્તિ બાદ તરત જ એક જુવાન મહેમાન આવે છે ને જ્યંતી વિશે પૃથ્ખા કરે છે ત્યારે એને જ્યંતી ઘરમાં નથી, ક્યારે આવશે એનો ભરોસો નથી વગેરે જવાબ આપી વિદ્યાય કરી દે છે. આ ઘટનાના બે સ્વીચ્છાર્થી થઈ શકે. એક તો નંદુ ગોરાણીનો કૃપણ સ્વભાવ બદલાયો નથી અને બીજું, હજુ પણ આગંતુકો પરભુ ગોરનું ઘર શોધતા આવે છે - જે એકંકીના અંતભાગે પદ્ધારતા આગંતુકની ઘટનાને પ્રતીતિકર, (એકાએક

બનતી નહીં) બનાવે છે.

ચંચળની વિદ્યાય સાથે નંદુ ગોરાણીના નાના દીકરા બટનું આગમન થાય છે. નંદુ ગોરાણીના બે દીકરાઓમાંથી મોટો જ્યંતી બાપના જેવો ઉદાર છે અને નાનો બટુ મા જેવો કૃપણ છે. મહેમાનોની અવરજવરથી બટુના અભ્યાસમાં ખાસ્સી ખલેલ પહોંચે છે. માદીકરાના ઠીકઠીક દીર્ઘ એવા સંવાદોનું પ્રયોજન, નંદુ ગોરાણીની કૃપણતા વધુ ને વધુ ધૂંધાય, એ છે. એમાં અધૂરામાં પૂરું મોટો જ્યંતી, થોડી વાર પહેલાં નંદુ ગોરાણીએ જેને જાકારો આપેલો એ જ મુગટવાલાને સામે ચાલીને વેર તેડી લાવે છે એ ઘટના પણ નંદુ ગોરાણીના આકોશને વધુ વળ ચાલે છે ને તેમાં નીજું પરિબળ રસમાં નાખવાની ખાંડ ખૂટી જાય તે ઉમેરાય છે. ઘરના છોકરાને ખાંડ આપી શકતી નથી અનો વલોપાત બિચારાં છોકરાને કોઈ સખે ખાવાય દેતું નથી.'<sup>10</sup> એ નંદુ ગોરાણીના શબ્દોમાં બ્યક્ત થાય છે. આ અત્યંત સ્ટોટ કાણે જ બારણે ફરી ટકોરા પડે છે. બારણે ટકોરા પડવાનું timing મહત્વાનું છે. સંવેદનાની તીવ્ર ક્ષણોમાં વળી એક મહેમાનનું આગમન સૂચવતા ટકોરા પડે તેથી નંદુ ગોરાણી ઉશ્કેરાતમાં આવી જાય અને -

'ભાઈ, આ નહિ ! ચોથે બારણે ધરમશાળા છે. ધરમશાળામાં જાઓને પગ ભાંગી ગયા છે !'<sup>11</sup>

નંદુ ગોરાણીના આ શબ્દો તેની વ્યથાની પરાકાષ્ઠમાંથી નીપજ્યા છે. તેનો આરંભ ચંચળના આગમનથી થયો છે, વર્તમાનની ગરીબી, ભૂતકાળની જહોજલાલી, શારીરિક અસ્વસ્થતા, બટુના અભ્યાસની મુશ્કેલી, જ્યંતીની પિતાસદશ ઉદારતા, ખાંડનું ખૂટી જવું એ બધી જ ગતિવિષયોમાં પસાર થઈ, નિર્વહણ પામતી નંદુ ગોરાણીને મુખે છેવટે આ શબ્દો નીપજે છે ત્યારે અનેક ઘટનાકમને વીધીને તે આવે છે. ગોરાણીના શબ્દો ભૌતિક રીતે ભવે અંતે આવે છે પણ તેનો બીજનિક્ષેપ એકંકીના આરંભે જ થઈ ચૂક્યો છે. હું આને climax ગણું છું તો છેલ્લી ઘટનાને anticlimax. બારણે પડતા ટકોરા બંધ થઈ જાય ને નંદુ ગોરાણી છુટકારાનો દમ ખેંચે પછી નંદુ ગોરાણી ખડકી ઉઘાડે છે. આ ખડકી ઉઘાડવાની ઘટના સ્લીસહજ કુતૂહલનું પરિણામ છે. સાવ સ્વાભાવિક છે પણ એકંકીના અંતિમધાન માટે ખૂબ જ વજનદાર બની રહે છે. જો નંદુ ગોરાણી ખડકી ખોલ્યા વિના જ ઘરમાં પાણી ચાલી ગયાં હોત તો એકંકીનો અંત જે અને જેવો છે તે અને તેવો આણી શકાયો હોત નહીં. ખડકી ખોલતાં જ ગોરાણીને, પાછા ચાલી જતા મહેમાનની આધીપાતણી આકૃતિ અંધારામાં દેખાય છે... 'એ જ પાછારી, પેલો લીલો ખેસ ને બટુ વિશંબરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો !'

અને બહુ સ્પષ્ટતા કરવા પૂછે છે -

'કોના હાથમાં, મારા બાપના...?'

દેખીતું છે કે દિવંગત થઈ ચૂકેલા પરભુ ગોર વાસ્તવિક રીતે તો નથી જ પણ નંદુ ગોરાણીની જે માનસિકતા આવેખાઈ છે તે સંદર્ભે તેને માટે તે વાસ્તવિક છે. પતિના શબ્દો 'હું કો'ક રંકને પેટ પડું ને કો'ક દી બારણું ઠોકું તો તું નો જ ઉઘાડે ને' નંદુના મનમગજનો કબજો લઈ બેઠા છે. આગંતુકોની આગતાસ્વાગતા ન કરી શકવામાં નંદુ ગોરાણીને તેનો સ્વભાવ વતા ગરીબી એમ બે બાબતો રોકે છે. તેનામાં આ કારણે અપરાધગ્રાન્ય પણ

દઢ બની ચૂકી છે. અને સ્વભાવગત પરાકાણા સાથે જ અપરાધભાવની પણ પરાકાણા સિદ્ધ થાય છે. આમ બે પરિબળોને સમાંતરે વિકસાવાયાં છે. ‘એ જતા રહ્યા છેવટે મારે પાપે’માં પ્રાયશ્ચિત્ત પણ છે, આત્મભર્તના પણ છે. વાસ્તવિક ઘટનાઓના સમુચ્યયમાંથી છેવટે નંદુ ગોરાણીના તૈતસિક પ્રવર્તનની વાસ્તવિકતાથી પર થતી ઘટનામાં ઉમાશંકર એકંકીનું નિર્વહણ કરી શક્યા છે એ આ ફુતિને સફણ અને સમર્થ એકંકી તરીકે સ્થાપે છે.

તળપદા શબ્દો, સામગ્રીઓ પણ વાતાવરણને ધૂટે છે.

‘The Monkey’s Paw’ W. W. Jacobsનું વિશ્વપ્રસિદ્ધ એકંકી છે. ૧૮૬ ઉના વર્ષમાં ૮ સાટેમ્બરે જન્મેલા જેકબ્સનું નિધન પણ સાટેમ્બરમાં ૪ પહેલી તારીખે થયું, વર્ષ : ૧૯૪૩. માનવીય સંબંધોના સૂક્ષ્મતાસૂક્ષ્મ આકલન કરનારા લેખક તરીકે જેકબ્સની પ્રતિષ્ઠા છે. ‘ધ લેડી ઓફ ધ બાર્જ’, ‘ડીપ વોટર્સ’, ‘ધ ગ્રે પેરોટ’, ‘ધ ઘોસ્ટ ઓફ જેરી બન્ડલર’ ‘અ લવ પેસેજ’, ‘અબલ ડીલિંગ’ વગેરે એમની જાણીતી નાટ્યરચનાઓ છે. પણ તેમની યશોદા કૃતિ તો છે ‘ધ મંડિઝ પાવ’. આ નાટક ૧૯૦૨માં એક કર્ટન રેઝિઝર તરીકે ભજવાયું પણ તેની અસર પ્રેક્ષકો પર એવી ગજબની થઈ કે તે જોયા પછી પ્રેક્ષકો મુખ્ય નાટક જોયા વગર જ સભાગૃહ છોડી ચાલતા થયા.

દરેક સમાજમાં શુક્ન-અપશુક્ન અંગે કેટલીક માન્યતાઓ પ્રવર્તતી હોય છે. ભણેવા અને શહેરી સમાજમાં પણ આવી માન્યતાઓ ઉથાપવાની હિંમત કોઈ ભાગ્યે જ કરતું હોય ત્યારે અર્ધશિક્ષિત એવા તળપદ, ગ્રામ સમાજમાં આવી માન્યતાઓ વધુ પ્રબળ હોય એ સ્વભાવિક છે. આ એકંકીમાં પણ આવી જ એક માન્યતા કેન્દ્રસ્થાને છે અને તે ગ્રામસમાજના એક કુટુંબમાં બનતી ઘટના સાથે સંકળાય છે તેથી પ્રતીતિકર પણ બને છે. ‘સાપના ભારા’નું નંદુ ગોરાણીનું પાત્ર પણ ગમડાગમની અશિક્ષિત નારીનું જ છે તેથી બારણે ટકોરા પડવાની પ્રમુખ ઘટના ત્યાં પણ સહજ બની રહે છે. આમ નાટ્યપરિવેશ ‘લોહાલ’ બંને ફુતિઓની ભૌય છે એની નોંધ લેવી જોઈએ.

નાટકના પ્રારંભે મિસ્ટર વાહાઈટ તેનાં દીકરા હર્બિટ સાથે શેતરંજ રમતો બતાવાયો છે અને મિસ્સિસ વાહાઈટ બંનેને રમતાં નિહાળતી બેઠી છે એ દરમિયાન ચાલતા સંવાદોમાંથી કેટલીક અગત્યની માહિતીઓ પ્રેક્ષકોને મળતી રહે છે જે મુજબ મિસ્ટર વાહાઈટ સૂમસામ સ્થળે ઘર બનાવ્યું છે અને તે માટે બસો પાઉન્ડનું દેવું ચૂકવવાનું હજુ બાકી છે. હર્બિટ કુવારો છે. તેનાં લગ્નના બર્ધની ચિંતા પણ માબાપને સતતો છે. મિસ્ટર વાહાઈટ તેના મિત્ર લેફ્ટેનાન્ટ મોરિસના આવવાની રાહ જુઓ છે. બહાર વાવાઝોંદું ફૂકાય છે અને વીજળીના જબકારા હડાકાભડાકા સાથે થાય છે ત્યાં બારણે ટકોરા પડે છે ત્યારે મિસ્સિસ વાહાઈથી સ્ટોપર જટ ખૂલતી નથી એ નાનકરી ઘટના નાટકના અંતે ખૂબ વજનદાર બની રહે છે. બહારનું કુદરતી તોણન અને બારણાની સ્ટોપર જટ ન ખૂલવાની બે વિગતો પ્રેક્ષકે ધ્યાનમાં ચાખવી રહી. ફૂકાતા વાવાઝોડામાં બારણે ટકોરા પડે છે અને મિસ્ટર વાહાઈના મિત્ર મિસ્ટર સાર્જન મેજર મોરિસ ઘરમાં પ્રવેશે છે. એકંકીના પ્રારંભે જુદાં જુદાં પાત્રો દ્વારા થતા કબ્રસ્તાન (cemetery) અને મૃતદેહના ઉત્ખેખો પણ પ્રેક્ષકોએ ધ્યાનમાં રાખવાના છે. વૃદ્ધ દંપતીનો એકમાત્ર પુત્ર હર્બિટ ઈજનેર છે અને વૈજ્ઞાનિક બુદ્ધિ ધરાવે છે. ચમત્કાર, જાદુ વગેરેને ધર્તિનું

માને છે પણ તેના બાપ અને બાપના દોસ્ત મોરિસ જુના જમાનાના દેશી માણસો છે અને ચમત્કાર વગેરેમાં માને છે, શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પણ તેઓ એમાં માને છે. મોરિસ, એક નજરે જોયેલો હિસ્સો પણ કહી સંભળાવે છે કે ‘એક વાર એક ફીરી હવામાં દીર્ઘ ઉછાળ્યું અને જાણે કોઈ હૂકમાં ભેરવી દીધું હોય એમ લાકડી જેવું સીધુંસટ થઈ ગયું એને પકડીને એ ફીરી ઉપર ચારી ગયો અને હવામાં ઓગળી ગયો’ આ સાંભળીને મિસ્ટર વાહાઈટ વાંદરાના પંજાની વાત કહેવાનો આગ્રહ કરે છે પણ તેનો આવો આગ્રહ બનાવઠી છે તે આ વાક્ય બોલાયા પછી... ‘He nudges Herbert and winks at Mrs. White’<sup>12</sup> (હર્બિટને ચૂપ રહેવાનો ઈશારો કરે છે અને મિસ્સિસ વાહાઈટ તરફ આંખ મીંચકારે છે) એ ચેષ્ટા પરથી સમજાય છે.

મોરિસઅંકલ પોતાના ખીસામાંથી સૂક્ષ્મ ગયેલો વાંદરાનો પંજો કાઢીને બતાવે છે એ જોઈને ત્રણો જણાં છળી ઊઠે છે. પંજાનો ઈતિહાસ મોરિસઅંકલ આ રીતે વણવે છે કે –

એક જુદ્દો ફીરી એક જ જ્યાએ પંદર-પંદર વર્ષ સુધી ચીટકી રહીને તપશ્યર્યા કરતો રહ્યો. તેના મતે નસીબ સૌથી મોટી વસ્તુ છે. (He wanted to show that fate ruled people.)<sup>13</sup> આ ફીરી વાંદરાના પંજામાં મંત્ર ફૂક્યો હતો જે મુજબ ત્રણ વ્યક્તિઓ પોતાની કોઈ પણ ઈચ્છાઓ આ વાંદરાના પંજ વડે પૂરી કરી શકે છે. (He put a spell on it and made it so that three people could each have three wishes.)<sup>14</sup>

આ કહેતી વખતે મોરિસઅંકલ સામે બેઠેલાં ત્રણો તરફ સૂચક નજરે જુદે છે. આગળ બોલે છે કે ‘ત્રણ જણાની ત્રણ ઈચ્છાઓ પૂરી તો થશે પણ પૂરી થયા બાદ ત્રણો પસ્તાશે કે મેં ક્યાં વળી આવી ઈચ્છા કરી? ઈચ્છા ન કરી હોત તો સારું થાત.’ સાર્જન મોરિસે પણ આ પંજાનો પરચો મેળવી લીધો છે પણ તે એટલો ભયાનક છે (પરચો જણાવાયો નથી) કે હેવ તે પંજાને બાળી નાખવા સગડીમાં નાખે છે. મિસ્ટર વાહાઈટ તેને તેમ કરતાં અટકાવે છે અને કહે છે કે ‘If you don’t want it, give it to me.’<sup>15</sup> આ પંજાનો જોઈવિચારીને ઉપયોગ કરવાની ભારપૂરક ચેતવણી આપીને મોરિસ વિદ્યાય થાય છે પણ આ ત્રણોને પંજામાં તેમજ મોરિસની વાતોમાં જાહેર નથી. તેઓ આખી વાતને હળવાશથી લે છે. અને ઘરની ક્રિમત પેટે જે ૨૦૦ પાઉન્ડનું દેવું છે તે આનાથી ચૂકવી દેવાશે એવી મજાકો સુધ્યાં કરે છે. દરમિયાનમાં દીકરો હર્બિટ પણ નોકરીએ ચાલી જાય છે. સવારે, હર્બિટ નોકરીએથી ઘર પાછો આવે તે પહેલાં સેમ્પ્રસન નામનો એક વકીલ ખચકાતો-અચકાતો મિસ્ટર વાહાઈટને ત્યાં બારણે ટકોરા મારે છે. તેના આગમનનું કારણ એવું છે કે તે તરત સ્વસ્થપણે કહી શકતો નથી ત્યાં એક સરસ નાટ્યાત્મક વકોક્તિ પ્રયોજાઈ છે.

સેમ્પ્રસન અચકાતો-અચકાતો કહે છે....

I have come...

પણ એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ મિસ્ટર વાહાઈટ બોલી ઊઠે છે કે –

‘Perhaps you was wishful to see Herbert; he’ll be home in a minute.’<sup>16</sup>

વકીલ એ છે કે સેમ્પ્રસન હર્બિટના મરણના સમાચાર આપવા આવ્યો છે. હર્બિટ સાથી કર્મચારીઓ સાથે હળવાશના સૂરમાં વાત કરતાં મશીનમાં ફસાઈને મૃત્યુ પાખ્યો

છે અને કંપનીએ, પોતાની જવાબદારી ન હોવા છતાં, સહાનુભૂતિ પેટે ૨૦૦ પાઉન્ડ સહાય રૂપે મંજૂર કર્યા છે એ વાત આગળ એકંકીનો પ્રવેશ બીજો પૂરો થાય છે.

જોઈ શકારો કે ત્રણમાંની એક ઈચ્છા (૨૦૦ પાઉન્ડની) પૂરી થઈ છે પણ તે કોઈ ચમત્કાર રૂપે નહિ, સહજ રીતે.

એકંકીના ગીજ અને અંતિમ પ્રવેશમાં પુત્રવિયોગની વથામાં ઝૂરતાં માબાપના સંવાદો મુકાયા છે. બંને પાત્રો પોતપોતાની રીતે દીકરાને ધાદ કરી દુઃખી થાય છે ત્યાં જ એકાએક મિસિસ વ્હાઇટને વાંદરાનો પંજો ધાદ આવે છે ને હજુ બે ઈચ્છા પૂરી કરવી બાકી છે તો દીકરાને સજીવન કરવાની ઈચ્છા કરી લઈએ. પત્નીની આવી ઈચ્છાને અનુમોદન આપવાને બદલે પતિ તેનો વિરોધ કરે છે કે -

'Good God ! Are you mad ?'<sup>૧૫</sup>

ત્યારે તેનો પતિ કહે છે કે -

'Was'nt that enough ?'<sup>૧૬</sup>

એક ઈચ્છા પૂરી થઈ રેણે કેવી વિતાડી તે શું નથી જાણતી કે બીજી ઈચ્છા રાખે છે ? પણ પત્ની માનતી નથી તેમાં તેનો અપત્યપ્રેમ પ્રગટે છે. પણ બાપને તેના દીકરાના અંતિમ દર્શનની ક્ષણો આંખ સામે તરવરે છે જેમાં એટલી ખરાબ રીતે દીકરાનો મૂત્રદેહ નંદવાઈ ગયો હતો કે ફક્ત કપડાં પરથી ઓળખવો પડ્યો. આ સ્થિતિમાં પંજાના પ્રતાપે દીકરો સજીવન થઈને આવે તો શી દરા થાય એ વિચારે બાપ બીજી ઈચ્છાની પૂર્તિ માટે સંમત થતો નથી પણ માતૃહૃદય પાગલ થઈ ચૂક્યું છે તેને વશવર્તીને બાપ બીજી ઈચ્છાની પૂર્તિ માટે તત્પર થાય છે.

'I wish my-son-alive.'<sup>૧૭</sup>

આટલું બોલ્યા પછીની ક્ષણો પ્રતીક્ષામાં વીતે છે પણ કોઈ કરતાં કોઈ આવતું જગ્ઘાતું નથી પણ ઠીક ઠીક ક્ષણો વીત્યા બાદ બારણે હળવા ટકોરા પડતા હોય એવો અણસાર આવે છે.

મિસિસ વ્હાઇટ પૂછે છે. "what's that ?"

જવાબ મળે છે, 'A rat.'

પણ કમશઃ ટકોરાનો અવાજ મોટો ને મોટો થતો જાય છે. પતિના અટકાવવા છતાં તે દરવાજો ખોલવા મથે છે પણ છેક ઉપરની સ્ટોપર તેનાથી ખૂલતી નથી એટલે મોહું થાય છે. દરમિયાનમાં અંધકારમાં વાંદરાનો પંજો મિસ્ટર વ્હાઇટને જલદી જડ્યો નથી અને તેને કારણે વધુ વિલમ્બ થતો રહે છે. છેવટે જે ક્ષણો મિસિસ વ્હાઇટ દરવાજો ખોલવામાં સફળ થાય છે એ જ ક્ષણો તેના પતિને પેલો પંજો જડી આવે છે. અને 'Herbert my boy'<sup>૧૮</sup> કહેતી એક તરફ મા દરવાજો ખોલી કાઢે તે જ ક્ષણો બીજી તરફ બાપ 'I wish him dead and at peace'<sup>૧૯</sup> કહીને છેલ્લી, ગીજી ઈચ્છા પણ માગી લે છે. મા પ્રતીક્ષાની અને બાપ પ્રાર્થનાની મુદ્રામાં હોય ત્યાં એકંકી સમાપન પામે છે.

જેકબનું એકંકી ૧૮૦૮માં પ્રગટ થયું અને 'a classic of horror fiction' તરીકે પ્રખ્યાત થયું, નિર્જનતા, કબ્રસ્તાન, અંધકાર, વાયુ અને વરસાદનાં તોફણ, વીજળીના કડાકા વગેરે સામગ્રી વચ્ચે એકના એક દીકરાનું મશીનમાં ફસાઈ જવાને લીધે દુક્ટેડુકડા થઈ

જવું. લોહીથી લથપથ શરીર જેવા વિભાવ, ઉદ્દીપનવિભાવની મદદથી ભયાનકતાની જમાવટ થઈ છે. અંગ્રેજમાં જેને Macabre (મા'કાબ્ર) કહે છે એવા મૃત્યુના નૃત્યનો ઓછાયો સાધન્ત આખા એકંકીમાં વ્યાપ્ત છે. ઉમાશંકરના એકંકીમાં કશા જાહૂઈ કે ચમત્કારિક તત્ત્વનો આશ્રય લેવાયો નથી. નંદુ ગોરાડીને બારણે ટકોરા પડતા સંભળાય છે અને બારણું ખોલવામાં થતા વિલમ્બને લીધે પતિ પરભુ ગોર પાછા ચાલી જવાનો આભાસ થાય છે તે તેની અસ્વસ્થ માનસિક સ્થિતિનું સ્વાભાવિક પરિણામ છે. ઉમાશંકરની ફૂટિ છેવટ સુધી વાસ્તવિકતા, પ્રતીતિકરતા અને સ્વાભાવિકતાને જાળવે છે જ્યારે જેકબની ફૂટિમાં ચમત્કારને કેન્દ્રમાં રખાયો છે. તેમ છતાં ત્રણ ઈચ્છાઓની જે રીતે પરિપૂર્તિ થાય છે તે પાછી સાવ સ્વાભાવિક લાગે છે. દીકરાનું મશીનરીમાં ફસાઈ જવાથી મૃત્યુ થવાને લીધે ૨૦૦ પાઉન્ડ મળે. એ પ્રથમ ઈચ્છામાં કશી અસ્વાભાવિકતા વરતાતી નથી, મિસિસ વ્હાઇટ પુત્રોમની ઘોલણમાં પુત્રને સજીવન કરવા ગાલાવેલાં થાય એ પણ સ્વાભાવિક જ લાગે છે અને બાપ દુક્ટેડુકડા થઈ ગેલા પુત્રને સજીવન ન કરવાની જે ચેષ્ટા કરે છે તે પણ તેના પાત્રના સંદર્ભો તો અત્યંત સ્વાભાવિક જ ગણાય. માતા પુત્રને જીવંત કરવાની ઈચ્છા સેવે તે જ ક્ષણે પિતા તેનાથી વિરુદ્ધની ઈચ્છા સેવે તે ટકાવ - નાટ્યાભ્યક્તાને, પરાકાષ્ઠાએ પહોંચાડે છે. વાતાવરણ બંને ફૂટિઓમાં પાત્રની ચૈતસિક ગતિવિધિઓને વળ ચડાવવામાં અને ઘૂંઠવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. નાણાકીય ભીસં બંને ફૂટિઓમાં અગત્યનું પરિબળ બની રહે છે. એક ઊલટી ધારણા કરીને આ વાત વિચારીએ તો બંને ફૂટિમાંનાં કુદુંબો જો આર્થિક ભીસિસમાં ન જવતાં હોત અને વૈભવી પરિસ્થિતિમાં રચયતાં હોત તો કદાચ જે ઘટનાકુમ સમ્ભવિત બને છે તે ન બન્નો હોત. વ્હાઇટટંપટીને ૨૦૦ પાઉન્ડની કશી જેવના ન હોત ને નંદુ ગોરાડી આગંતુકોને પાછા હાકવાની પેરવીમાં પણ ન હોત.

બંને એકંકીના અંત પ્રેક્ષકોને સ્તરથી કરી મૂકે એવા છે. બારણે ટકોરા પડવાની ઘટનાનું સાચ્ય પણ ધ્યાન જેંગે એવું છે. છતાં નંદુ ગોરાડીની જે દ્વિધાત્મક માનસિક સ્થિતિ છે તે જેકબની મિસિસ વ્હાઇટમાં નથી. પરભુ ગોર મૃત્યુ પામી ચૂક્યા છે તો વ્હાઇટટંપટીનો પુત્ર પણ મૃત્યુ પામી ચૂક્યો છે. દિવંગત પાત્રોના પુનરાગમનનું થીમ બંને ફૂટિના કેન્દ્રમાં છે પણ પણ મૃત્યુનો કારણે બસો પાઉન્ડ જીવી રકમ પ્રાપ્ત થાય એમાં રહેલી કરુણ વકતા એકંકીને ધાર આપે છે. માતૃહૃદયનાં સંચલનો બંને ફૂટિઓમાં સરખાવી શકાય એ રીતે આવેખાયાં છે. પતિ-પત્નીનો વિચારભેદ પણ બંને ફૂટિઓમાં સરખો છે. આમ, ઘણી રીતે બંને ફૂટિઓને જોડાજોડ મૂકી, તપાસી, માણી અને નાણી શકાય છે.

### સંદર્ભ :

૧. 'સાપના ભાગ', જોણી ઉમાશંકર, ચૌદમું પુનર્ભૂદ્ધણ, ૨૦૦૦, પૃ. ૧૩. ૨. એજન, પૃ. ૧૩.
૩. એજન, પૃ. ૧૩. ૪. એજન, પૃ. ૧૩. ૫. એજન, પૃ. ૧૨. ૬. એજન, પૃ. ૧૩. ૭. એજન, પૃ. ૧૪. ૮. એજન, પૃ. ૧૫. ૯. એજન, પૃ. ૧૮. ૧૦. એજન, પૃ. ૧૯. ૧૧. એજન, પૃ. ૨૦. ૧૨. 'Poetry and minor forms of English Literature oup' ૧૯૯૮, p. ૧૯૮. ૧૩. Jbid, P. ૧૯૮.
૧૪. Ibib, P. ૨૦૦. ૧૫. Ibib, P. ૨૦૬. ૧૬. Ibib, P. ૨૦૮. ૧૭. Ibib, P. ૨૧૧.

[મુંબઈ યુનિવર્સિટી વાણ્યાન, તા. ૩-૩-૨૦૦૮, કુ. ડેલાસબહેન રામપ્રસાદ મહેતા સ્મારક વાણ્યાન અંતર્ગત]

## ‘રાગ-પરાગ’ની કવિતા | ડૉ. હિમ્મત ભાલોડિયા

દરેક સર્જક પરંપરાનું સંતાન છે. પરંપરાનું બળ એના સર્જન-સંસ્કારને પાળે છે, પોષે છે અને વિકસાવે છે. પરંપરા પાસેથી ઋણ સ્વીકારી સર્જક પોતાનાં સર્જનને નવીન ઘાટ આપે છે. પરંપરાનુસંધાન એ દરેક સર્જકનાં સર્જનને ચાલક બળ પૂરું પાડે છે. જાણો-અજાણો દરેક સર્જક પોતાનાં સર્જનમાં પરંપરાનુસંધાન જાળવતો હોય છે. કોઈના માટે પણ પરંપરાથી સંપૂર્ણ વિશ્વેષ શક્ય નથી.

‘રાગ-પરાગ’ની કવિતામાંથી પસાર થતાં ડિશોરસિંહ સોલંકીનાં કાવ્યસર્જનમાં આપજાને ગુજરાતી કાવ્યસાહિત્યનો પરંપરિત વારસો સચવાયેલો જોવા મળે છે. એમની કવિતામાં અનાયાસે પણ પરંપરાનુસંધાન જળવાયું છે.

ડિશોરસિંહ સોલંકીએ ‘વિન્યાસ’ (૧૯૮૧), ‘કારણ’ (૧૯૮૮), ‘પ્રેમાક્ષર’ (૧૯૮૫), ‘અજાણ્યો ટાપુ’ (૧૯૮૭), ‘મનસાને મેળે’ (૧૯૮૮) અને ‘દરિયાનું વૃક્ષ’ (૨૦૦૭) જેવા છ-એક કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘મનસાને મેળે’ એમની ૧૯૮૭ સુધીની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે. એ પહેલાંના ચારેક કાવ્યસંગ્રહો ‘વિન્યાસ’, ‘કારણ’, ‘પ્રેમાક્ષર’ અને ‘અજાણ્યો ટાપુ’માંથી કેટલીક રચનાઓ પસંદ કરી મણિલાલ હ. પટેલે ‘રાગ-પરાગ’ (૨૦૦૭) કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું છે.

ડિશોરસિંહ સોલંકીએ નિબંધ, નવલિકા, નવલકથા અને પ્રવાસકથા જેવા ગદ્યક્ષેત્રે તો કવિતા જેવા પદ્યક્ષેત્રે પણ પોતાની કલમ ચલાવી છે. તેમની વિશેષ પ્રસિદ્ધિ કવિ, નવલકથાકાર અને પ્રવાસનિબધકાર તરીકેની રહી છે. ગદ્ય-પદ્ય બેઠું ક્ષેત્રે પોતાની કલમનો વિહાર કરનાર આ સર્જક સદાય ઉમળકાભેર સર્જન કરતા રહ્યા છે.

સ્વરૂપ અને વિષયની દસ્તિએ ‘રાગ-પરાગ’ની કાવ્યસમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને વિશાળ છે. એમની કલમે અછાંદસ, સોનેટ, ગીત, ઉર્મિકાવ્ય, તાંકા આદિ સ્વરૂપો પર અને પ્રણાય, પ્રકૃતિ, ચિંતન, વ્યક્તિમતા આદિ વિષયો પર વિહાર કર્યો છે. પ્રકૃતિ, પ્રણાય અને પરમતાર ઉપરાંત સાંપ્રદાત્રે સમયના માનવીની દુર્દ્દાશ કાવ્યનો વિષય બનીને આવે છે. તેમણે નાનાં-નાનાં ઉર્મિકાવ્યોથી માંણીને દીર્ઘકાવ્યોનું ખેડાણ કર્યું છે. ‘રાગ-પરાગ’ની કવિતાઓનો ડિશોરસિંહનો આગવો અવાજ, આગવો મિજાજ, આગવી ખુમારી અને અલગારીપણું પ્રગટ થાય છે.

ડિશોરસિંહની કવિતામાં કૃષિજીવન કે તળપદ્ધ ગ્રામજીવન સજીવતા ધારણ કરે છે. ગ્રામજીવનનો પરિવેશ, પરિસ્થિતિ કે પારદર્શિતા એમની કવિતામાં સુપેરે પ્રગટે છે. પોતાનાં વતનની યાદ કવિને સતત તડપાવે છે, અકળાવે છે, મૂંજાવે છે. કવિ વતનની સ્મૃતિઓને વિસરી શકતા નથી. વતન સાથે સંકળાયેલાં દરેક સ્મરણો કવિના સ્મૃતિપટ પર તાજાં થઈ આવે છે. આથી જ ‘વતનાંચલ’ કવિતામાં જણાવે છે.

“જ્યાં મારું પ્રથમ આગમન છે. / મારો પહેલો શબ્દ ‘આ’ પણ છે.” (ધર)

“જ્યાં મારાં પગલાં છે. / મારું અસ્તિત્વ પણ છે.” (શેરી)

“જ્યાં મારું શૈશવ છે. / આમળી-પીપળી રમતા/ મારા બેરુઓ પણ છે.” (પાદ)

“જ્યાં મારા ભૂસકા છે. / મારી દૂલ્હકીઓ પણ છે.” (તણવ)

(‘વતનાંચલ’, પૃ. ૮૮-૯૦૦)

ગ્રામજીવનથી વિભૂતા પડ્યાની વેદના અને શહેરીજીવનની ભરચુક ભીસમાં ભીસાયા કર્યાની અકળામણ કવિને વિધિત કરી મૂકે છે. કવિને વતનનો વિશ્વેષ સતત સત્તાવ્યા કરે છે. નગરજીવનની યાંત્રિકતા, વિચિન્નતા, કૃત્તિમતા અને કુસ્તિતત્ત્વાથી કવિ કંટાળી ગયા છે. એમને તો ગ્રામજીવનનું સાહું, સરળ અને લાગણીશીલ વાતાવરણ વધારે આકર્ષે છે. કવિ ‘કંટાળી ગયો છું’ કાવ્યમાં નગરજીવન અને ગ્રામજીવનની વિરોધાભાસી બેદરેખાનું અંકન કરતાં જણાવે છે:

“હું કંટાળી ગયો છું –

આ નગરની નગ્ન જાંઘો ઉપર હાથ ફેરવતાં ફેરવતાં / અને  
એની નસેનસમાં વહેતા ડામણિયા લોહીના ઉચ્છવાસથી.

મારે તો મારી છાતી ઉપર ઉગાડવું છે મારું ગામ.

સીમના છેલ્લા જેતરમાં ચરતી સાંજને

હંકતાં હંકતાં વાળવી છે ધર તરફ.”

(કંટાળી ગયો છું’, પૃ. ૨૦)

કહેવાય છે કે ભારત ગામડાંમાં જીવી રહ્યો છે. પણ હવે પરિસ્થિતિ એવી નિર્માણ પૂર્ણી છે કે ભારત ગામડાંઓમાં મરી રહ્યો છે. ગામડાંઓ ભાંગાને શહેરો બનવા લાગ્યાં છે, ભરવા લાગ્યાં છે. વિકસવા લાગ્યાં છે. ગામડાંમાં જ્યાં ખર્જું, ખેતર, અને આંબાવાદિયું હત્યાં ત્યાં સિમેન્ટ + કોકિટના ફેલેટ્સ ઊભા થઈ ગયા છે. પાઇન્નું ઝરણું વહેતું હતું ત્યાં વીજળીના થાંબલાઓનો ઇલેક્ટ્રિક પ્રવાહ શરૂ થઈ ગયો છે. આથી જ કવિ આવી નગર-સંસ્કૃતિને ‘રાક્ષસી યંત્ર’ તરીકે ઓળખાવે છે અને એટલે જ બોલી ઉઠે છે...

“આજે / કોઈ તરત જ જન્મીને મૃત્યુ પામેલા બાળકની / માના  
વણધારેલા સ્તનની વેદના / ભોગવી રહી છે મારી ધરતી.”

(‘વેદના’, પૃ. ૨૨)

પ્રેમાંદના ‘સુદામાચારિત્ર’માં આવતા કૃષ્ણ-સુદામાના ‘તને સાંભરે રે, મને કેમ વિસરે રે’ જેવા સંવાદરૂપી કડવાની જેમ. ‘એક પત્ર’ કાવ્યમાં પણ ગામડાંના વાતાવરણમાં વીતેલાં શૈશવનાં સ્મરણોને વાગોળતાં કવિ પોતાના મિત્રને પત્રમાં લખી જણાવે છે કે ‘એ યાદ તને ? મને યાદ છે.’ કવિ વતનમય બની ગયો છે. વતનનાં સમસ્ત તત્ત્વો જાણે કે એમનામાં શ્વસી રહ્યા છે. વતનનું વાતાવરણ કવિમાં પ્રવેશી ગયું છે. એટલે જ કવિ કહે છે :

“પાદર ધર ધર રે / સીમ આવતી સામે મળે

ધાંશ – ખેતરને શોઢા – શોઈડા / મારામાં હરે – ફરે ને ચરે.

શોરી ને શાળા / ગામ ને નામ / ચોમાસાનો દૂધમલ વગડો.

ભાગોળેથી વહેતો હેળો / ખળખળવા માંડે છે મારામાં.”

(મારા સિવાય’, પૃ. ૮૮)

આ ઉપરાંત ‘ચાત-૧’ ‘ચાત-૨’ કાવ્યમાં પણ કવિએ પોતાના વતનની સ્મૃતિઓને વ્યક્ત કરી છે.

ગામડું છોરીને શહેરમાં આવી વસતા મધ્યમ વર્ગના માનવીના જીવનની અકળામણ,

મૂંગવજ અને મથામણને કવિ સચોટ મૂકી આપે છે. નગરજીવનની ભીસમાં પિસાતા માનવીની દુર્દશા, વેદના, વ્યથિતતા એને અકળાવે છે. તેમ છતાં નગરજીવનની ભીસ કે ભીડથી વિષાદ કે વેદના અનુભવવામાં આ કવિને જીવનની સાર્થકતા જ્ઞાની નથી.

કવિને મહામૂલો મનુષ્યાવતાર ધરી પૃથ્વી પર પધારવું યોગ્ય જ્ઞાનું નથી. કારણ કે માણસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. માનવી પોતાની ઈચ્છા અનુસાર કંઈ કરી શકતો નથી. પોતાની મરજી મુજબ વર્તી શકતો નથી. માનવી પોતાને નિઃસહાય માને છે. કવિ જ્ઞાનાર્થી હોય છે તેમ...

“મને સમજાય છે  
હર કાશનું સાર્થક્ય, સર્વસ્વ !  
પણ હું નિઃસહાય...!”

(‘સાર્થક્ય’, પૃ. ૬૮)

આપણા દેશની આજની પરિસ્થિતિ જોઈને કવિ ગુંગળામજા અનુભવે છે. એટલે જ તેઓ નવો જન્મ લઈને અવતરવાને ‘જનમટીપ’ કહે છે. એટલું જ નહીં, એ તો મનુષ્યજીવનને જનમટીપની સઝ માની નવા જન્મને વિકારે છે. તેઓ પોતાની જન્મદાની જનેતાને પોતાની પાંગળી પરિસ્થિતિનો પરિચય કરાવતાં કહે છે :

– કબાટમાં ઠસ્ટી કરીને મૂકેલાં કપડાની જેમ  
અત્યારે તો / હું / – ગુજરીમાં વેચાતો કૂકડો  
– પાંજરાપોળનું ખોડું ઢોર / – બલિનો વધીચાતો બકરો  
– ભઠીયાર ગલીમાં તળાતી માછલીની ગંધ / કે  
– ભીતો ઉપર ચોડેલું નામ વિનાનું પોસ્ટર... / મા,  
મને આ જનમટીપની સજા કેમ આપી / કેમ ...?”

(‘જનમટીપ’, પૃ. ૧૮)

કિશોરસિંહ સોલંકી નિતાંત સૌંદર્યભિમુખ કે સૌંદર્યલક્ષી કવિ નથી પણ સમાજભિમુખ કવિ છે. એમની કવિતામાં સમાજભિમુખતા, જીવનના ઉચ્ચ આદર્શની ભાવના અને જીવનની વાસ્તવપરાયણતાનાં પ્રત્યક્ષ દર્શન થાય છે. છતાં તેમની કેટલીક પ્રકૃતિ-વિષયક કે પ્રણયવિષયક કવિતાઓ સૌંદર્યભિમુખતાની જાંખી અવશ્ય કરાવે છે.

કવિએ ઘણાં રમણીય પ્રકૃતિકાલ્યો આપ્યાં છે. જેમાં ‘ગામ’, ‘ખેતર’, ‘વહેલી સવારે’, ‘ઢળી સંધ્યાએ’, ‘અંધકાર’, ‘વૃક્ષત્વ’, ‘દરિયો’, ‘દરિયાનું વૃક્ષ’, ‘આ વૃક્ષ’, ‘પ્રભાત’, ‘વસંત’, ‘ચાત ૧-૨’ – આદિને ગજાવી શકાય. કવિ પ્રકૃતિરાગી છે. તેમની કવિતામાં પ્રકૃતિ-તત્ત્વોનો વિનિયોગ ભિન્ન ભિન્ન પ્રયોજનથી થયો છે. ઘણી વાર મનોભાવને વયક્ત કરવા પ્રકૃતિતત્ત્વોનો પ્રતીકાત્મક વિનિયોગ કર્યો છે. પ્રકૃતિનાં રમ્ય – રૈદ – રૂપોનું, પ્રકૃતિની વિવિધ છટાઓનું – પ્રભાત, સંધ્યા, સવાર, સાંજ, બપોર, રાત્રિ, અંધકાર, ખેતર, વૃક્ષ, દરિયો, ભરતી-ઓટ, વસંત આદિનું વર્ણન આસ્વાદ્ય બની રહે છે.

કવિ અંધકારને જીવત કરી અંધકારની વિવિધ લીલાઓને પ્રતીકાત્મક શબ્દચિત્ર દ્વારા આદેખે છે. અંધકારને ભયાનક, વિકરાળ, રૈદ કે કોમળ, ઝજુ અને રમ્ય રૂપે પ્રગટ કરે છે. અંધકારને કવિની કવિતામાં વિધવિધ રૂપે આવતો જોઈ શકાય છે. જેમ કે ‘અજાણ્યો

યપુ’માં અંધકારને ખળખળ વહેતો દર્શાવતાં કહે છે :

“ખળ ખળ વહેતા / અંધકારના કિનારેથી / મને કોઈ અકળ હાથ  
ધક્કા મારે છે. / અને હું ઝ્રમ દઈને ફેંકાઈ જાઉ છું.  
કોઈ અજાણ્યા યપુ ઉપર / જ્યાં બધું જ જળજળ જળજળ.”

(‘અજાણ્યો યપુ’, પૃ. ૧૧૧)

આ જ કવિતામાં કવિએ ‘અંધકારના કિનારે’, ‘અંધકારનાં ઉદ્યાનમાં’ અને ‘અંધકારની ડાળીએ’ એવા શબ્દપ્રયોગો વાપરી અંધકારને નથી, બાગ અને વૃક્ષનાં રૂપમાં કલ્યાણો છે. અહીં કવિએ પોતાની તિમિરથી તેજમય ગતિ દર્શાવી છે.

તો ‘ચાત-૨’ કાવ્યના અંતમાં કવિ કહે છે.

“પણ આ અંધકારને જજાનારી રાત  
કેમેય કરીને ખસે જ નહીં.”

(‘ચાત-૨’, પૃ. ૧૨૨)

‘પ્રભાત’ કાવ્યમાં પણ જુઓ ! પ્રકૃતિનું કેટલું સુંદર આવેખન છે !...

‘તારી પ્રતીક્ષાનું / સરોવર તરંગાય / અંધારા પવનની હોડીમાં  
જાની લહેરો સાથે / સંતાકૂકી રમતો ચાંદો / માછલીની પીઠ પાછળ  
સંતાઈ જાય / તળિયાની શેવાળમાં / લપસી પડે તારાઓનું ટોળું...’

(‘પ્રભાત’, પૃ. ૮૬)

આ ઉપરાંત ‘વસંત’ની નાનકડી છ કવિતાઓમાં કવિ જજાને છે :

“ઈથરે / આપણા આનંદ માટે / એક કવિતા રચી છે. / એની /  
ધૂવાંદિત છે. / આ વસંત....”

(‘વસંત’, પૃ. ૧૦૧)

તેમજ....

“આ વૃક્ષની ડળ પર / એક સાથે / બે આશ્રય : /  
રડતી પાનખર / અને / હસતી વસંત !”

(‘વસંત’ પૃ. ૧૦૨)

વર્ષાત્રાનું આવતાં, વરસાદી માહોલ બંધાતાં, વાદળો દરિયામાંથી પાણી ભરી લાવી પર્વતોના ડોળાવા પર વરસાવી ટે છે. કવિ આ ચોમાસાની મોસમને ‘દરિયાના દિવસો’ તરીકે ઓળખાવે છે. જેમકે...

“દરિયાના દિવસો શરૂ થયા છે  
અને દરિયાના ટોળોટાં શરૂ થયા છે.  
હોડીઓ અને હોડિયો ભરી દરિયો  
ડોળાવા લાગ્યો છે. પર્વતમાં !”

(‘દરિયો’, પૃ. ૬૬)

કવિએ પ્રણયકાવ્યમાં મિલન, વિરહ, વેદના, વ્યથા, ઉત્સાહ, આનંદ – આદિ ભાવોને ઉજાગર કર્યા છે. મિલનની ઉત્સુકતા કેટલી છે ? પ્રિયા અને પોતે કેટલા અદ્વિતી છે એ દર્શાવતાં

કહે છે.

“કહે છે કે / અત્યારે પણ મારી રાહ જોતી  
તું તિલી છે મારા બારણામાં / કાળો કાળો પડળાયો પહેરી  
જેવો હું ઘરમાંથી બહાર નીકળું / ત્યાં તું દેલાની જેમ  
વીટળાઈ વળે, મને / આપણો એક, અદૈત !”

(મૃત્યુ-૨, પૃ. ૧૧૭)

કવિ પોતાની પ્રિયતમાને ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વિહરતી જોવાની ઠથ્થા ધરાવે છે. એટલે જ કહે છે :

“ગઈ કાલે / મેં તને જોઈ હતી / ધોમધખતા તડકા જેવી.  
આજે / તને જોઉ છું / સાગરનાં મોંઝ ઉપર / બેણળતી - ફૂદતી.  
આવતી કાલે / જરૂરથી જોઈશ તને / મારી / તરસી બોમકા ઉપર  
વાણીની જેમ વરસતી.”

(‘પાંચ રચના’, પૃ. ૧૦૩)

કવિ પ્રિયતમા માટે થઈને લીલો-હરિયાળો, પ્રકાશમય-પ્રેમનો રસ્તો જે રસ્તો એના પ્રેમના ગંતવ્યસ્થાન સુધી લઈ જાય એવો રસ્તો - બનવા તૈયાર છે.

“મારે બીજું કાઈં નહીં / માત્ર તારો રસ્તો બનવું છે.  
લીલો - લીલો - હરિયાળો રસ્તો / જે રસ્તેથી તું આવી શકે  
મારા સુધી - હું તારા સુધી !”

(‘રસ્તો’, પૃ. ૮૭)

કવિ કેટકેટલા અભાવો વચ્ચે જીવી રહ્યા છે. કવિને ભૂત-પવિત કે હિંસક પશુનો નહીં પણ માણસનો, આધુનિકતાનો, કર્દિક મેળવ્યા પછી ગુમાવવાનો ભય છે પણ પ્રેમપથ પર ચાલ્યા પછી કવિને આવો કોઈ ભય રહેતો નથી. એ તો નિર્ભય બની ગયા છે. એટલે જ બોલી ઊઠે છે...

“હું હું અભ્ય, પ્રેમપથ  
પ્રેમને ક્યારેય હોતો નથી / કોઈનો ભય !”

(પ્રેમ-૨, પૃ. ૬૪)

પ્રણયનો ભાવ અનુભવવા બંને પ્રેમી પાત્રોએ એકબીજાને જાગ્રતા-સમજવા-પામવા-અનુભવવા-પ્રમાણવા સતત પ્રયત્નશીલ રહેવું પડે. પ્રણયની પરાકાષ્ઠાએ પહોંચવા બંને પક્ષે સમજણ અને શાશપણ જોઈએ; તો જ પ્રણયજીવનની સાર્થકતા સિદ્ધ થાય છે. કવિ જણાવે છે તેમ...

“જશો જ્યાં જ્યાં ત્યાંથે રહુ નયનમાં અંજન સમો  
સદાયે આંજેલો પળપળ હું તો હાજર, પ્રિયે !”

(‘આમંત્રણ’, પૃ. ૧૫)

મિલન અને વિરહનો ભાવ કવિની સૂક્ષ્મ પ્રણયાભિવ્યક્તિની વિવિધ તાસીરીથી અવગત કરાવે છે. એમની કવિતામાં મિલનની પ્રસન્નતા કરતાં પ્રણયના વિષાદનો રંગ

વિશેષ અનુભવાય છે. જેમ કે...

“નહિ ચાહવું એટલે શું ?  
પ્રેમ કોઈ હૃજમાં મૂકેલું ફૂદસ છે, તે  
ના ખાશો ?”

અથવા

“અરેખર / એ મને નહિ ચાહતી હોય ?  
તો પછી ‘ના ચાહશો’ એવું લખે કેમ ?  
ચાહે છે માટે લખે છે ?”

(‘તું ચાહીશ નહિ’, પૃ. ૮૪)

ઉપરંત

“હું તને ચાહું છું એવું કહું છું  
ત્યારે હું મને જુદા જુદા ખંડોમાં વહેંચું છું  
તેથી તને ચાહવી એ પણ મારા માટે  
એક ખંડ બની જાય છે.”

(‘સાયુજ્ય’, પૃ. ૬૮)

પ્રણયની વેદના અને વથામાંથી કવિની સ્વકીય મુદ્રા ઉપસતી જગ્યાય છે. પ્રિયાને પામવાની ઝંખના એમનાં પ્રણયકાબ્યોમાં વિશેષ અનુભવાય છે. અને એટલે જ એમની કવિતામાં નિષ્ફળ પ્રણયની વેદના ક્યારેક પરાકાષ્ઠાએ પહોંચે છે. જેમકે...

“જ્યાં હુઃખ છે ત્યાં ચાહના નથી  
જ્યાં ચાહના છે ત્યાં હુઃખ નથી  
આ સામસામેના ધૂંવ છે બન્ને.”

(‘સાયુજ્ય’, પૃ. ૬૮)

મિલન સ્થળ હોય કે સૂક્ષ્મ, સંદેહ હોય કે વિદેહ, પ્રિયાના વિરહની વેદના હોય કે પ્રિયા સાથેનું મધુર મિલન હોય - એ બધું એમનાં પ્રણયકાબ્યમાં વિલક્ષણ રીતે પ્રગટે છે.

કિશોરસિંહ સોલંકી પુરાકલ્યનનો (મીથનો) પણ સારો વિનિયોગ કરી જાણે છે. પુરાકલ્યનનું ઉત્તમ ઉદાહરણ ‘તેઓ’ કાબ્યમાંથી પ્રાત થાય છે. અહીં કવિએ ભગવાન વિશ્વાના નૃસિંહાવતાર અને કૃષ્ણાવતાર બન્નેમાંથી સંદર્ભો લઈને આજના રાજનેતાઓની પુઅંડિતતા, પોકળતા ને સ્વાર્થી વૃત્તિને ખુલ્લી પાડી છે. જેમકે,

“તેઓ / નૃસિંહાવતાર ધારજ કરીને જન્યા છે.  
એમના વધતા જતા પોલાદી નહોરથી  
ઉજરાયા કરે છે હાડપિંજરો  
ને જન્યા કરે છે કાળ કાળ લોહીનાં ટીપાં ટાયક...ટાયક.”

(‘તેઓ’, પૃ. ૨૧)

ઉપરાંત.....

“તેઓ / ધારે ત્યારે બદલી શકે છે ઋતુઓ,  
ધારે ત્યારે આકાશને ગડી કરીને મૂકી શકે છે ગજવામાં,  
ને ધરતીને ઊંચકી શકે છે ટચલી આંગળીએ.”

(‘તેઓ’ પૃ. ૨૧)

એટલું જ નહિ, આવા રાજકારણીઓના રાજમાં તો પ્રકૃતિનાં તત્ત્વોને પણ એમના આદેશો અનુસાર વર્ત્તવું પડે છે. એમના દ્વાર સૂર્યને પહેરો ભરવો પડે છે. એમના બાંધીલા કિનારાઓમાં જ સાગરને પુરાઈ રહેવું પડે છે. એમના આદેશો મુજબ જ પંખીઓને કલરવ કરવો પડે છે અને વૃક્ષોએ પણ શિસ્તમાં હારબંધ ઊભા રહી સલામી આપવી પડે છે. આ લોકો ધારે તે કરી શકે છે. પણ કવિ કહે છે તેમ તેઓ માત્ર ‘માનવ’ જ બની શકતા નથી.

‘મતદાતા’ કાવ્યમાં કવિએ આજના સમયે યોજાતી ચુંટણીઓ અને આવી ચુંટણીઓમાં મતદાન કરતાં મતદાતાઓ પર ચોટદાર કટાક કર્યો છે. ચુંટણી સમયે મતદાતાઓને શાત્રીવાદનું તેર પિવડાવવામાં આવે છે. ભાઈચારાની વાતો કરતા રાજનેતાઓ ભાઈચારાની આડમાં ભાઈ-ભાઈને ખતમ કરાવી નાંબે છે. ધાક-ધમકી અને મારઝૂડના વાતાવરણમાં ચુંટણીઓ યોજાય છે. ‘વાલચનો વેપાર કરનારી ઠોળીના પંજામાં સપડાઈને’ લાલચુ મતદાતાઓ દેશના દ્વાલાને – સોદાગરોને ચુંટી લાવી રાજ્યાસન પર બેસાડી હે છે એનો કવિને ભારોભાર રંજ છે. ‘લોકશાહી નામની સ્વભાસુંદરી’ને આ લોકો મનજીવે તેમ નચાવે છે, નમાવે છે અને તરફદિયાં મરાવે છે. કવિને દેશની આવી દારુણ પરિસ્થિતિ જોઈ ખૂબ હુંબ હુંબ લાગે છે અને એટલે જ કવિ આવા મતદાતાઓ વિશે કરે છે :

“એને મળી ગયા છે / અંધારિયા દેશના આગેવાનો  
જેમની આંગળી પકડીને / આંખ-કાન અને મગજ ગીરે મૂકતો જાય છે.  
એની પણ એને બિચારાને ખબર નથી પડતી.”

(‘મતદાતા’, પૃ. ૫૪)

માનવજીવનમાં માનવીને ગમે ટેટલી વેદના કે વ્યથા સહેતી પડે છતાં તેણે પોતાની ઊભિલતા, સંબેદનશીલતા કે ઋજુતા ગુમાવવી ન જોઈએ. પરંતુ માણસ તો આખરે માણસ છે ને ? ક્યારેક કોઈક કારણોને-દબાણોને-સત્તાને વશ થઈ વર્ત્તવું પડે છે ત્યારે કવિનું લાગણીશીલ હૃદય વ્યાકુળ બની અસર્વ વેદના અનુભવે છે. કવિ પોતાના જ વિશે કહે છે તેમ....

“કિશોર તો ભઈ કિશોર હોય / એને માણસ હોવાનો શાપ હોય  
જીવનું હોય તો / તરવું પડે ને કરગરવું પડે.  
નરમ-ગરમ / કે શરમ વિનાનું થર્યું પડે.”

(‘કિશોર’, પૃ. ૩૨)

માનવજીવનમાં સુખદુઃખની આવન-જાવન તો ચાલ્યા કરે. જીવનના વાસ્તવની સાથે માનવીએ જીવનમાંગલ્યના ઉચ્ચ આદર્શ સિદ્ધ કરવા પડે. સકારાત્મક વિચારસરણી અપનાવવી પડે. વેદનાઓ અને યાતનાઓને સહેતી પડે. તો જ માણસને માનવજીવનનો

સાચો મર્મ સમજાય.

આમ, પ્રકૃતિરંગયું વતનનું વાતાવરણ, પ્રશયચેતનાની મધુર મહેક, વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનો સંબંધ અને સહવાસ, સર્જન અને રાજકારણની વિરોધાભાસી દુનિયાના વિશાળ અને વૈવિધ્યપૂર્ણ અનુભવો એમના કવિ-વ્યક્તિત્વનાં ઘડતર અને ચણતરમાં સહાયક પરિબળો પૂરાં પાડે છે.

કિશોરસિંહનાં કેટલાંક ગીતો તો રસિક લોકગીતોના લયઢાળમાં રચાયાં છે. તેમાં તળપદી લોકબોલીના લય-લહેકાઓનો સુભગ વિનિયોગ કર્યો જણાય છે. લોકઢાળમાં વાખેલા ‘હમચૂં ત્યો હમચૂં’ ગીતમાં કવિએ બાલઉખાણાની જેમ પાણી અને પરપોટાની વાત કરી છે. પાણીને લીધે કે પાણીમય જ સમસ્ત સૂચિ છે, પાણી આખરે પાણીમાં જ સમાય એ વાતને કવિએ લોકલયનો ઉપયોગ કરી સરસ રીતે મૂકી આપી છે :

“પરપોટામાં પાણી રે હમચૂં ત્યો હમચૂં  
પાણીમાં એક પોરો રે હમચૂં ત્યો હમચૂં  
બટકે ઓરો ઓરો રે હમચૂં ત્યો હમચૂં”

(‘જીત’, પૃ. ૫૫)

ગ્રામજીવન કે કુષિપરિવેશને લગતા શબ્દો કિશોરસિંહની કવિતામાં પુષ્ટ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેમ કે – ખેતર, શેલો, ખણું, રેતી, મોગરી, પાદર, ઘાસ, તણખણું, પરાળ, ધૂળ, ઘઉંની ઊંબી, છીંદું, ગમાણ, ધૂસરી, ખોડું ઢોર, લોંદો, ઢૂંડાં, ગોફણ, ચાડિયો, ઠાઈઠી, તરણું, ખાટલો, ઈસ, ખોયલું, હોકલી, અંગારો, રજોટી, ટાબરિયાં, બોઘા, ઢેરો, નેજવાં, ડાકલાં, બોગરણાં, ખીલો, અંદેલી, ગાભા-ગોદાં, નાળચું, ચોરસી, ઘાડવો, પાણિયાંદું, બાળોતિયાં, આળિયા, ભાથરી, ખાંદિશિયો, સાંબેલું, કુશકા, ઘંટી, જેફરા – આદિ તેમજ ‘શત-૧ અને ૨’માં તો લોકબોલીના અનેક શબ્દો આપણાને મળે છે. એમાંના ઘણા શબ્દો તો કેટલાક લોકોને માટે અપરિચિત જેવા જ લાગે !

કિશોરસિંહની કવિતામાં પ્રતીક-કલ્યનની યોજના તો ખરેખર આકર્ષક જ છે. તેમણે પ્રકૃતિનાં તત્ત્વો સાથે અનુંબંધ રચી પ્રતીક-કલ્યનની યોજના કરી છે. પ્રતીકો જોઈએ તો...

“સુકાઈ ગયેલા વગડાના ઉદરમાંથી તશ્શખલાનો જન્મ થતો હો ?”

(‘શબ્દ’, પૃ. ૨૪)

“હશહજાતા ઘૈવનને લઈ દાણેથી ખરતું હશે પાંડકુ ?”

(‘શબ્દ’, પૃ. ૨૪)

“આપણા પાદરે ઊળી નીકળ્યો ડામરનો શેઠો”

(‘એક પત્ર’, પૃ. ૩૦)

“પાદરે ઊલેલો વાંદ્રિયો વડ આંબે નેજવા કરીને તાકી રહે છે મને”

(‘પિતા વિનાના પ્રદેશમાં’, પૃ. ૩૭)

“લોકશાહી નામની સ્વભાસુંદરી,  
છેલ્લાં ચાલીસ વર્ષથી તરફદિયાં મારી રહી છે.”

(‘મતદાતા’, પૃ. ૫૪)

“આ કરોડરજજુ વિનાનું આકાશ તો મારા ખોળમાં આવીને,  
લપાઈ ગયું.”

(‘ઘોદશની રાતે’, પૃ. ૮૦)

કવિએ પોતાની કવિતામાં શ્રાવ્ય, ગંધ્ય, સ્વર્ણ આદિ કલ્પનોની હારમાળા રચી આપી છે. દસ્તિગોચર, શ્રવણગોચર, ધ્રાષેન્દ્રિય કલ્પનો કવિ ખૂબ સહજતાથી વાપરે છે. જેમકે....

“છણી સંધ્યાએ વૃક્ષને કલરવ ફૂટે.”

(‘છણી સંધ્યાએ’, પૃ. ૪૧)

“પાંદડે પાંદડે ફરફરી રહે લીલોછમ અંધકાર”

(‘છણી સંધ્યાએ’, પૃ. ૪૧)

“તરણાની યોચે ઊભેલો પવન / સાંભળો કાન સરવા કરીને.”

(‘છણી સંધ્યાએ’, પૃ. ૪૧)

“ઝાકળભીના ઘાસમાં પગલાં પાડતો પવન.”

(‘વહેલી સવારે’, પૃ. ૪૦)

‘તારી રાહમાં’ કાવ્યમાં કવિએ કલ્પનોની જે યોજના કરી છે તે અદ્ભુત છે. તેમાંય કિરણોનું દીરું પકડીને અંધકારની ખીણોમાં ઊતરતો સૂરજનું કલ્પન તો ખરેખર આસ્વાદ જ બની રહે છે.

કવિ ક્યારેક શબ્દોની સાથે છળ પણ કરી લે છે; જેમ કે....

“આપણો તો રેતીનું લીલુંછમ ઘાસ ને  
ઘાસની લીલાશ તો આપણો”

તેમજ

“આપણો તો રેતીનો ઊતરેલો ઘાટ ને  
ઘાટનો વળાંક તો આપણો.”

(‘આપણો’, પૃ. ૧૭)

તો ‘અક્ષર’ કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં કવિને કોઈ નવો પ્રાસ ન સૂક્ષ્મતાં ‘માછલી રોતી નવ’ અને ‘માછલી રોતી ભવ’ કરી બેસે છે. આમ, તેમની કવિતામાં ક્યારેક પ્રાસના પલટા કે લયના લપટાઓ પણ અનુભવવા મળે છે. તેમની કવિતામાં ક્યારેક શબ્દપુનરગવર્તનો કે પંક્તિપુનરગવર્તનો પણ જોવા મળે છે. જેમ કે ‘ઘઉંની ઊંબીઓ’ (‘પિતાજને’ પૃ. ૨૬ અને ‘એક પત્ર’ પૃ. ૩૧), ‘ડનલોપના પગ’ (‘એક પત્ર’ પૃ. ૩૧) તો ‘ડનલોપી નાવ’ (‘પિતા વિનાના પ્રદેશમાં’ પૃ. ૩૭), ‘આપણા પાદરે ઊગી નીકળ્યો ડામરનો શોઢો’ (‘એક પત્ર’ પૃ. ૩૦), ‘અને જે પાદરમાં ચાંદની રમતાં હતાં ત્યાં / ડામરિયો શોઢો ઊગી નીકળ્યો છે.’ (‘પિતા વિનાના પ્રદેશમાં’ પૃ. ૩૭). તેમની ઘણી કવિતાઓ સાથ સામાન્ય કક્ષાની પણ માલુમ પડે છે જેમાં ‘આપણો’, ‘અક્ષર’, ‘સાથીદાર’, ‘ઘર’, ‘ધેય’, ‘પરીક્ષા’, ‘હૃપાહૃપ’, ‘ભાષા’, ‘ભંડોડા’, ‘ધેખી’ – આદિને ગણાવી શકાય.

કવિએ ચિંતનોર્ભિ અને વ્યક્તિવિશેષ કાવ્યો પણ લખ્યાં છે. ‘બાધો’ કાવ્યમાં કવિએ ‘બંધન’ અને ‘મુક્તિ’ તેમજ ‘જીવન’ અને મૃત્યુ’ વિશે પોતાનું ચિંતન ૨૪૪ કર્યું છે. ‘સાથીદાર’

પરબ્ર. v ઓંગસ્ટ, 2009

અને ‘ઘર’માં ‘સમય’ વિશે તો ‘પ્રત્યુત્તર’માં ઈશ્વર વિશે ચિંતન પ્રગટ થાય છે. ‘પ્રત્યુત્તર’માં કવિ જણાવે છે....

“ગુલાબના બગીચામાં ઊભા રહીને / સારામાં સારું  
ગુલાબનું કૂલ / શોધીને ચૂંટીએ છીએ / અનું જ હોય છે.  
ઈશ્વરનું પણ / આપણા માટે.”

(‘પ્રત્યુત્તર’, પૃ. ૪૪)

એમનાં વ્યક્તિવિષયક કાવ્યોમાં ‘પિતાજને’, ‘કવિ પ્રિયકાન્તને’, ‘પિતા વિનાના પ્રદેશમાં’, ‘હું કૃષણ’, ‘જશોદાને’ અને ‘મા’નો સમારેશ કરી શકાય.

કિશોરસિંહ સોલેકી પાસેથી સોનેટ અને ગીતો પણ થોડા પ્રમાણમાં મળે છે. તેઓ જેટલા ગીતોમાં ખીલે છે તેટલા સોનેટમાં સંઝણ થતા નથી. એમનાં સોનેટમાં ક્યાંક છંદ અને પ્રાસ તૂટે છે. તેમનાં કેટલાંક ગીતો વેણીભાઈ પુરોહિત અને પ્રિયકાન્ત મણિયારની યાદ તાજ કરાવે તેવાં છે. ‘રાગ-પરાગ’ની કવિતામાં ઘણાં સુગેય ગીતો સંગ્રહિત થયાં છે. જેમકે....

“કાળજાં કંપે ને રુહિયા રડે માશારાજ  
ઘોડલા પલાણો રે / હવે જારું છે પરદેશ...”

(‘ગીત-૧’, પૃ. ૧૨૩)

“તમે મહ્યા આ મનસાને મેળે કે વિજોગણ વેદના રે  
અમે ઊભા આ આંસુના ખોળે કે વિજોગણ વેદના રે.”

(‘ગીત-૨’, પૃ. ૧૨૪)

“બ્લાલા રાયજી રે / દિલડાં દુલાણાં / મારાં કૂલડાં વીધાણાં રે  
આંખોમાં ઓરતા ઓળાય...”

(‘ગીત-૩’, પૃ. ૧૨૫)

“ભૂખી રે તલવારુ કોરી ધાર  
સોલેકી બાપુ ! નાગી રે તલવાર ભૂખી ધાર  
એક રે સંગાથે ભ્યાનુમાં રહીએ હો જી.”

(‘ગીત-૪’, પૃ. ૧૨૬)

“અમે તો ખારાં રે પાણી ખારા દરિયા  
ખારા ખારા વડવાનલની આગ  
ઊડા રે ઊતરો તો અત્યાગ માશશું.”

(‘ભીની ઠંચાનું ગીત’, પૃ. ૧૬)

આમ, ‘રાગ-પરાગ’ની કવિતામાં સ્વરૂપ અને વિષયનું વૈવિધ્ય અપાર છે. પ્રકૃતિ, પ્રણય, ચિંતન, વ્યક્તિમત્તા, મૂલ્યઙ્વાસતા, નગરજીવન, રાજકારણ તેમજ ઉર્મિકાવ્ય, અછાંદસ, સોનેટ, ગીત અને તાંકા આદિમાં કવિતા પોતાનો વિકાસ સાથી છે.

કિશોરસિંહ સોલેકીએ ‘રાગ-પરાગ’ની કવિતામાં પોતાની કાવ્યવિલક્ષણતાને કારણે આગાવી ઓળખ પ્રાપ્ત કરી છે. જોકે ઓમની કવિતામાં આલંકારિકતા અને

પ્રાસાનુપ્રાસનું તત્ત્વ વિશેષ અનુભવાય છે, તેથી કવિતામાં ક્યારેક કૃતિમત્તા પ્રવેશતી ભાસે છે. છતાં એમની કવિતા ભાવકને દુર્બોધ લાગતી નથી. સરળ અને સહજ પ્રત્યાયન એમની કવિતાની આગવી લાક્ષ્ણિકતા છે.

ટૂકમાં, સાદી, સરળ, સુગમ અને સ્પર્શક્ષમ અભિવ્યક્તિરીતિ, અનુભૂતિની સર્ચાઈ, ભાષાની આગવી છટા, જીવનનું વ્યાપક અને વિશિષ્ટ દર્શન, લોકથળોનું લયલાલિત્ય અને લયહિત્ખોળ એમની કવિતાના વિશેષ ગુણો છે.

૧

### પ્રક્રિયા

(૨૫૮) લાગણીના ઘરમાં આપણો : નાનુભાઈ નાર્યા, બીજી-૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૮૦, રૂ. ૪૦/- (૨૬૦) વાતે વાતે જીવન જબકે : અવંતિકા ગુજરાત, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૧૫૨, રૂ. ૧૨૦/- (૨૬૧) ચાલતા રહો, ને આજીવન તંદુરસ્ત રહો : જનક નાયક, પુનર્ભૂદ્ધશ ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૪૮, રૂ. ૩૦/- (૨૬૨) વિચારમેળો : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૧૪, રૂ. ૧૭૦/- (૨૬૩) વિચારવૈભવ : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૩૮, રૂ. ૧૮૫/- (૨૬૪) વિચાર-પ્રવાહ : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૦૬, રૂ. ૧૮૫/- (૨૬૫) વિચાર-સાગર : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૨૪, રૂ. ૧૮૫/- (૨૬૬) વિચારમંચ : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૧૬, રૂ. ૧૮૫/- (૨૬૭) વિચાર-યાત્રા : યાસીન દલાલ, ૨૦૦૮, સાહિત્યસંગમ, સુરત, પૃ. ૨૩૮, રૂ. ૧૮૫/- (૨૬૮) યોગ અને પ્રાક્ષણ્યામ : જનક નાયક, બીજી-૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૩૨, રૂ. ૧૮/- (૨૬૯) ગાંધીવિચારમંથન : સતીશ વ્યાસ, ૨૦૦૮, જન્મભૂમિ, જન્મભૂમિ ભવન, મુંબઈ, પૃ. ૧૦૫૮, રૂ. ૫૦/- (૨૭૦) પાંડે પાંડે રેખા : સંકેપ અને સંકળન : મહેશ દવે ૨૦૦૮, ઈમેજ પલ્બિકેશન્સ, મુંબઈ-અમદાવાદ, પૃ. ૪+૪૪, રૂ. ૩૫/- (૨૭૧) શનિમહિમા : મૂ. લે. વસુધા વાઘ, ભાવાનુવાદ : જ્યા. મહેતા, ૨૦૦૮, ઈમેજ પલ્બિકેશન્સ, મુંબઈ-અમદાવાદ, પૃ. ૧૬૭, રૂ. ૧૨૦/- (૨૭૨) અસીમને આગણો : ભાવાનુવાદ : સુરેશ ગાલા, ૨૦૦૮, એમ. એમ. ડક્કરની કું., મુંબઈ, પૃ. ૨૬+૧૧૭, રૂ. ૧૨૫/- (૨૭૩) એકાન્તનો વૈભવ : આચાર્ય યશોવિજયસૂરી, ૨૦૦૮, વિજયભદ્ર ચે. ટ્રસ્ટ, લીકીડીયાજી, પૃ. ૧૦+૧૭૮, રૂ. ૧૫૦/-

## સમીક્ષા/ગ્રંથવલોકન

### ‘જગરું’ : એક અનોખી અમરકથા | રમેશ બી. શાહ

[જગરું (સ્મરણકથા) : લે. નટવરસિંહ પરમાર, પ્ર.આ. ૨૦૦૮, પાર્શ્વ પલ્બિકેશન, અમદાવાદ, પૃ. ૧૪૬, ડિ. ૩. ૧૧૦/-]

‘જગરું’ નટવરસિંહ પરમારની સ્મરણકથા છે; એમના ‘વતનનું પ્રોઝાઇલ છે.’ એમનું વતન ડાંગના અરાજ્યના પચ્ચિમ સરહદી વિસ્તારમાં આવેલું છે. આજાદી પૂર્વે અંગ્રેજ શાસનની છત્રશાયા નીચે એ વિસ્તારમાં અનેક ઠકરાતો હતી; એમાંની એક ઠકરાત લેખકના દાદાજીની, દાઉંજની હતી. લેખકનો વતનવિસ્તાર આદિવાસી વિસ્તાર સુધી પ્રસરેલો હતો. એ રીતે તેમનો એ વિસ્તાર વીસમી સદીના પૂર્વાધારા એક અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર હતો.

એ વિસ્તાર તત્કાલીન રાષ્ટ્રીય પ્રવાહોથી સાવ અલિન રહ્યો હતો. લેખકે નોંધ્યું છે તેમ, “સામંતશાહી માહોલમાં સામાજિક વ્યવહારો, ખેતી, તહેવારો અને સામાજિક પ્રસંગોની ઠઠભરી ઉજવાણી, તીર્થયાત્રાઓ, રંગરાગવાળી જિવાઝનો, રામજાહીના નાચ, રામલીલાનાં માયણું, મહાભારત, ભાગવતનું શ્રવણ, રાજપૂતાઈ શાન, અને દબદબો એ તે એં યથાર્થ. એ યથાર્થનાં ધેન અને મદહોશીમાં આજાદીનું પર્વ ક્યારે ઊગી જાતે ભાન નહીં... મૂળ વાત એ કે રાષ્ટ્રમાં સંભવેલું એક પ્રચંડ આંદોલન, ખુલ્લ સુધીની માહિતી ધરાવતા બહુશુદ્ધ ગણ્યા એવા દાઉંજને ઝાંઝું અહ્યા સાર થઈ ગયું ??”

એક એવા સમાજનું ચિત્ર છે, જેને અંગ્રેજોના શાસન નીચે દેશમાં પ્રવેશેલી આધુનિકતાનો સ્પર્શ થયો નહોતો. આ સમાજ સહીઓ જૂની પરંપરાથી જિવાનું જીવન જીવી રહ્યો હતો, પરંતુ અપેક્ષા રાખી ન શકાય એ રીતે ગ્રામીણ માહોલમાં જીવેલાં પાત્રોમાં ભારે વૈવિધ્ય છે. આધુનિક પ્રવાહોથી સાવ વેગણું રહેલું આ જીવન શુષ્ણું કે નીરસ નથી. સ્વ. જ્યંત કોઠારીએ લેખક પરના પત્રમાં નોંધ્યું હતું તેમ, “‘જગરું’ વાંચીને ખુશ થઈ ગયેલો, એક નવી જ દુનિયા ઊંડાતી લાગેલી.” સાચે જ, નગરવિસ્તારમાં જ ઊંડરેલા કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા વાચકને ‘જગરું’ એક નવી દુનિયામાં લઈ જાય છે. ‘રેશનલ’ વાચકના ગણે ન ઊતરે એવી ભૂતપ્રેત, ડાકશ, ભૂવા ભગતની દુનિયા અહીં છે, પણ વીસમી સદીના પૂર્વાધારા ગુજરાતના ગ્રામીણ જીવનને તમે એના વિના કલ્પી ન શકો. આજના નાગરિકોને સાવ કપોળકલ્પિત લાગે એવી આ વાતો તત્કાલીન ગ્રામવાસીઓ માટે એક વાસ્તવિકતા હતી. અલબત્ત, એ વાતોને બાજુ પર રાખ્યા પદ્ધીયે ‘જગરું’માં જે માનવીય ચહેરો ઊપરો છે તે હદ્યસ્પર્શી છે. આમાં જે પાત્રોનાં જીવન વર્ણવાયાં છે તે પૈકી કેટલાંકના પ્રેમની વાતોમાં ‘જગતની અને સાહિત્યકૃતિઓની કેટલીક અમર પ્રેમકહાનીઓ પડધાય છે.

કેટલાંક પાત્રોની ખાનદાની અને માનવતા ચિત્તાકર્ષક નીવડે છે. સાવ પછાત ગણ્ણાત્મા આ ગ્રામીણ જીવનમાં કેવા કેવા માનવીઓ અસામાન્ય જીવન જીવી ગયા હતા તે જાણવા-જોવા માટે ‘જગરું’ એક આસ્વાદ્ય સ્મરણકથા બની છે.

‘જગરું’માં લેખક તેમનાં બાળપણનાં સ્મરણોનું પુનઃકથન (‘નોરેશન’ – narration) કર્યું છે. આ પુનઃકથનમાં તેમણે રજવાડી – ગ્રામીણ માહોલને જાળવી રાખ્યો છે. શિયાળાની ઠડી રાતોમાં દા’ઉજ્જાના આંગણામાં તાપણું (જગરું) કરવામાં આવતું હતું. એ રાવણામાં આવીને બેસતા ગ્રામવાસીઓની વાતોમાંથી ઊપસતી ઘટનાઓ અને પ્રગત થતાં પાત્રોને લેખક સાંભળ્યાં તે પ્રમાણે આવેખવાનો અભિગમ અપનાવ્યો છે. વાતો વર્ષો પહેલાં થઈ ચૂકી છે, પાત્રોને લેખક તેમના નાનપણામાં જ જોયા છે, પણ એ બધું જ લેખકના ચિત્તમાં બચાબર જળવાઈ રહ્યું છે. ‘જગરું’માં આવી ચેલી વ્યક્તિઓનાં સ્મરણો આવેખતી વખતે તે વ્યક્તિ તેમની નજર સમક્ષ હોય એ રીતે ની દેહાકૃતિ અને પોશાકની જીણી જીડી વિગતો તેમણે નોંધી છે. બે ટૂંકાં વર્ષનો જ ઉદાહરણ રૂપે નોંધીએ :

“અમારા આગવા જાંપણા વળાંકમાંથી અંધકાર પ્રવેશું પ્રવેશું કરતો હતો. જાણે એની પૂછું પકડીને એક પુરુષ અને સ્ત્રી જગરું પાસે આવી ઊભાં... બંને તરુણ પતિ-પત્ની કાળા સીસમના સોરા જેવાં શરીરે કઠણ હતાં. મખોટીએ બંને રૂદાં અને આકર્ષક.... સ્ત્રીએ મરાઠી ફબની સાડી પહેલી. માથે ઓફેલી. કાનમાં બુઢી, નાકમાં જાડી જડ, પગમાં કલ્યાં, હાથે કાચની બંગડીઓ. કાળા દેહમાં ઓગળેલું પહેલા પરોઢનું લાવાય.” (પ્રકરણ ૬)

“.... ઈશ્વાહીમકાકા દા’ઉજ્જાની વયના. ઉંચું ટાર અને ગોરું શરીર, બધાં બટન દીધેલું કિરમજ અચકન, સફેદ સુરૂવાત, ચણકતા કાળા બૂટ અને માથે ફેઝ – કાળા જૂમખાવણી લાલ તુર્ફી ટોપી એ એમનો પહેરવેશ.” (પ્રકરણ ૭)

લેખક આવાં જીણાવટભર્યા વર્ણનો કરી શક્યા છે કેમ કે નાનપણનાં એ ચિત્તો અને ઘટનાઓ તેમના ચિત્તમાં જડાઈ ગયાં છે. એનાં બે ઉદાહરણો નોંધીએ :

“.... પણ મારા ચિત્તમાં હજુ એ આખી ભૂત્યાળ હ્યાત છે, મને ‘નજ્યા’ વિના હ્યાત છે. પેલી મે’સાઇઝ (બેંસ)ની વલોપાતી આંખો તગતગ્યા કરે છે. ભગતના હુસ હુસ સાથેના ‘જા’ છી લૈરવનાથ’ પડધાયા કરે છે. અજજુ બાપુના ‘ધા તિરકિટ ધા’ સંભળણાં કરે છે. અને કોઈની કુવારકનાં જંગર ‘ધભમ, ધમાધમ ધભમ’ નર્તન કર્યા કરે છે, કર્યા કરે છે મારા ચિત્તના એકાંતમાં.” (પ્રકરણ ૮)

“.... અને બીજા દિવસે સવારે જિરધરલાલનો પડાવ અમારે ત્યાંથી ઊપરી ગયો. અમારાં આંગણાં સૂનાં મૂકીને, અમને નાટકના છંદે ચઢાવીને, સૂનાં આંગણો સ્મરણોની ડમરી ઊડતી મૂકીને. હજુથે મારા ચિત્તમાં એ ડમરી ઊડતી રહે છે, હા, નિલકુલ શમી નથી.” (પ્રકરણ ૮)

જગરુંના માહોલને લેખકે પુનઃ કથનનો અભિગમ અપનાવીને બચાબર જાળવી રાખ્યો છે. આ સ્મરણકથાને સાહિત્યના પ્રચલિત સ્વરૂપમાં ઢાળવાને બદલે તેને આપણી મૌખિક કથા-પરંપરાના સ્વરૂપમાં ઢાળવાનો અભિગમ લેખકે અપનાવ્યો છે. લેખકનો એવો કોઈ સભાન પ્રયાસ હોય કે ન હોય, આ કૃતિને મેં એ સ્વરૂપે જોવાનું પસંદ કર્યું છે. અલબટ, મૌખિક અને લેખિત સ્વરૂપે થતી અભિવ્યક્તિમાં જે તફાવત રહેવો જોઈએ તે આમાં

જળવાયો છે. તાપકાની આસપાસ નિરાંતની પળો ગાળી રહેલા ગ્રામવાસીઓ વચ્ચે જે અનૌપચારિક સ્વરૂપે લાંબા દોરે વાતો ચાલતી તેને એ જ સ્વરૂપે લેખકે અહીં રજૂ કરી છે. તેથી સાહિત્યિક વિવેચનાની પરિભાષામાં વિચારતા વિવેચકને આ કથાઓમાં ક્યાંક ક્યાંક અનાવશ્યક અને વિષયાંતરમાં સરી પડતો પ્રસ્તાર જણાશે. એને એવી લાગણી થઈ આવશે કે લેખક આ પ્રસ્તારને ટાળીને આમાંની કેટલીક કૃતિઓને ટૂંકી-લાંબી વાતરનું સાહિત્યિક સ્વરૂપ આપી શક્યા હોત. પણ લેખકનો આશય તો પોતાના નાનપણમાં જે વતનને જ્યા તેનું આવેખન કરવાનો જ છે. તાપકાની આસપાસ શિયાળાની રાતોમાં અલકમલકની વાતો ચાલતી હોય, હાજર શ્રોતાઓમાંથી કોઈ ને કોઈ વચ્ચે પ્રસ્તુત – અપ્રસ્તુત પ્રશ્નો પૂછું હોય, તેના જવાબો આપાતા હોય અને એ રીતે વાતોનો દોર લાંબાતો હોય. લેખકે એ શૈલીમાં અહીં તેનું પુનઃ કથન (‘નોરેશન’) કર્યું છે.

આમ ઇતાં જિવાઈ ગયેલા ગુજરાતના એક પ્રદેશના ગ્રામીણ જીવનની આ કથાઓ ગુજરાતીમાં આપણને વિવિધ લેખકો દ્વારા જે ગ્રામીણ ચિત્તો અને જીનપરી નવલકથાઓ મળી છે તેનાથી જુદી પડે છે. આમાં ગુજરાતના ગ્રામીણ જીવનનું કોઈ બીબાંઢાળ (stereotype) વર્ણન નથી. અહીં જે પાત્રોની આસપાસ વાતોનો દોર ચાલ્યો છે એ બધાંનું વ્યક્તિત્વ અને તેઓ જે જીવન જ્યાં છે તે કોઈ ને કોઈ રીતે નિરાણાં છે. વળી જગરુંના રાવણામાં આવતાં – ઉલ્લેખાતાં બધાં જ પાત્રો ‘ગ્રામીણ’ પણ નથી.

તેમાં આ ગ્રામીણ વિસ્તારના રજ્યૂપૂત રામસિંહ સાથે ઊંડા ‘લેટોનિક’ પ્રેમમાં પડતી અંગ્રેજ બાઈની પ્રેમકહાની છે અને તેના વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય છે. લશ્કરમાંથી નિવૃત્ત થઈને આવેલા, અંગ્રેજ અફ્સરની દીકરીના પ્રેમમાં પડેલા, પણ તેની સાથે લાન નહીં કરી શકેલા પ્રેમના વ્યબિચારી કહી શકાય એવા જીવનનું નિરૂપણ છે. પણ આ ‘મામાજ’ પાસે અપરિણીત રહીને વ્યબિચારને પંચે વળવા માટેનો તત્ત્વદર્શી ખુલાસો છે. આ કથાઓમાં ઠાકોરોના કોડાઓમાં વડારણો અને રામજણીઓ તરીકે જીવન ગુજરાતી કમભાગી સ્ત્રીઓની કરુણ કથની છે. કેટલાંક પાત્રો ‘શિક્ષિત’ કહી શકાય એટલું શિક્ષણ પામેલાં છે અને એમનું વાચન વિશાળ છે. ગ્રામીણ કથાઓમાં આવતું ભગતનું પાત્ર અહીં સુલેમાનચાચાના રૂપમાં આવે છે, પરંતુ એ અભિના સુશ્રીશ્રી અને બહુશ્રુત હોવાની સાથે આત્મબાની છે. અહીં પ્રેમની કથાઓ છે; પરંતુ ગ્રામીણ જીવનમાં શ્રાતિજન્ય નિરેધોમાંથી ઉદ્ભબતી કરુણતાના સ્થાને અહીં પરિસ્થિતિ અને પાત્રની વિલક્ષણતામાંથી ઉદ્ભબતી કરુણતા વિશેષ છે.

લેખકનો ઉદ્દેશ અહીં કેવળ અતીતરાગથી પ્રેરાઈને તેનાં સ્મરણો વાગોળવાનો નથી. લેખકે પ્રસ્તાવના રૂપે નોંધ્યું છે તેમ, “એ રાવણામાં અમારા લોકના રાની અભણખાઓ, લોહીના છંદપતિછંદો, પ્રાણના તડફડતા આવેગો, હૃદયમનના ઉદ્વેગો, સંતાપોના પ્રસંગો અને ઘટનાઓની વાતોના લાંબા દોરે અમારી રાતો ભાંગતી રહી હતી, શિશિરની ઠડી રાતો. ‘જગરું’માં એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન છે. ‘જગરું’ જગરુંએ ગુજરેલી રાતોની ચાતનું અભિનવ અસ્તિત્વ છે? મારી ચેતનાના રસાયણમાં ઉદ્ય પામેલું એક ન્યૂ એઝિઝસ્ટન્સ છે?”

લેખકને થયેલો આ પ્રશ્ન પુનઃકથન રૂપે કહેવાયેલી આ કથાઓના સ્વરૂપને સમજવાની

દિશા ચીધે છે. ‘જગરું’ના વાચકે એ યાદ રાખવાનું છે કે દાયકાઓ પૂર્વે લેખકે જે વાતો સાંભળી હતી તેનું આ પુનઃકથન છે. વીતેલા દસકાઓમાં લેખકે તેમનાં વાચન-મનન દ્વારા અને જીવનના અનુભવો દ્વારા જે સમજ ડેળવી છે તેની પ્રકાશમાં જગરુન્ના રાવણામાં સાંભળેલી વાતોનું, ઘટનાઓનું અર્થઘટન કર્યું છે. અથવા એમ પણ કહી શકાય કે વર્ષો પછી એ બધી ઘટનાઓનું તેમણે જે અર્થઘટન કર્યું છે તેના પ્રકાશમાં જ તેમણે એ ઘટનાઓનું પુનઃ કથન કર્યું છે. આ પુનઃ કથન આપણી કથાપરંપરાની નજીક રહે છે. રામાયણ કે મહાભારતની કથા કરતો કથાકાર મૂળ કથના નાનામોટા પ્રસંગોને યથાતથ જાળવી રાખે છે, પણ તેમનું અર્થઘટન પોતાની રીતે કરે છે. પાત્રોની વાતોને શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે જરૂર જાણાય તાં પોતાની ભાષામાં મૂકે છે ‘જગરું’માં લેખક એ અભિગમને અનુસર્યા છે. લેખકે જેને ‘અભિનવ અસ્તિત્વ’ કે ‘ન્યૂ એરિઝન્સ’ કહ્યું છે તેને આ પરિપ્રેક્ષયમાં જોવાનું છે.

પણ ‘જગરું’નો ઉદ્દેશ કથારસ પીરસીને કેવળ વાચકનું મનોરંજન કરવાનો નથી. ‘જગરું’ના માધ્યમથી લેખકે માનવજીવનને અને તેના વિવિધ આયામોને સમજવાનો પ્રયાસ કર્યો છે. જગરુંની બહાર લખાયેલા પ્રકરણ ‘ઘર મોઢાના પહાડી વગડે’માં લેખકની જીવનને સમજવાની મથામણ જોઈ શકાય છે :

“સાગરનાં ઊછળી ઊછળીને તત્ત્વે સ્પર્શવા મથાતાં મોજાંને તટે અથડાઈને ફીઝ ફીઝ થઈ જતાં જોઉં છું ત્યારે એ અર્થશૂન્ય ગતિનું, મારી હાજરી-ગેરહાજરીમાં અહનિશ્ચ ચાલ્યા કરતી એ ઉદ્દેશહીન પ્રવૃત્તિનું ભાન મારા ચિત્તને ગમગીન કરી મૂકે છે. તો તથી પ્રલંબાઈને આસમાનની સરહદમાં સરી જતો સાગરનો પ્રલંબ વિસ્તાર મારા ચિત્તમાં, એક પ્રકારનો ગેબી સૂનકાર બનીને વ્યાપી વળે છે.”

“તટ પર ફીઝ ફીઝ થઈને, વળી વળીને ફીઝ ફીઝ થઈને નિરર્થક ઘૂઘવાયા કરતા સાગરના ગેબી સૂનકારમાં મને રહી રહીને માણસની જિંદગીની – સંસારની અર્થશૂન્ય, આશયશૂન્ય ગતિનો અહેસાસ થયા કરે છે. એક વ્યર્થ ગતિનો તીવ્ર અહેસાસ.”

પણ ખરેખર શું માણસની જિંદગીની – સંસારની ગતિ અર્થશૂન્ય, આશયશૂન્ય, વ્યર્થ છે? જો લેખકને એવી પ્રતીતિ થઈ જ ગઈ હોય તો જિવાઈ ગયેલા જીવનની કથા મંદીને તેઓ કેમ બેઠા છે? વાત એમ છે કે પ્રકૃતિના જ એક અંગરૂપ માનવીઓની લીલાને અવલોકીને તેમાં, જો હોય તો, અર્થ શોધવાનો પ્રયાસ લેખકે આ પુનઃકથનમાં કર્યો છે. સાવ અર્થશૂન્ય જણાતા જીવનમાં માનવી શામાં જીવનની સાર્થકતા અનુભવે છે? શાન માટે જીવે છે? માનવીના જીવનનો નકશો કોણ આલેખે છે? આવા આવા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ લેખકે અહીં કર્યો છે. અહીં બધી જ પ્રશ્નોના ઉત્તર મળ્યા નથી, પણ ક્રાંક મળ્યા પણ છે.

જ્યાં જીવનને સ્પર્શતા પ્રશ્નોના ઉત્તર નથી જ મળ્યા એનાં એકબે ઉદાહરણ નોંધીએ.

“રાજુ, તખત તો વતનમાં સંદર્ભ ભુલાઈ ગયાં છે. જાણો એમની હયાતી જ ન હતી. પરંતુ, મારા ચિત્તમાં એ બધાં જીવી ઉઠે છે, અવારનવાર : જ્યાંના રાજુ, તખત અને માસ્તર ? સમયના એક એકમ પર એકબીજાથી બિલકુલ અલગ. એકબીજાના અસ્તિત્વથી પણ મુદ્દા અણજાણ. સમયના એક બિંદુએ એ બધાં મળી ગયાં. ચલાય એટલું સાથે ચાલ્યાં

અને વિખૂટાં પડી ગયાં. વજ જેવી આપત્તિ અને સંતાપ ખમતાં. બધું દટ્ટઈ ગયું એમની સાથે સમયની કબરમાં.” (પ્રકરણ ૧૦)

અહીં લેખકની મૂંજવણ સમજી શકાય એવી છે : બધું જ જો ક્યારેક સમયની કબરમાં દટ્ટઈ જ જવાનું હોય, ભુલાઈ જ જવાનું હોય તો જે કંઈ ઘટે છે તેનો કોઈ અર્થ છે ખરો? સમયના એક બિંદુએ એકમેકથી સાવ અજાણી બ્રિક્ઝિસ્ટો સમયના બીજા બિંદુએ મળી જાય છે; સાથે થોડું જીવી લે છે એને વિખૂટી પડી જાય છે. આ કોઈ યાદચ્છા(at random)પણ બનતી ઘટનાઓ હોય છે કે એમની પાછળ કોઈ ડિઝાઇન, કોઈ નકશો હોય છે?

માનવીના જીવનમાં બનતી ઘટનાઓનો નકશો કોણ દોરે છે? આ પ્રશ્ન લેખકને, તેના જીવનમાં બનતી અન્યાય અને શોષણી ઘટનાઓને સહી લઈને પણ કારમી ગરીબીમાં પણ પત્તીના સહારે જીવન જીવવાની હામ ધરાવતો શ્વમજ, જ્યારે પત્તીની બેવક્ષાઈથી આપધાત કરી લે છે ત્યારે થાય છે : “અમારાં તરુણ ચિત્ત છાણી ઉઠ્યાં. સમયના પટ પર એના જીવનનો નકશો અમારી કાર્યી આંખ સામે દોરાયો અને આજે ભૂસાઈ ગયો. અમારી આંખ સામે – અમારા ગામમાંથી.”

“– પરંતુ આજેય એ નકશો મારા મનની ભૌંય પર દોરાયેલો ટકી રહ્યો છે અને ...અવારનવાર મને રહી રહીને પ્રશ્ન થયા કરે છે કે માણસની જિંદગીનો નકશો કોણ દોરે પાતે? કે નકશો પહેલેથી જ તેયાર હોય?”

‘જગરું’માં એવાં બીજાં કેટલાંક પાત્રો મળી આવે છે, જેમને આવા તેયાર મળી જતા નકશામાં પણ તેમના જીવનની સાર્થકતા શામાં રહેલી છે એ પ્રશ્નનો ઉત્તર મળી ગમે છે. ગામમાં રામલીલા ભજવવા આવતા ગિરધરલાલ ‘રંગદેવતાને ચરણો આયપું વિતાવી દેવાની’ નેમ રાખીને જીવી રહ્યા છે. એમાં જ એમને પોતાના જીવનની સાર્થકતા દેખાય છે. બિનિશ શાસનના સનદી અધિકારીના ઓર્ડર્લિં તરીકે સેવા આપતા રામસિંહ અને એ ગોરા અધિકારીની પત્તી વચ્ચે ગાઢ પ્રીતિ બંધાઈ છે, પણ એ માણસ તેના પ્રેમને ત્યાગના સ્વરૂપે જ જુઓ છે અને એ બે પ્રત્યેની આજીવન વજાદારીમાં પોતાના જીવનની સાર્થકતા અનુભવે છે. (પ્રકરણ ૮) ઠકાત ભોગવતા દાઉંજ નિરાધારને આશ્રય આપવામાં અને તરછોડાયેલાઓને સહારો અને હુંસ આપવામાં જીવનની સાર્થકતા અનુભવે છે. ‘જગરું’માં જ્યાંય એમનું સીધું નિરૂપણ નથી છ્ટાં વિવિધ પ્રકરણોમાં આવતા તેમના ઉલ્લેખમાંથી અને પ્રસંગોપાત્ર થોડું જ બોલતા દાઉંજનું પ્રેમાળ, હમદર્દ અને પ્રભાવક છ્ટાં પ્રસન્નકર વિકિત્તવ ઉપસી આવે છે.

આમ નિરર્થક જણાતી પ્રકૃતિની લીલા અને તેના ભાગરૂપ માનવીના સંસારની અસારતામાં માનવી પોતે જે પરિસ્થિતિમાં મુકાય છે તેમાં પોતાના જીવનનો સાર, આપણી ભાષામાં ‘ધર્મ’ શોધી શકે એવું આચાસન ‘જગરું’ના કેટલાંક પાત્રોનાં જીવનમાંથી સાંપદે છે. અલબત્ત, અહીં સુલેમાન છે, જેમને જીવનનાને, અલ્લાહને અને ધર્મગ્રંથોને સ્પર્શતા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે, પરંતુ એ તો એક વિરલ વ્યક્તિ છે.

ઉપર નોંધ્યું છે તેમ, લેખકે ‘જગરું’ના લેખનાની શૈલીને આપણી કથાપરંપરાની નજીક રાખી છે. કથાકારની સફળતા તેના શ્રોતાઓને જકરી રાખતી તેની વક્તવ્યશૈલીમાં છે.

અહીં લેખકનું ગવદ વાચકને જકડી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રકરણ ૫ આમ તો ભૂવા, ભૂત, ભૈરવનાથની આજના વાચકને ગળે ન ઉત્તરે એવી વાતોની આસપાસ ચાવે છે, પણ તેમાં ભૂવાની કામગીરી બજાવતા ભગત દ્વારા થતી વિધિઓનું જે શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે તે વાંચતો વાચક એ દશ્યો એની નજર સામે બજવાઈ રહ્યાનો અને એ અવાજો કાને પડી રહ્યાનો ભાવ અનુભવ્યા વિના રહી શકે તેમ નથી.

બીજી બાજુ, રાજુ અને તખત વચ્ચેના પ્રગાઢ પ્રેમને તેઓ ખૂબ ઓછા શબ્દોમાં પણ પૂરી રેધકતાથી વ્યક્ત કરી શક્યા છે. રાજુના ભેટી મૃત્યુ પછી તખતસિંહ જે જીવન જીવો છે તેનું આ વર્ણન જુઓ :

“.... તખત જીવા કરતો. આસપાસની દુનિયાનું જાડો ભાન ગુમાવી બેઠો હોય તેમ જીવા કરતો. બિલકુલ જીવતો લીલોછમ માણસ અંદરથી જ આખો ને આખો સુકાતો ગયો, ઘટાદાર ઝડ સૂકું થતું જાય એમ.”

“અને થોડાં વર્ષો પહેલાં ભર ચોમાસામાં અનું રહ્યુંસંધું લીલું મૂળ પણ સંદર્ભ સુકાઈને મટી ગયું.”

“અમારા દદુએ કહેલું : ‘ચાર ખાંધ પર ચઢીને તખતની અર્થી નીકળી. ત્યારે ડાયુઓની સાથમાં એની પાછળ ચાલતા મારા મનમાં રહીરહીને ઊપરથા કરતું કે વર્ષો પહેલાં મૃત્યુ પામેલા, રાજુના મોત સાથે જ મરી ગેયેલા, માણસની સ્મરણનયાત્રામાં હું ચાવી રહ્યો હતો.’”

પણ લેખકના આગવા ગણી શકાય એવા ગવદનું વિરેચન મારે અહીં નથી કરવું. એ મારે માટે અધિકાર પણ નથી. એ કાર્ય અધિકારી વિરેચકો પર છોડું છું. પણ લેખકના ગવદના થોડા નમૂના વિવિધ સંદર્ભમાં અહીં અલપઽલપ આપ્યા છે એના આધારે શલાકાન્યાચે વાચકને લેખકની ગવદશક્તિનો અંદાજ આવી જશે.

## ‘એક ક્ષણનો ઉન્માદ’ : સ્થાપિત પરંપરાને અનુરૂપ | કદર્દ ૨. દેસાઈ

**એક ક્ષણનો ઉન્માદ** (વાર્તાસંગ્રહ) : હરીશ નાગેચા, ૨૦૦૭, રનાકે પ્રકાશન, તેમી પૃ. ૨૩+૨૫૩, રૂ. ૧૩૫૪]

‘એક ક્ષણનો ઉન્માદ’ એ હરીશ નાગેચાનો ચોથો વાર્તાસંગ્રહ છે. તેમાં સતત ટૂંકી વાર્તાઓ છે. અગાઉની જેમ અહીં પણ સ્ત્રીસંવેદનાને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓ તો છે; તદ્વિપરંત શહેરી જીવને માણસને, માનવસંબંધોને કેવી રીતે ઉસ્તર્બ કરી દીધા છે તેની પણ કેટલીક સારી વાર્તાઓ સાંપડે છે. આવી વાર્તાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે ‘મમરિયો’.

પ્રજાસત્તાક દિન પહેલાં ટ્રાફિક સિગનલ પર બે-ત્રણ રૂપિયામાં વેચાતા પ્લાસ્ટિકના રાષ્ટ્રવજ જોઈ અકળાતા સ્વાતંત્ર્યસેનાની મોહનલાલ અને બીજી બાજુ એવી જ નિર્દોષ દેખાતી પ્રવૃત્તિ કરતાં કરતાં આતંકવાદી કૃત્યો કરનારા યુસુફ મુસાનો ઇન્ટરવ્યુ એમ જે પરિસ્થિતિને સાથે વાર્ષિકતી વાર્તા ‘મમરિયો’ બધિર અને સંવેદનહીન રાષ્ટ્રભાવનાને

યથાતથ ઉપાડી પાડે છે. મમરાના લાડુની લાલચે એક કિશોર ક્રમે ક્રમે મુંબઈને દહેશતની ગર્તમાં ધકેલનાર ત્રાસવાદી કેવી રીતે બની જાય છે તે યુસુફ મુસાના કમશા: વિકસતા પાત્રાલેખન દ્વારા સરસ નિરૂપાયું છે તો સામે તેને સલામ ઠીકતો પોલીસ કોન્સ્ટેબલ કે માત્ર લોકોના મનોરંજનમાં જ રચીપણી રહેતી ન્યૂઝ ચેનલ કે ભવિષ્યની પેઢીને કેળવવાની જવાબદારીમાંથી છટકી જતી આજની પેઢી - બદ્દુ અને અનિકેત વગેરેનું આલેખન વાચકને બેચેન કરી મુકે એવું થયું છે. આશા તો છે, ભલે વૃદ્ધ તો વૃદ્ધ મોહનલાલ - નામ પણ સંકેતિક છે ! રાષ્ટ્રવજનું ગૌરવ જળવાય તે માટે પગે રગડોળાતા ધજને એકદા કરવાનું નક્કી કરે છે પણ બહુમતી તો એવી જ નિંબર અને પોતાનામાં જ મસ્ત અનિકેત જેવી છે જે એટે તો એ વિચારે છે... “દોસાનું ખસી ગયું છે કે શું ?”

મુંબઈ પરના તાજેતરના હુમલાએ આ વાર્તાના સત્યને એકદમ સ્પષ્ટ કરી આવ્યું છે, નાની નાની લાલચોથી ઉપર ઉઠીને દેશના ગૌરવને આગળ નહીં મૂકીએ તો પરિણામે સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ જોગમાં મુકાવાનું જ છે. એક વાર્તાકાર સમાજ સાથેની એની નિસ્બત આથી વધુ દફ્તા અને માર્મિકતાથી કદી રીતે વ્યક્ત કરી શકે ?

‘ઝોલાં ખાતો માણસ’ સત્ય અને ભિથાને નવા સંદર્ભથી ચકાસતી વાર્તા છે. યશવર્ધનની એકવીસમી નવલકથાના પ્રકાશન સમયે લેખકનો ઇન્ટરવ્યુ ધાપવાના તંત્રીના નિર્ણયને પરિણામે પત્રકાર કામ્યા વયોવૃદ્ધ લેખકની મુલાકાતે જાય છે. વારંવાર ઝોલે ચઢી જવાના પરિણામે સરખો ઇન્ટરવ્યુ ન લઈ શકતાં અકળાયેલી કામ્યાની નજરે મોટી સાઈઝનાં કાર્બૂઝ ચઢે છે. આ કાર્બૂઝમાં, આજના યુગની તારીખે પોતાનું સત્ત્વ, સ્વમાન જાળવી કેમ આગળ વધુવું તે સંબંધી પોતાની પુત્રીને સંબોધાને કરેલા અનેક ટાંચણો મળે છે, જે યશવર્ધનને સમાજ સાપેક્ષે મુક્કી ઉંચેરા સાબિત કરે છે. કામ્યાએ લીધીલો ઇન્ટરવ્યુ પ્રગત થતાં જ એક ઝોન આવે છે : “યશવર્ધન તો બેચલર છે, બદનક્ષીનો દાવો માંગીશ.” જે તંત્રી અને પત્રકારને ખણભણાત કરતા મૂકી દે છે. તંત્રી માર્જીનામું સૌંપવા જણાવે છે. કામ્યા કહે છે, મારી પણ એમનો અવાજ કેમ છે ? સત્ય કરતાં વિગતો ચઢિયાતી કેવી રીતે હોઈ શકે ? એમની ફેન્ટસી એમની સર્જનાત્મકતાનું રહસ્ય છે અને માર્જીપત્ર આપવાની ના પાડે છે તંત્રી રાજનામું માંગે છે અને કામ્યા માર્જીપત્ર અને રાજીનામા વચ્ચે ઝોલાં ખાઈ રહે છે !

સુંદર ! લેખક યશવર્ધન વાર્ધક્યાના લિધીલ જોખે ચઢે છે તે ઝોલું તો વાસ્તવમાં સત્ય અને કલ્યાના વચ્ચેનું ઝોલું છે પણ સત્ય અને કલ્યાના વચ્ચેનું એ દ્વંદ્વ પત્રકાર કામ્યા સુધી પહોંચાતા સ્વમાની અને વ્યવહારુપણા વચ્ચેનું બની રહે છે ! આમ, ઝોલાં તે જાણે માણસ માત્રાની નિયતિનો એક છિસ્સો બની રહે છે !

ભદ્રાની કરુણ નિયતિની વાત ‘માખી’ વાર્તામાં થઈ છે. ચોખાઈ અને ચીવટાઈની આગાઉની ભદ્રાને શરદ રૂપે લઘરવઘર અને અભ્યવસ્થાના પર્યાય સમો પત્ર મજ્જો છે. ભદ્રાના સુધુ વ્યક્તિત્વથી અભિભૂત થયેલો શરદ લઘુતા પામતો કમશા: નફફટ અને ઉદ્ધત બનતો જઈ લગ્નેતર સંબંધોમાં રાખે છે. સતત માનસિક યંત્રણ વેઠતી ભદ્રાને જે ક્ષણે જાણ થાય છે તે પત્ર, અન્ય કોઈ નહીં પણ કામવાળી રાધાબાઈ સાથે જ જોડાયેલો છે તે ક્ષણે તીવ્ર માનસંભંગ અનુભવી માનસિક સંતુલન ખોઈ બેસે છે. ભદ્રાના સવાયા વ્યક્તિત્વ સામે તેના પત્રની ડેસિયત માખીથી વિશેષ નથી. ભદ્રાએ પોતાના સ્વમાનને રક્ષી લગ્નના બોજામાંથી

જાતને મુક્ત કરી હોત તો તે વિરલ નાયિકામાં સ્થાન પામી માનને હક્કદાર બની હોત અને વાર્તાવાચકોએ એની પ્રશંસા કરી હોત પણ વિદ્રોહ કરવો એ સરળ બાબત નથી. તેથી તેમ ન થતાં ભદ્ર માનસિક સંતુલન ખોઈ નિતાંત કરુણાને પામે છે. વાતોમાં સંપ્રતિ સમયે પણ સ્વી કેવી તો લાચાર જીવે છે તે સહજતથા નિરૂપાયું છે.

નૈતિકતા અને ધારાધોરણોનો અભાવ, બદલાયેલાં મૂલ્યો, અંગત સંબંધોને પણ કેવા તોડીઝોડી મૂકે છે તેનું નિરૂપણ ‘દ્રોહકાંડમાં જોવા મળે છે. ટીકરાને મેડિકલમાં જરૂરું છે. પૈસા ખર્ચી પેપર મેળવી આપો તો સરળતા થાય. મા-દીકરાના આવા આગ્રહ સાથે કથાનાયક ભીષ સંમત નથી. સ્વાર્થ અને નાગરિક ધર્મના ધરા આકાશ વચ્ચે નિરંસુની જેમ અટવાવા કે જીલ્યા કરવાને બદલે ફુંબના તાત્કાલિક લાભ-સ્વાર્થમાં ન ફસતાં સમગ્ર સમાજના સ્થાયી સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને પેપર ફોડી આપતી ટોળકીનો પર્દફાશ કરવાના સંકલ્પ સાથે ભીષ પોલીસર્ટેશને પહોંચે છે.

સમાજહિતચિંતાને બદલે સ્વાર્થપરાવયણતા સ્થાપિત થઈ જાય એ પહેલાં કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે, કદમ માંડવાં પડશે, ભલેને અવાજ ક્ષીણ કેમ ન હોય, કે ડગલું એક જ કેમ ન હેવાય ! ઘયાટોપ અંધકારની કાલિમા વચ્ચે ભીષનું સૂચિત એક પગલું આશાનું એક કિરણ બની રહે છે.

એકમેકને ચાહતા હોવા છતાં અથવા તો ચાહવાના કારણે જ એકબીજા માટે સમસ્યારૂપ બની ગયેલા વ્યક્તિત્વોની વાર્તા એટલે ‘બારીથી બારી સુધી’. આધુનિક, શહેરી દ્વારા જીવનમાં સમજણ, ઉદારતા અને સહનશીલતાનો વધતો જતો અભાવ એ સંબંધને કેવો અને કેટલો વેરવિભેર કરી મૂકે છે તેનું તાદદ્ય નિરૂપણ આ વાર્તામાં મળે છે.

બીમાર પિતાને લઈ જતી ગામડાગામની પુત્રીને જોઈ કથાનાયક અને બસમાં સફર કરનારા અન્ય યાત્રીઓ જે અન્યથા કલ્યાણ કરે છે તે પણ શહેરી સમાજ જે રીતે લાગણીશૂન્ય બંધિયાર અને વિવેકભાન વિનાનો થઈ રહ્યો છે તેનું દ્વાળિયું પરિણામ ‘નજરકેદ’માં જોવા ચાલે છે. આ જ શહેરીજીવનની તાજ બાળપણને તો ભરખી જ ગયું છે. હવે તે માતૃત્વને શી રીતે ભરખી જવા માંડયું છે તેની ચિંતા ‘હું જાઉ, ભીજાઉ !’માં સુંદર રીતે આવેખાઈ છે. જોકે પિતાના સ્વસ્થ અભિગમના પરિણામે માતા-પુત્રીના સંબંધ પણ નોર્મલ બની, જે મળી તે ક્ષણોને જીવી લેવાના હક્કારાત્મક અંત ભાડી લઈ જાય છે. ‘આ શહેર સદશો મને’ વાર્તા શહેરી સમાજના મધ્યમવર્ગાંથી માનસને ઉઘાડી આપતી સુંદર વાર્તા છે. ટૂંકી અને એટલે જ સરસ આ વાર્તા વાંચતાં એક પ્રશ્ન એ પણ ઉદ્ભબે છે કે લેખકને લાઘવબર્યું નિરૂપણ આતલું સિદ્ધ હોવા છતાં અન્ય કેટલીય વાર્તાઓ શા માટે લંબાવ્યા કરતા હોય ભલા ! જેમ કે ‘ઉડાન’. તો ‘અગનાખેપ’ પણ માતા-પુત્રીના સંબંધને નિરૂપતી નબળી વાર્તા છે. તેની સામે ‘ઝાલી ન જલાતી છોકરી’ મૂકો. સરખાં વિષયવસ્તુ પણ વાર્તાની ટ્રીટમેન્ટ જીદી અને તેથી પરિણામ પણ જુદું. ‘ઝોર અ કપ ઓફ કોફી’ લગ્ન પૂર્વના સંબંધને પુનઃ આસ્વાદવાના ઓરતા જેવા વિષયને કેન્દ્રમાં રાખી લખાયેલી છે. પણ એ વાર્તા કરતાં રેડિયો-એકાડી જેવી વધુ લાગે છે. જોકે પતિ-પત્ની વચ્ચેની એકબીજાને ગિલ્ટી ઝીલ કરવવાની રમત રસ પડે તેવા સંવાદોમાં લખાઈ છે.

‘એક કાશનો ઉન્માદ’ એ સંગ્રહની શીર્ષકવાર્તા છે. લેખકના આરંભકાળમાં લખાયેલી

ઘટનાવિહીન વાર્તાઓની જેમ આ વાર્તા પણ માત્ર પાત્રની મનોમયતામાં રાચે છે અને અંતે જતા અગ્રાઉની એક વાર્તા ‘સુમન મળી હતી’ની યાદ અપાવી જાય છે. ‘સુમન મળી હતી’ વાર્તામાં તો નાયકની ઉદાસી વાચકને પણ બેચેન કરી મૂકવા સક્ષમ હતી. પણ આ વાર્તાનો ઉન્માદ વાચકને પાગળ તો ટીક, વિચલિત કરી મૂકવા જેટલો પણ પ્રબળ નથી !

‘અભિસાર’ અને ‘રિમલિમ’ આજની યુવા પેઢીની મુંઘતાની વાર્તા છે જ્યાં લગ્ન પહેલાંના અફેર કોઈ મોટી વાત નથી કે પદ્ધી દૈહિક એષાણાઓ પ્રગત કરવામાં કશો છોછ નથી. ‘અભિસાર’ વાર્તાની નાયિકા તનુ, ધ્રુવના ઘરે સાવ એકાંતમાં તેના પ્રેમી અભિને મળવા જવાની છે તેનો રોમાંચ ક્ષણે ક્ષણે અનુભવે છે. પરંતુ ક્યાં મળીશું ? એ વાતે પ્લેટફોર્મ નંબર એક અને ચાર વચ્ચે થયેલી ગેરસમજથી મિલનનો સધળો સમય પ્રતીક્ષામાં વીતે છે અને જરાક અમસ્થી શાબ્દિક ટ્પાટ્પીના અંતે તનુ વળતી લોકલ પકડી અભિને છોડીને નીકળી પડે છે.

બધું જ વહેલું અનુભવી લેવાની ઉતાવળ, અસહિષ્ણુતા, પ્રેમની ઊરી લાગણીને બદલે છીછરું આકર્ષણ, વાતે વાતે ઘાવતી લાગણીઓ અને બટકી પડતો અહમ્ - વર્તમાન પેઢીની બધી જ લાક્ષણિકતા આ વાર્તામાં આવેખાઈ છે. એ સાથે તનુમાં જીવતી બીજી તનુ - અંતરાત્મા કહીશું એને ? સાથે સતત ચાલતો સંવાદ, અને રોકવાની કોશિશ કરે છે એટલે સંસ્કારોનું પ્રભુત્વ હજુ બાકી છે, પણ એ ક્યાં સુધી ટકશે ? એવો પ્રશ્ન જરૂર થાય છે કેમ કે અંતે બીજી તનુ પહેલી તનુને પૂછે છે, “અંખમાં પાણી કેમ આવ્યા ?” દુઃખ શી વાતે થયું ? અભિને છોડીને આવવાનું થયું તેથી કે આખી બપોર જે રીતે માણવા ચાહી હતી તે પ્રમાણે માણી શકાઈ નહીં તેનું ?

‘રિમલિમ’ વાર્તામાં બોયહેન્ડ સાથે ફ્લિટ્મ જોવા ગયેલી રિમલિમની નજર સામે જ શર્મનાનું અપહરણ થાય છે ને પછી જે વરવી વાસ્તવિકતા અને નાટ્યાત્મકતાનો સામનો કરવો પડે છે તે કોઈ રોમાંચયક ફ્લિટ્મથી કમ નથી; શર્મન જેવા જ ગેંગસ્ટર મુનીર મછલી - પણ ના, વાર્તાસાર કહી દઈશ તો તમને મળા નહીં પડે ! એના કરતાં વાર્તા જ વાંચો ! પછી મન થાય તો મને કાગળ લખજો. તમે પણ રોમાંચયક ફ્લિટ્મ જોયાનો આનંદ પામ્યા કે નહીં આ ‘રિમલિમ’ વાર્તામાં !

નારીકેન્દ્રી અન્ય વાર્તાઓમાં ! ‘કુકુ - એક અનુભંધ’માં કવેળાએ શરીરની ધમનાને પૂરી કરવા ઉતાવળે લગ્ન કરી લેવા અને પોતાના જીવનનું ધ્યેય ખોઈ બેસવાના કારણે અકાળે મૃત્યુ પામતી કુકુની વાર્તા નાયક મન્યાની સાપેક્ષતામાં કહેવાઈ છે, તો ‘ઝાલી ન જલાતી છોકરી’માં નિત્યા, યુવાન થયેલી દીકરી ચીકુ પુરુષશરીર પાછળ પોતાની કારકિર્દીનું સત્યાનાશ ન વાળે તે માટે પોતે વેઠેલી પીડા દૈહિક આકર્ષણને વશ થઈ પ્રેમમાં પડી લગ્ન બાદ પોતાનું લક્ષ ખોઈ, જાત સામે જ આપમાનિત થઈ તેમાંથી કેવી રીતે પાછી વળી અને શું શું સહન કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી તેની વિગતે વાત કરી છે.

આ બંને વાર્તા જાણી પરસ્પર પૂરક બની રહી છે અને એક અત્યંત આવશ્યક હાઇપોથિસીસ સમાજ સમક્ષ મૂકે છે કે યુવાવે સ્વીશરીરમાં થતા હોર્મોન ચેઠિન્જસના કારણે પુરુષ તરફ થતા આકર્ષણને સહજતથી લેવું જો ઉછાળા અદ્ભુત હોય તો લગ્ન પહેલાં શરીરસંબંધ બાંધવો, પણ લગ્નની ઉતાવળ ન કરવી, પોતાનું લક્ષ્ય છોડવું નહીં.

જો ધ્યેય ચૂક્યા તો પોતાની ઓળખ જોઈ જાત સામે જ અપમાનિત થવાનો વારો આવશે.

આ બે વાર્તા અને અન્ય ડેટલીક વાર્તાઓ ‘ઉડાન’ ‘અમિસાર’ ‘ઝોલાં ખાતો માણસ’ વગેરેમાં પણ આ વિચાર એક યા બીજી રીતે મુકાયો છે તે જોતાં લેખક પોતાના આવા જીવનતારણને ખાસ્સા ગંભીરતાથી લેતા હોય તેમ જ્ઞાય છે પરંતુ તે સ્વી માટે અને પરિણામે સમાજ માટે ડેટલું ઉપકારક હશે તેનો આગામી સમય જ કહેશે.

લેખક પાસેથી આ સંગ્રહ પહેલાં ‘કૂલો’, ‘કુલરી’, ‘કેટવોક’, ‘પદભાઈ’ જેવી નારીસંવેદનાની ઉત્તમ વાર્તાઓ સાંપડી હતી તે બરની એક વાર્તા અહીં નથી તે નોંધવું રહ્યું. જોકે સંગ્રહમાં ‘મમરિયો’ અને ‘જોવા ખાતો માણસ’ જેવી ઉત્તમ વાર્તાઓ તો છે જ અને ‘માખી’, ‘આ શહેર સંદર્ભ મને’, ‘હું જાઉં બીંજાઉં’, ‘ડ્રોહકાંડ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ પણ મળે છે. આમ, આ સંગ્રહમાં પણ વાર્તાકાર એમની વાર્તાદેખનની ક્ષમતા દર્શાવે જ છે. સરવાળે એવું કહી શકાય કે પોતે સ્થાપેલાં ધોરણ મુજબની વાર્તાઓ અહીં અલબત્ત મળી છે પણ તેને વળોટી આગળ વધી શકાયું નથી. આ વિધાનની સાથે એક સ્વીકારોક્ષિત એ પણ કરી લેવી જોઈએ કે પાંચ અંગળીઓ સમાન નથી તો વાર્તાઓ પણ તેના પ્રભાવ સંદર્ભ અસમાન હોઈ શકે ! હા, વિષયમાં વૈવિધ્ય જરૂર ઉમેરાયું છે તેથી આગામી સમયમાં એવી વાર્તાઓ સાંપડશે જ તેવી આશા અસ્થાને નથી કેમ કે હરીશ નાગ્રેયા સિદ્ધ વાર્તાકાર તો છે જ.

સંગ્રહમાં લેખકે પ્રસ્તાવનામાં પોતે વાર્તા કેવી રીતે લખે છે કે નારીને સંવેદનની વાત આટલી સરસ રીતે વાર્તામાં કેમ મૂકી શક્યા છે, તેની વિગતે વાત કરી છે તે અભ્યાસુને ઉપયોગી નીકલશે.

## સાચા સૌંદર્યનો સુરેખ માહિમા : ‘એક રૂપકથા’ | ડૉ. પ્રવીષભાઈ એસ. વાઢેલા

[‘એક રૂપકથા’ : શ્રી રઘુવીર ચૌધરી, પ્ર. આ. ૨૦૦૬, પ્રકાશક : સાહિત્ય સંગમ, સુરત, ક્ર. ૧૨૫/-]

સાહિત્યનાં અનેકવિધ સ્વરૂપોમાં જેમની કલમે નોંધપાત્ર કૌવત દાખબ્યું છે તથા ગુજરાતી સાહિત્યમાં જેમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે તેવા અચિમ હોરેણા સર્જક શ્રી રઘુવીર ચૌધરીનું નવલકથાક્ષેત્રે ધ્યાનાર્થ પ્રદાન રહ્યું છે. ‘અમૃતા’, ‘લાગણી’, ‘શ્રાવશરાતે’, ‘આવરણ’, ‘વેણુવત્સલા’ તથા ‘ઉપરવાસ – સહવાસ – અંતરવાસ’ જેવી કથાત્રથીના સર્જકે આ ઉલ્લેખ સિવાય પણ ઘડી જ પ્રશંસનીય નવલકથાઓ ગુજરાતી સાહિત્યને સંપડાવી છે. આવા સબળ સર્જક પાસેથી આપણાને એક વધુ નવલકથા લેખે ‘એક રૂપકથા’ – આસ્વાધાયથી સભર એવી સ-રસ કૃતિ છે. સાહિત્ય સંગમના પ્રકાશન હેઠળ પ્રકાશિત આ નવલકથાનું તે જ વર્ષમાં થયેલું પુનર્મુદ્રણ તેની લોકપ્રિયતાનું સૂચક છે.

અસ્તિત્વવાદી વિચારધારાનો સર્જનાત્મક ગંધથી બળ્ણો અનુભવ તેમણે ‘અમૃતા’માં ખૂબ જ રસપૂર્વક કરાયો છે. જીવન અને જગત સાથે જોડાવેલા સનાતન મૂલ્યો કે પ્રશ્નોની વિશાદ છણાવત તેમની નવલોમાંથી આપણાને પ્રાપ્ત થયા જ કરે છે. પોતાના મનમાં સતત

રમ્યા કરતા અને ઉપરતળે થતા કોઈક નિજ દર્શનને આવેખવા જ સર્જકો નવલકથાપંચ આદરે છે. પરંતુ એ નોંધવું જોઈએ કે દરેક વખતે દરેક સર્જકો પોતાને પ્રાપ્ત દર્શનને નવલકથાસ્વરૂપમાં સંઘટિત કરી શકતા નથી. આ બાબતે શ્રી રઘુવીર ચૌધરીની નવલોને અપવાદરૂપ ગણાવી શકાય. ‘એક રૂપકથા’માં તેમણે જે મૂલ્યોની માવજત કરવાનું ધ્યાર્યું છે તેમાં તેઓ સક્ષમતાથી પાર ઊતર્યા છે.

નવલકથાની માંડળી હેતુવિલીન હોઈ શકે જ નહિ. નવલકથાકાર ભાવકને કોઈક હેતુ સંપદાવવા જ તેની રચના આદરે છે. ‘એક રૂપકથા’ના નિવેદનમાં શ્રી રઘુવીર ચૌધરી જગ્યાવે છે કે, “જે કહેવા માટે આ કથા રચી છે એ તો આ દેશમાં સદીઓથી કહેવાનું આવ્યું છે : સૌંદર્ય, સત્ય અને શિવાનું અવિરોધી હોય. સૌંદર્યની શક્તિ અન્ય છે. પણ જે સૌંદર્ય વ્યક્તિ, દાંપત્ય, પરિવાર અને સમગ્ર પરિવેશને ઋષી કરે છે એ તો છે, સમગ્ર વ્યક્તિત્વનું સૌંદર્ય. આ વાત વિચાર અને સંવેદનના સંયોગે પ્રત્યક્ષ કરવા પ્રયત્ન કર્યો છે.”

નવલના નિરૂપિત વસ્તુમાં આવેખાય છે ભારતીય સમાજની વર્ષોજૂની કુરિવાજ ગણાતી બાળલગ્નની ઘટના. સર્જક ગૌરી અને બળવંતસિંહના બાળલગ્નને ઊડળમાં લઈને સૌંદર્ય, સત્ય અને વ્યક્તિત્વનાં વિભિન્ન હકારાત્મક પાસાઓનું ઝીણવટબર્યું નકશીકામ કર્યું છે. બંને પાત્રો રૂપની બાબતમાં સામસામે છે છે. ગૌરી છે. રૂપ રૂપનો અંબાર. તેની બહેનપણી એલિટ તેને પ્રથમ વાર એક સંગીત કાર્યક્રમમાં જોતાં બોલી ઊઠે છે, ‘અસલ ભારતીય ચહેરો !’ ગૌરીની બરાબર વિરોધમાં બળ-બુદ્ધિ, વિદ્યા બધું જ નોંધું પણ મોં પર સુંવાળપણું નામ નહીં એવો બરછટ, પડછંદ સાચા અર્થમાં બળવંતસિંહ. નવલકથામાં બળવંતસિંહનું પાત્ર ધીમે ધીમે ખૂલતું જઈને ભાવકની સહદ્યતા પામતું જાય તેવું ઉંદ્રષ્ટ છે. એક રૂપની બાદબાડી કરીએ પછી બળવંતસિંહનાં એટલું બધું સભર વ્યક્તિત્વ છે કે ભાવક તેના પ્રગાઢ પ્રેમમાં પડી તેની સમજા વિશે અહોભાવનો અહેસાસ કરે છે. અનેક જુદા જુદા પ્રસંગોએ જે ધીરજ, સહનશીલતા અને ઔદ્ઘર્ય બળવંતસિંહ ઘાખવે છે તે પ્રશંસનીય છે. કુદરતી ખેતીમાં રસ ધરાવતો તે અર્થશાસ્ત્રનો તેજસ્વી વિદ્યાર્થી હોવા છતાં પૈસાની સ્વાર્થી ગણતરીઓથી જોજનો દૂર છે. ગરીબ અને પણાત કુટુંબોને તેના દ્વારા થતી મદદ સમજ પ્રયેની નિસબતનું ઉમદા ઉંદહરણ છે. બળવંતસિંહ ગૌરીને ખૂબ જ ચાહે છે પરંતુ તે પોતાની કુરુપતાથી સભાન છે એટલે ગૌરીને તેનો નિર્ણય લેવામાં મુક્ત રાખે છે તે તેની આગવી ચાહત છે.

ગૌરી અભ્યાસ ને વિધવિધ કલાઓમાં રૂચિ ધરાવતી સૌંદર્યની મહારાણી છે. કિશોરાવસ્થામાંથી યૌવનમાં પદાર્પણ કરતી ગૌરીને તેના જીજાજી દોલતસિંહ વારંવાર તેના સૌંદર્યને પ્રશંસનીય છે. કુદરતી ખેતીમાં રસ વધુ ને વધુ તિરસ્કાર ઊભો કરે છે. આની સાથે સાથે બળવંતસિંહની અરૂપતાનો કે કુરુપતાનો ઉલ્લેખ ગૌરીના મનમાં વધુ ને વધુ તિરસ્કાર ઊભો કરે છે. દોલતસિંહની પત્ની માયાદેવીને બળવંતસિંહનું ઉંદત વ્યક્તિત્વ આકર્ષે છે. તે હંમેશાં બળવંતસિંહનો પક્ષ લેતી રહે છે. ગૌરીની વિદેશી બહેનપણી એલિટ પણ બળવંતસિંહની પીઠ, ચાલ અને ચારિયથી અંજાય છે. આ બધાં પાત્રોની મદદથી ને પરિસ્થિતિના વળાંકથી ગૌરીનો તિરસ્કાર નવલકથાના અંતે જતાં પ્રેમમાં ફેરવાઈ જાય છે. ઘડીબધી વિકટ સ્થિતિઓમાંથી ઉગારનાર બળવંતસિંહનું આંતરિક સત્ત્વ, સત્ય અને સૌંદર્ય ગૌરીને પ્રભાવિત કરે છે. આ સમયે તેના

આકર્ષણ અને આદરનું પાત્ર દોલતસિંહનું કપટી વ્યક્તિત્વ ખુલ્લું થઈ જવા પામ્યું છે. એશાઓરામ, વૈભવ- વિવાસમાં જીવતા તેમણે ગૌરી અને તેની માતા કલ્યાણીની તમામ મિલકત હડપ કરી લીધી છે. માયાદેવીને દુઃખી કરતા દોલતસિંહનું ખરું સ્વરૂપ ગૌરીને તેના તરફ તિરસ્કારનો ભાવ પ્રગટારે છે જે અંતે જતાં ગૌરી-બળવંતસિંહ એકત્ત્વમાં વિરમે છે. અહીં કથાનો મધુરેણ સમાપનેટું ભાવકને વધુ કૃતિ માયાનો આનંદ સંપદારે છે.

‘સરસ્વતીચંદ’ મહાનવલની જેમ અહીં પણ સર્જકે પાત્રોનાં નામ ગુણ પ્રમાણે રાખ્યાં હોવાનું જોઈ શકાય. બળવંતસિંહ સાચા અર્થમાં બળ-બુદ્ધિ બળવાન છે. તેના પિતા શક્તિસિંહ આઈ.પી.એસ. અધિકારી હતા તો તેનાં માતા જાનકી ધીરજ અને સહનશીલતાની કાર્યમૂર્તિ સમાં છે. ગૌરીની સરખામણી સહજ રીતે પારવી સાથે કરી શકાય. બાધ્ય દેખાવથી કુરુપ પતિ શંકરને તેઓ ઘણી તપશ્ચર્યા બાદ પામે છે. ગૌરી પણ પતિ બળવંતસિંહને પ્રાપ્ત કરવામાં ઘણા લાંબા સમયની તપશ્ચયામણી પસાર થાય છે, પરંતુ તે પુરાણાની ગૌરીની જેમ નહિ, આપણા સાંપ્રદાને અનુલક્ષીને જરા જુઈ રીતે. માયાળુપણું ધરાવતાં માયાદેવી અને તેમના પતિ સાચા અર્થમાં દોલતના ભૂખ્યા દોલતસિંહ જ છે. કલ્યાણી, ખુશી, ગુલાબ, એવિટ વગેરે પાત્રો પણ તેમના નામ પ્રમાણેના ગુણ ધરાવે છે.

ભાષાનું બળકટ પોત, ઉપમા, કલ્યાનો અને ગંધાની અવનવીન તરાહો તથા શિક્ષિત પાત્રોની કેળવાયેલી ભાષા માણવાયાદ છે. નવલકથાનાં પાત્રો સુશિક્ષિત તથા ઉચ્ચમધ્યમ વર્ગનાં હોવાને લીધે તેમનાં વ્યક્તિત્વોને ઉપસાવતી ભાષામાં કુન્નિમતા કે સર્જકપ્રવેશનો દોષ જણાતો નથી. સર્જકના સર્જનાત્મક ગંધાના એક-બે નમૂના :

“પાનખર અને ગ્રીઝના સંધિકાળે ઠેર ઠેર પાંઠંડાના ઢગલા પડ્યા છે. વાવેતરના વિસ્તારોમાં લાણાણી પછી જેડ તો થઈ છે પણ મૂળિયાનાં જડથાં વીણીને બહાર કાઢ્યાં નથી.” (પૃ. ૨૨)

“સુંદરતાને સમાદરની વસ્તુ માની છે. મને લાગે છે કે બળવંતસિંહજના હદ્યના માનસરમાં રાધાની અંખ જેવાં કુણ્ણકમલ ખીલ્યાં હોય.” (પૃ. ૩૬)

દાદરનાં પગથિયાં પરથી લપસી પડતી ગૌરીને બળવંતસિંહ પોતે જીવી લે છે તેનું સ્વર્ણ અનુભવે છે તે સમયની આ સુમધુર ઉપમા, “કમળના કૂલમાં ગુલાબની સુગંધ ? રક્તકમલ ! અલંકૃત સોદ્ધા પર મૂકે છે, કપૂરકાયાને, શ્રાવણના ઠિન્દધનનું...” (પૃ. ૧૧૩)

પ્રસંગ, પરિવેશ તથા પાત્રોની જીવનસ્થિતિઓને વધુ સ-ચોટ બનાવવા નવલકથામાં આવતું જીતન આગંતુક લાગવાને બદલે જે તે સ્થિતિનો ભાવકને સબળ અનુભવ કરાવે છે. દા.ત. એવિટ બ્રિટનની નાગરિક છે તે હાલમાં ભારતના ગ્રામવિસ્તારોનો પ્રવાસ કરી લોકજીવનની ખાસિયતોનો પીએચ.ડી.ની ડિગ્રી માટે અભ્યાસ કરી રહી છે તે ગૌરીને કહે છે : “સંકૃતિ મહાનગરોના રાજમહેલામાં કે સંસદીના વિવાદીમાં નથી સર્જાતી. શ્રમજીવીઓના પસીનાથી સિંચાઈને એ લોકોના ઉત્સવોમાં ફિલિત થાય છે. તમારાં અહીંના વિવિધ વ્રતનો પણ મારે પરિચય કેળવવો છે. અહીં ભારતમાં લોકો સ્વજનોથી વિમુખ થતાં બચી જાય છે અનું કારણ વ્રત પણ હોય.” (પૃ. ૮) બળવંતસિંહના સમગ્ર વ્યક્તિત્વને જોતાં તેની સ્વગત ચાલતો આ સંવાદ ધ્યાનથી સાંભળવા જેવો છે. “રૂપરાશિના સ્વામી થયા વિના એના પૂજારી થઈ શકાય. રૂપ હોય છે, એક વ્યક્તિનું પણ એ અજવાળે છે

સમગ્ર સ્વયંવર-સભાને... સૌંદર્યને અનુગ્રહ બલકે વરદાન કહેવામાં અતિશાયોક્તિ નથી.” (પૃ. ૨૬) જાહેરખબરોમાં વધી ગયેલા અંગપ્રદર્શન અંગે – “ભારતના મહાયુદ્ધના મૂળમાં ચીરહરણની ઘટના હતી. બજારલક્ષી અર્થત્તંત્ર દુઃશાસન વિના આ પ્રવૃત્તિ કરે છે એને કલા સાથે કશી લેવાદેવા નથી. વિષ્ણુના વરદાનરૂપ સૌંદર્ય આદરની વસ્તુ છે. ઉપભોગીઓને આકર્ષવા ઈચ્છનારા સૌંદર્યનો સ્થૂળ ઉપયોગ કરે છે એ મને કઠે છે.” (પૃ. ૬૪)

પાત્રો, પ્રસંગો અને કથાતાંતુની આકર્ષક માવજતથી આગળ વધતી કથામાં ભાવક અભાનપણે ખેંચાતો જ જાય છે. જે રીતે કમિક ઘટનાઓ દ્વારા કથા આગળ વધે છે તેથી કથાના અંતે ગૌરી અને બળવંતસિંહનું થયેલું સ્નેહમિલન સ્વાભાવિક બની રહે છે. બાધ્યરૂપની સામે આંતરિક સૌંદર્ય, સત્ય અને વ્યક્તિત્વનાં ઊર્ધ્વગામી બળોની આ કથા સાચ્યે જ રોચક છે. નવલકથામાં એવિટના પાત્રને થોડું વધુ પ્રકાશમાં લાવી પૂર્વની સરખામણીએ પાશાત્ય વિચારણાને પણ થોડી સાંકળવામાં આવી હોત તો નવલકથાનો આકર્ષક રંગ વધુ ધેરો – આઢ્લાદક બન્યો હોત ! આવી મધુર અને આસ્વાદક નવલકથા આપવા બદલ તેના સર્જકને ખૂબ ખૂબ અભિનંદન !

## સંપ્રત સમાજનું લઘુકથાઓમાં પ્રતિબિંબ | ગણપત સોઢા

**પ્રતિબિંબ :** તલકશી પરમાર, પ્રકાશક : પોતે, પ્ર. આ. ૨૦૦૭, પૃ. ૫૬, ક્રિ. ૩. ૩૦/-]

છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતી સાહિત્યમાં વિકસેલું નમણું-નાજુક કલાસ્વરૂપ એટેલે લઘુકથા વર્તમાનની ક્ષણે લઘુકથાના આ સ્વરૂપે પોતાની આગણી – નોખી ઓળખ ઊભી કરી લીધી છે. લઘુકથાને યોગ્ય અપેક્ષિત વિશ્િષ્ટ ભાવપરિસ્થિતિ, શબ્દને કરકસરથી પ્રયોગ તેની વંજનાશક્તિનો ક્યાસ કાઢીને થયેલું ભાષાકર્મ, લઘુકથાના પ્રાણરૂપ ‘લાઘવ’ની કલાત્મક અને માર્મિક જાળવણી – તેના સર્જક પાસે વધુ પ્રતિભાસભર સર્જકતા માગી લે છે. આમાંની એકાદ ભાબતમાં પણ જો સર્જક સહેજ ગોયું ખાઈ જાય તો લઘુકથા કથળી જાય એવું બને. આ દણિએ લઘુકથા અત્યંત સૂક્ષ્મ, લપસણું અને પડકારરૂપ સાહિત્યસ્વરૂપ છે.

લઘુકથાના સ્વરૂપમાં નિષ્ઠાથી સમજપૂર્વક સર્જન કરનારની સંખ્યા જૂજ છે તેથી સાહિત્યજગતમાં લઘુકથાની થવી જોઈએ તેટલી પ્રતીષ્ઠા થઈ નથી. ક્યારેક તો ઉપેક્ષા થતી હોવાનું લાગે છે તો પણ લઘુકથાનું સર્જન થતું રહે છે. અનેક નવોદિત સર્જકો લઘુકથાક્ષેત્રે કલમ ચલાવે છે. વીસમી સદીના છેલ્લા બે દાયકા દરમિયાન લઘુકથાના ક્ષેત્રે જે સર્જકોએ જેડાણ કર્યું છે તેમાં તલકશી પરમાર પોતાની સીધી અને સરળ ઔભિયુક્તિથી ધ્યાનપાત્ર બની શક્યા છે. લઘુકથાક્ષેત્રે નિષ્ઠાથી કામ કરી અત્યાર સુધી ‘લક્ષ્યવેદ્ધ’ (૧૯૮૦) અને ‘કાણાર્ધ’ (૨૦૦૨) એવા બે લઘુકથાસંગ્રહો તેમણે આપ્યા છે.

‘પ્રતિબિંબ’ (૨૦૦૭) શ્રી તલકશી પરમારનો તાજેતરમાં પ્રગટ થયેલો ત્રીજો લઘુકથાસંગ્રહ છે જેમાં કુલ છઘન લઘુકથાઓ સંગ્રહિત થઈ છે.

પ્રથમ લઘુકથા ‘ડાઢો’ વર્તમાન શિક્ષણજગતમાં પ્રવેશેલ દુરિતનું આવેખન કરતી

ચોટદાર લઘુકથા છે. શિક્ષણના પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા મુજબ શિક્ષકની કામુકતા નાયિકા શાંતિના ‘ઓય મા, ત્યાં તો મોટો ડાખો બેઠો છે’ વાક્યથી વંજિત થઈ છે. પોતાના નાના બાળકને ડરવાના માટે વપરાયેલો ‘ડાખો’ શબ્દ નાયિકાની મનોદશાને વ્યક્ત કરે છે.

‘પીડા’ માતૃત્વથી વંચિત સ્ત્રીહદ્યની વેદના વ્યક્ત કરતી ઉત્તમ લઘુકથા છે. લઘુકથાને અનુરૂપ સંવેદન પકડતાં સર્જકને આવડયું છે. ગામમાં દાયશનું કામ કરતાં નિઃસંતાન રૂડીમાને જ્યારે એકાદ મહિના પછી પ્રસૂતિ આવવાની છે. એવી વાતી દ્વારા પૂછવામાં આપે છે, ‘હેં રૂડીમા, પ્રસૂતિની પીડા કેવી ઊપરે ?’ ત્યારે પ્રસૂતાની પીડાથી અણાત અને તેથી જ માતૃત્વથી વંચિત રૂડીમાની વેદના – પીડા સાડલાના છેડાથી આંખો લૂછતાં લૂછતાં ‘બેટા, ઈ તો ભોગવી હોઈ ઈને જ ખબર !’ જેવા શાઢ્યોમાં વ્યક્ત થઈ છે.

‘ઓબોર્શન’ પુત્રની ઘેલાયમાં ગર્ભસ્થ શિશુ જો દીકરી હોય તો તેને ગર્ભમાં જ મારી નંખતા દંપતીને લાલબંતી ધરે છે. નાયક રાકેશ અને નાયિકા સરિતા ઓબોર્શન કરાવવાનો નિર્ણય કરે છે. પણ પડોશી સુરેશભાઈનો વ્યસની પુત્ર અમન લથડિયાં ખાતો ધેર આવ્યો અને સુરેશભાઈ તેને જોઈ રહે છે, ‘આ કરતાં તો ભગવાને વાંઝિયાં રાખ્યાં હોત તો સારું’ આ સાંભળતા નાયક રાકેશના પત્નીને ઓબોર્શન કરાવવાના વિચારનું જ – ‘ઓબોર્શન’ થાય છે. વર્તમાનની આ ક્ષાણો આવી લઘુકથાઓનું ઘણું મૂલ્ય છે.

સાંપ્રદાત સમયમાં વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ વડીલો પ્રત્યે પુત્ર-પુત્રવધૂઓ કેવાં લાગણીવિહોણાં તથા જડ રીતે વર્તતાં હોય છે તેનું આલેખન કરતી ઘણી લઘુકથાઓ અહીં છે. ‘ભૂકૂપ’માં સંતાનોની મનોવૃત્તિ આલેખાઈ છે. સ્વાભાવિક મૃત્યુને ભૂકૂપથી થયેલ મોતમાં ખપાવીને સરકારી મદદ મેળવી લાખોપત્ર બની જવાની લાલચમાં સંતાનો મોતના મલાજાને પણ ભૂલી જાય છે.

‘જીવાદોરી’માં વૃદ્ધ જમનીમાની વિડંબના આલેખાઈ છે. વૃદ્ધત્વમાં ‘જીવાદોરી’શબ્દ દીકરો પોતાના પરિવાર સાથે શહેરમાં ચાલ્યો ગમ્યો છે અને જમનીમાના જીવનનિર્વાહ માટે ચાતી પાઈ પણ મોકલતો નથી. આધારવિહોણી જમીનમાને સીમમાંથી નધણિયાતી વાછરડી મળે છે. તેને ઉછેરી મોરી કરે છે. તે વિયાતાં દૂધ વેચતાં બે પૈસા મળતા થયા અને પેટનો ખાડો પુરાતો થયો. ગાય જીવાદોરી બની. પણ કોઈક વખત ગામતરે ગયેલા જમનીમાની ગેરહાજરીમાં શહેરમાંથી આવેલો દીકરો રામુ ગાય અને વાછરડી બન્નેને શહેર ચાલ્યો જાય છે. આમ વૃદ્ધ જમનીમાની ‘જીવાદોરી’ શહેરમાં દૂધ વિના ટળવળતાં રામુનું સંતાનોની જીવાદોરી બને છે. આમ અહીં ‘જીવાદોરી’ના ઘણા સંકેતો બને છે.

‘કૂતરો’ લઘુકથામાં શહેરમાં રહેતી પુત્રવધૂની સસરા તરફની નફરત અને અણગમો જોઈ શકાય છે. જોકે સજ્જકે છેલ્લું વાક્ય ‘ને દરવાજે પૂછુંની પટપાવતો ઊભો હતો’ ન લખ્યું હોત તો લઘુકથા વધુ ચોટદાર બનત. પુત્રવધૂની માનસિકતા અહીં સરસ આલેખાઈ છે.

‘અકબંધ’માં નાયિકા સ્વાતિબહેનનું શું અકબંધ નથી ? તે ચાંદલાવિહીન કપાળ અને સૂના હાથથી સૂચયાવ છે. આમ નાયિકાના – પતિશ્પુરી સૌભાગ્ય સિવાય બધું જ અકબંધ છે. અહીં પણ સાત-ાચાર રૂમનો પૂરતી સગવડાળો બે માળનો બંગલો, પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રોથી ધમધમતું ઘર, પૈસો, ટકો બધું જ અકબંધ છે. પણ વૃદ્ધ મા પ્રત્યે બાળકોની લાગાડી

અકબંધ નથી અને તેથી જ કદાચ નાયિકાને વૃદ્ધાશ્રમના આશ્રયે આવવું પડ્યું છે.

‘જર્જરિત’માં પણ સહોપસ્થિતિની ટેફનિક દ્વારા લઘુકથાકારે અંતે તો ધનસુખલાલ અને તેમાં પત્નીની વેદનાને વાચ્ય આપી છે. જૂના ઘરને રંગકામ કરાવવાના સંદર્ભમાં પુત્ર રાજીવ કહે છે : બાપુજી, આ જર્જરિતને વાચ્ય પહેરાવીએ તોય શું અને ન પહેરાવીએ તોય શું ? ત્યાં વૃદ્ધ દંપતી અને વર્ષો જૂના જર્જરિત મકાનની સહોપસ્થિતિ જોઈ શકાય છે.

‘ભાઈ’માં સંપત્તિ સંતાનને નામે કરી દેતાં, હવે મા-બાપથી આપણને કંઈ મળવાનું નથી. અને તેથી આવાં મા-બાપ સંતાનોને ભારરૂપ લાગે છે. તેથી જ નાયક સુરેશભાઈને પત્ની સહિત નાનાભાઈને ધેર આશરો લઈને ભારરૂપ બનવું પડે છે.

‘મનોકામના’માં લક્વાગ્રસ્ત વૃદ્ધ સસરાની જવાબદીશી કંટાળી ગયેલી પુત્રવધૂ જ્યારે પતિને ‘કામનાથદાદાનાં’ દર્શનથી મનોકામના પૂરી થાય છે. આપણે દર્શને જઈએ તો ?’ એમ કહે છે. પતિને લાગે છે કે પિતાની શાંતિ માટે પત્ની દર્શને જવાની વાત કરે છે. પણ લઘુકથાને અંતે લાગે છે કે પુત્રવધૂની ‘મનોકામના’ શી હશે ? અને તે ખરેખર પૂરી થઈ !

‘રાહ’ લઘુકથામાં સજ્જકે સહોપસ્થિતિની પ્રયુક્તિ કર્મે લગાડી છે. અને તેથી ‘રાહ’નાં વિવિધ પરિમાણો જોઈ શકાય છે. નાયક મોહનલાલનાં સંતાનો ઉમરલાયક થતાં ઘર છોડી બિચે રહેવા જતાં રહ્યાં. આથી પાળેલાં કબૂતરોને નાયક મુક્ત કરી દે છે. પણ કબૂતર તો સાંજ ફળતાં ‘ધૂ ધૂ’ કરતાં પરત ફર્યા અને ફિલ્યાં ગજીવી દીધું. નાયક બંધ તેલીનાં કમાડ ખોલીને રસ્તા પર દૂર સુધી નજર માંડીને ઉભરે ઊભો રહે છે. ‘રાહ’... જોતો.

‘કોલાહલ’માં વૃદ્ધ નાયક જીવેશભાઈની એકલતા આલેખાઈ છે. નાનાં-મોટા મળીને વીસેક માણસોનો પરિવાર ધરાવતો નાયક વર્તમાન ક્ષાણો એકલો છે. સતત કોલાહલથી ટેવાયેલો છે. તેથી કોલાહલને જંબે છે. પણ... સંતાનની વાત સીધી રીતે નહીં. પણ ટિફિન આપવાવાળા માણસ દ્વારા અને તેની સાયકલની ઘંટડીના રણકાર દ્વારા કહેવાઈ છે.

દાંપત્યજીવનમાં નિઃસંતાનપણું કેવો અભિશાપ છે તેને કેન્દ્રમાં રાખીને આલેખાયેલી ‘ખાડી’, ‘વેદના’, ‘કોડ’, ‘ડુસ્કુ’, ‘નિરશા’, ‘ચિંતા’ વગેરે લઘુકથાઓ ધ્યાનપાત્ર બની છે. આમ તો એકસરખા સંવેદન ઉપર રચાયેલી આ લઘુકથાઓમાં એકવિધતા જોઈ શકાય છે પણ તેની માવજત જુદી જુદી રીતે સજ્જકે કરી છે. ‘પાખડી’માં પુરુષની વૃત્તિ છતી થઈ છે. પાખડી ગાયને ત્રાણ વરસથી પાલવતો નાનજી ગાયને વેચીને લેંસની પાડીને ખીલે બાંધે છે. અરીસામાં માથા પર સહેદ વાળ, મોં પર કરચલીઓ અને પડી ગયેલા દાંતવાળું પોતાનું પ્રતિબિંબ જોઈ આથી જ નાનજીની વહુ નિસાસો નાંખે છે. અહીં ગાય અને પાડી પ્રતીક બનીને આવ્યાં છે.

આખ લઘુકથાસંગ્રહમાં યુવાન હૈયાના પ્રશયની અનુભૂતિને વ્યક્ત કરતી એકમાત્ર લઘુકથા અહીં જોઈ શકાય છે. તે લઘુકથા એટલે ‘ચંપલ.’ નવાં ચંપલથી પડતા ડંખનો આધાર લઈને સજ્જકે પ્રણયની વાત સરસ રીતે મૂડી આપી છે. આમ તો ઘટના સાવ તુચ્છ છે. પણ છેલ્લા વાક્યમાં નાયિકા વાતીની પ્રશયપ્રાપ્તિથી વાતનો નિર્દેશ મળે છે.

ભારતની ગરીબાઈ અને ભૂખમરાની વાત કરુણતાસહ આલેખાઈ છે. ‘ભૂખ’

લઘુકથમાં ‘રામનામ સત્ય છે.’ એ શબ્દો દ્વારા ભૂમનો ઉપાય કર્યાં છે તે સૂચવાયું છે. અહીં કરુણા છે. શામજ લમણે હાથ દઈને બેસી જાય છે. ભૂખ માણસ પાસે શું નથી કરાવતી! જ્યાંથી ભૂખ ન ભાંગવી જોઈએ ત્યાંથી ભૂખનું શમન થયું છે તે ઘટના કરુણાને જન્માવે છે. ભાવક સ્તરથી બની જાય છે.

અંતિમ લઘુકથા ‘ઝાણાનુંધ’માં સર્જકે દાદા-પૌત્ર વચ્ચેના ઝાણાનુંધના સંબંધને આલેખ્યો છે. દાદાની સારવાર માટે પોતાનો ગલ્ફો તોડીને તેના પૈસા ડૉક્ટરને આપાટો પૌત્ર પિતા પ્રત્યે બેદરકાર બનેલા પણ્ણાની આંખો ખોલી નાંખે છે.

‘ભાગ’ લઘુકથા બની શકી નથી. એ જ રીતે ‘ભિભારી’ પણ ટુચ્કા ટાઈપની બની રહેતી લઘુકથા છે. ‘ફાટક’ લઘુકથમાં પણ કથનકક્ષાએ જ ચાલતી વાતથી લઘુકથનો પિડ બનતો નથી. ‘પાખડી’ અને ‘વેદના’ જેવી લઘુકથાઓમાં કથાવસ્તુ અને પાત્રોના નામની સમાનતા ખૂંચે તેવી છે. જોકે સર્જક તરીકે તલકશી પરમારની સરળ અભિવ્યક્તિ ધ્યાનાઈ છે અને રેથી આ લઘુકથાઓ સર્જકના સર્જનાનેષની ભાવકને પ્રતીતિ કરાવે છે. પ્રતિબિંબાની આ લઘુકથાઓ એકવિધાતાનો અનુભવ કરાવતી એકબીજા પર પ્રતિબિંબ પાડતી હોય તેવું લાગે છે. છતાં સંપ્રત સમાજનું પ્રતિબિંબ તેમાં સુપેરે જીવાયું છે. રોજિંદા કુટુંબજીવનના પ્રસંગોમાં પ્રગટતા માનવસ્વભાવનાં વિવિધ સ્વરૂપોને અસરકારક રીતે આલેખ્યીને ‘સંપ્રત સમાજનું લઘુ પ્રતિબિંબ’ સરસ રીતે જીવી બતાવ્યું છે.

r

### પ્રક્રિયા

(૨૫૧) મીઠા મીઠા મધ્ય બોકે રે : ડૉ. રક્ષા પી. દવે, ૨૦૦૮, લેખક પોતે, ‘જીવનકોટેજ’, ૪૩૮/અે, પ્રલુદાસ તળાવચોક, ભાવનગર-૧, પૃ. ૧૨+૨૩૪, રૂ. ૨૨૫/- (૨૫૨) લોકસાહિત્યની વિરાસત : જોરાવરસિંહ જાદવ, ૨૦૦૮, લેખક પોતે, ૨, પ્રોફેસર કોલોની, નવરંગપુરા, અમદાવાદ-૮, પૃ. ૮૧૧૮૦, રૂ. ૧૨૫/- (૨૫૩) મહાભારત : જીવનદર્શન : શાંતિકુમાર પંડ્યા, ૨૦૦૮, ગુજરાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ-૧, પૃ. ૧૨+૩૦૮, રૂ. ૨૦૦/- (૨૫૪) હિંદ સ્વરાજના શિલ્પી મહાત્મા ગાંધી : પ્રવીણ ક. લહેરી, બીજી-૨૦૦૮, ગુજરાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૪+૨૫૮, રૂ. ૨૦૦/- (૨૫૫) મહેકતો રહેજે મનવા : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, ૨૦૦૭, સાહિત્યસંગમ, સુરત, પૃ. ૧૫૨, રૂ. ૬૦/- (૨૫૬) ક્ષણનો સાક્ષાત્કાર : કુમારપાળ દેસાઈ, બીજી-૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૧૬૮, રૂ. ૭૫/- (૨૫૭) મારા ગાંધી : નારાયણ દેસાઈ, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૨૦૦, રૂ. ૮૫/- (૨૫૮) બાળવિકાસની એબીસીડી : ડૉ. શરીરકાન્ત શાહ, બીજી-૨૦૦૮, સાહિત્ય સંગમ, પૃ. ૧૪૪, રૂ. ૭૦/-



### પરિષદ્વસ્તા

સં. અનિલા દલાલ

(૧) તા. ૩૦-૬-૨૦૦૮ મંગળવાર : શ્રી ભક્તિપ્રસાદ મો. નિવેદી (પત્રકારત્વ) વ્યાખ્યાનમાળા અંતર્ગત (વર્ષ ૨૦૦૮-૨૦૦૯) શ્રી વિષ્ણુ પંડ્યાએ ‘સાહિત્ય અને પત્રકારત્વ’ વિશે વ્યાખ્યાન આપ્યું. વિષ્ણુભાઈએ પરદેશમાં સાહિત્ય અને પત્રકારત્વના સંબંધો, પ્રશ્નોની વાત કરતાં કરતાં આપણો ત્યાં પણ આ બને ક્ષેત્રો ડેવી રીતે સંકળાયેલાં છે તેની વાત વાપક સંદર્ભો સાથે કરી – પત્રકારત્વનાં આરંભનાં વર્ષાનું પણ સ્મરણ કર્યું-કરાવ્યું. વ્યાખ્યાન પછી પ્રશ્નોત્તરીમાંથી બીજા ઘણા મુદ્દાઓ અને પ્રશ્નોની છાણાવટ થઈ. સાહિત્યને પત્રકારત્વ સાથે જોડતાં કયાં ભયસ્થાનો છે, તેમજ તેના વિના તે ક્ષેત્ર થોડું શુષ્ક બની જાય એ મર્યાદા પણ ઊપરી આવી – વાચકોના સંદર્ભો પણ જોડાયા. આરંભમાં શ્રી રતીલાલ બોરીસાગરે વિષ્ણુભાઈનો પરિચય આપ્યો હતો. સંચાલન અનિલા દલાલનું હતું.



(૨) રવીન્દ્રભવનના ઉપક્રમે તા. ૧-૭-૨૦૦૮, બુધવારે શ્રી સુશ્રા શાહનું ‘રવીન્દ્રનાથનાં શિશુકાબ્યો’ પર વક્તવ્ય યોજાઈ ગયું. સુશ્રાબહેને ‘શિશુ’ સંગ્રહમાંથી તેમજ ‘શિશુ ભોલાનાથ’ સંગ્રહમાંથી પસંદ કરેલાં કાલ્યોનાં ગુજરાતી રૂપાંતરનું પઠન કરતાં કરતાં વાન્દનાથે વ્યક્ત કરેલાં શિશુમાનસના સૂક્ષ્મ ભાવોને, હંદ્યસ્પર્શ સંવેદનોને, નિરીક્ષણોને સરસ રીતે તારવી આપ્યાં. અંતમાં અનિલા દલાલે રવીન્દ્રનાથે યોના અંગ્રેજીમાં કરેલાં અનુવાદના સંગ્રહ ‘The Crescent Moon’માંથી ‘On shore’ (‘જગત પારાવારેર તીરે’) કાબ્યનું આસ્વાદલક્ષી પઠન કર્યું હતું. તા. ૪-૭-૨૦૦૮થી ૧-૨-૭-૨૦૦૮ દરમિયાન સાહિત્યયાત્રા યોજાઈ ગઈ. ઉત્તર કુંઠાંપાંદીસા, હિંમતનગર, ઈડર, વિસનગર, મહેસૂસા, ઊંઝા, પાલનપુર, ડીસા, પાટણ વગેરે સ્થળોએ શૈક્ષણિક-સાહિત્યિક સંસ્થાઓની અહીંથી ગયેલા યાત્રીઓએ સ્થાનિક મુલાકાત લીધી અને બને સ્થળોના સાહિત્યકારોએ વિચારોનું આદાન-પ્રદાન કર્યું, તેમજ વિદ્યાર્થીઓને મળી ગુજરાતી ભાષાના ગૌરવને સ્થાપિત કર્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન-સંયોજન શ્રી રાજેન્ડ પટેલે કર્યું હતું.

(૪) કવિ-મનીષી ઉમાશંકર જોશીની ૨-૧-૭-૨૦૦૮ના રોજ જન્મતિથિએ ઉમાશંકર સ્વાધ્યાપીઠના ઉપક્રમે કવિ-સ્મરણ નિમિતે એક કાર્યક્રમ ‘ઉમાશંકરના ઉલ્લેખી’ યોજાઈ ગયો. આરંભમાં શ્રી અનિલા દલાલે કવિ ઉમાશંકરે પ્રયોજેલી ‘ગુજરાતી ગિરા’ને ‘ઉમાશંકર ગિરા’ તરીકે બિરદારી. પછી શ્રી રઘુવીર ઘોધરીએ પ્રાસંગિક વક્તવ્યમાં કાબ્ય-પઠનથી શરૂઆત કરી ઉમાશંકરના શિખરિણી છંદના વિનિયોગનું સ્મરણ કરી, પછી કવિની સર્જકતાના, સમાજચિંતનના, મૂલ્યબોધ વિશેના ભિન્ન પાસાંઓનું વિશ્વેષણ કર્યું. છેલ્લે શ્રી મનસુષ્પભાઈ સત્ત્વાએ આભારવિધિ કરી.

કાર્યક્રમનો બીજો ભાગ હતો શ્રી પ્રવીષ પંડ્યા દિગ્દર્શિત કવિનાં નાટકોમાંથી નાટ્યપ્રસ્તુતિ, કવિનાં ગીત-કાવ્યપઠન વગેરે. બે નાટકોના અંશો કલાકારોએ તાદેશ કરી દીધા એટલો ઉત્તમ અભિનય જોવા મળ્યો. તો પઠન અને ગાન-ગરખામાં પણ એટલી તો સહજતા અને સહદ્યતા જોવા મળી! સૌને લાગ્યું કે 'Memories are made of all this.' શ્રી પ્રવીષભાઈને ખાસ અભિનંદન. કલાકારો હતા - રૂપા મહેતા, કિન્નરી વિદ્યરાજાની, સંભવનાથ, નિસર્જ નિવેદી, હર્ષિલ રોય, સુપ્રિયા રાય, જ્યાતિ દલાલ, રવિ બારોટ, અનીશ શાહ, અખ્ટરખાન, જફર, ઈમરોજ, હાર્દિક, મૌલિક. સંગીત : કમલેશ ચૌહાણ અને જિગર. પ્રકાશ : હરીશ ઉપાધ્યાય.

પ્રવક્તા તરીકે શ્રી રમેશ ર. દવેએ સેવાઓ આપી હતી.

### જ્યાતિ દલાલ સ્મૃતિવિશેષ

તા. ૨૫ ઓગસ્ટ ૨૦૦૮

જ્યાતિ દલાલ સ્મૃતિ સમિતિ, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપકરે, જ્યાતિ દલાલના શતાબ્દીવર્ષના ઉપલક્ષ્યમાં એમના જીવન અને કવનને અનુલક્ષીને સમકાળીન સંદર્ભમાં એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરિષદ-પ્રમુખ નારાયણ દેસાઈના અધ્યક્ષપણે યોજાયેલા આ પરિસંવાદમાં સમિતિના પ્રમુખ મૃણાલિની સારાભાઈ, બુઝુર્ગ સમાજવાદી સનત મહેતા, નાટ્યકર્મી માર્કિડ ભણ અને સાહિત્યકાર રઘુવીર ચૌધરી વગેરે સંબોધન કરશે. તદ્વપરાંત, કર્મશીલ રંગકર્મી મલિકા સારાભાઈ તેમજ આકાશવાણી-ખ્યાત વસુભણેન તરફથી નાટ્યપ્રસ્તુતિ પણ થશે.

મંગળવાર, તા. ૨૫-૮-૨૦૦૮ના રોજ સાંજે ૫ વાગ્યે ગોવર્ધન ભવનના રા. વિ. પાઠક હોલમાં આયોજિત સ્મૃતિસંધ્યામાં સહભાગી થવા સૌ સહદ્યજનોને હાર્દિક નિમંત્રણ.

r

### બાળસાહિત્ય

(૨૪૧) કલાગાન (બાળકાવ્ય) : જ્યાંત મોઢા, ૨૦૦૮, દિશા પ્રકાશન, મુંબઈ, પૃ. ૫૨, રૂ. ૫૦/- (૨૪૨) શહેનશાહ ગાંધી અને બીજી વાતો : જ્યાંત ડી. શાહ, ૨૦૦૮, જ્યાંત ડી. શાહ, ઈસનપુર, અમદાવાદ, પૃ. ૮૧૧૫૨, રૂ. ૮૦/- (૨૪૨/અ) ઝડા જીચા રહે હમારા : નટવર પટેલ, ૨૦૦૮, સી-૨/૪, સીમંધર કોમ્પ્લેક્સ, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧, પૃ. ૮૧૧૨, રૂ. ૫૦/-

### હાસ્ય

(૨૪૩) હાસ્યમુંગધા : જ્યાંત દમણિયા 'બિન્દાસ', ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૧૫૨, રૂ. ૧૨૫/-

## સાહિત્યવૃત્ત

સંકલન : પ્રકુલ્લ રાવલ

### 'મને વરસાદ બીજોવે' વ્યાખ્યાન - સૂરતમાં

મુકેશ કોન્ટ્રાક્ટરની સ્વૃતિમાં રવીન્દ્ર પારેખની અધ્યક્ષતામાં બંકુલેશ દેસાઈએ મને વરસાદ બીજોવે શીર્ષકથી આસ્વાદમૂલક વ્યાખ્યાન આવ્યું હતું. ભગવતીકુમાર શર્મા અને નાનુભાઈ નાયકે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. રવીન્દ્ર પારેખે સ્વ. મુકેશભાઈ સાથેનાં સ્મરણો વાગોળીને એમના વરસાદી નિંબધનું પઠન કર્યું હતું.

### 'હાસ્યલોક'નું વિમોચન

'સાહિત્યવર્તુળ' - હિંમતનગરના ઉપકરે રમેશ પટેલ 'ક્ષ'ના હાસ્યલેખોના સંગ્રહ 'હાસ્યલોક'નું વિમોચન ૧-૭-૦૮ના રોજ ઈસુભાઈ ગઢવીના અધ્યક્ષપદ હેઠળ પ્રા. ફૂલચંદ ગુતાના વરદ હત્તે થયું હતું.

### 'ભેદદૂત' પર વાર્તાલાપ

'સાહિત્યસ્ફુર્ચિ' - વડોદરાના ઉપકરે મ. સ. યુનિવર્સિટીના પ્રાચાર્ય યોગેશભાઈ ઓઝાએ 'ભેદદૂત' પર વાર્તાલાપ આયો હતો. ગુ. પુસ્તકાલય સ. સ. મંડળ લિ.ના અંબુભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. અવિનાશ મણિયારે કાર્યકર્મનું સંચાલન કર્યું હતું.

### 'સાબર સાહિત્ય સભા'ના ઉપકરે કાર્યક્રમ

જુલાઈના રોજ સાબર સાહિત્ય સભાના ઉપકરે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો અધ્યક્ષસ્થાને ડૉ. એસ. એસ. રાહી હતા. એમણે આબીદ ભણ કૃત 'મુનલાઈટ'નું કર્યું હતું. આ પ્રસંગે કવિસંમેલન પણ યોજાયું.

### વાર્તાશિબિર - શામળાજીમાં

ઉત્તર ગુજરાત વાર્તાવર્તુલની દસમી વાર્તાશિબિર ૧૨ જુલાઈના રોજ આદિવાસી આદ્ર્સ કોલેજ - શામળાજીના ઉપકરે યોજાઈ હતી. શિબિરનું સંકલન ડાચ્યાભાઈ પટેલ 'માસ્કે' કર્યું હતું. અગ્નિયાર વાર્તાકારોએ મૌલિક - અપ્રકાશિત વાર્તાઓનું પઠન કર્યું હતું.

### 'ભીલી આદિવાસી કઠ પરંપરા' પર પરિસંવાદ

૫ જુલાઈના રોજ સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપકરે 'ભીલી આદિવાસી કઠપરંપરા' પરિસંવાદનું આયોજન થયું હતું. એમાં વિવિધ વિદ્વાનોએ વ્યાખ્યાનો આપ્યાં હતાં. આદિવાસીઓએ ભીલી રામાયણ-મહાભારતનાં લોકાખ્યાનોનું નિર્દર્શન કર્યું હતું.



શ્રી દુલા ભાયા કાગ

## આ અંકના લેખકો

- અનિલા દલાલ** : ઉઘ, પ્રોફેસર કોલોની, નવરંગપુરા, અમદાવાદ-૮  
**કલ્યેશ પટેલ** : ૭૨૮/૧, કિસાનનગર, સેક્ટર-૨૬, ગાંધીનગર-૩૮૨૦૨૮  
**કંદર્પ ર. દેસાઈ** : 'પારિજીત', ૬, અરુણોદયપાર્ક, સેન્ટ એવિર્યર્સ કોલેજ કોર્નર,  
 નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮  
**ગજપત સોઢા** : ૧૮/૩૧, સોમેશ્વરતીર્થ સોસાયટી, કરણનગર રોડ, કડી-૩૮૨૭૧૫,  
 જિ. મહેસાળા  
**ગિરીશ ભટ્ટ** : 'પ્રશાંત નિવયમ', માધવનગર, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧  
**ચન્દ્રકાન્ત ટોપીવાળા** : ડી/૬, પૂર્ણિશ્વર ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫  
**જગદીપ સ્વાર્ટ** : ૧૧, જ્યસોમનાથ સોસાયટી, ઈચ્છાનાથ, સુરત-૩૮૫૦૦૭  
**નટવર પંડ્યા** : C/o. ભાવના તેરેયા, જે. બી. ધારુકાવાલા કોલેજ, સ્પિન્નિંગ મિલ  
 સામે, વરાચા રોડ, સુરત-૩૮૫૦૦૬  
**નવનીત જાની** : બ્રહ્મશેરી, મુ.પો. જાણીલા રોડ, તા. રાણપુર, જિ. અમદાવાદ-  
 ૩૮૨૨૫૫  
**નારાયણ દેસાઈ** : સંપૂર્ણ કાંતિ વિદ્યાલય, મુ. વેડાઈ તા. વાલોડ, જિ. સુરત  
**નિર્મિશા ટાકર** : બી-૮/૩૧, ઓ.એન.જી.સી. કોલોની, સી-૧, દુમ્બસ રોડ, ન્યૂ  
 ગાડલાલ, સુરત-૩૮૪૫૧૮  
**Nilesh Rana** : 1531, Buckcreek Drive Yardely PA 19067 4053  
 (U.S.A.)  
**પ્રહુલ રાવલ** : ૩, રાજમહેલ ફ્લેટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦  
**ડૉ. પ્રવીષાભાઈ અંસ. વાવેલા** : ફ્લેટ નં. ૨૦૭, સંસ્કૃતિ કોમ્પ્લેક્સ, મુ. બાકરોલ, જિ. આણંદ  
**ભગવતીકુમાર શર્મા** : C/o. મેહુલ શર્મા, બી/૩૨, પવિત્ર રોડાઉસ, ગેટ-૨, આનંદ મહલ,  
 રોડ, અડાજણ, સુરત-૩૮૫૦૦૭  
**રમણીક સોમેશ્વર** : 'પલ્લવ', ફોરેસ્ટ ઓફિસ પાસે, માનવ કોમ્પ્લેક્સ પાછળ, નવા  
 અંજાર-૩૭૦૧૧૦ (કચ્છ)  
**રમેશ બી. શાહ** : બી/૭, પૂર્ણિશ્વર ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫  
**લાલિત નિવેદી** : 'શિવકૃપા', ૧, વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટ-૩૬૦૦૦૭  
**વિજય શાસ્ત્રી** : જે/૩/૩૦૨, મુક્તાનંદ, અડાજણ રોડ, સુરત-૩૮૫૦૦૮  
**સુરેશ શુક્લ** : ૬/૩૧, ચંદ્રજ્યોત સોસાયટી, વેજલપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૫૧  
**હિમત ભાલોડિયા** : ગુજરાતીના વ્યાખ્યાતા, સરકારી કોલેજ, આહવા, જિ. ડાંગ-  
 ૩૮૪૭૧૦

## રંગદ્વાર પ્રકાશન

G-૧૫, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા,  
અમદાવાદ-૩૮૦ ૦૦૮

ફોન નંબર : (૦૭૯) ૨૭૯૯૩૩૪૪

વેબ સાઈટ : <http://www.rangdwar.com>

### 'માનસ'થી લોકમાનસ

કથાના માધ્યમથી એક માનવમૂલ્ય તરીકે પ્રેમભક્તિના પ્રસારની સફળતાને સમજવાનો પ્રયત્ન. શ્રી મોરારીબાપુના ઉછેર, સ્વાધ્યાય, સાધના અને માનવધર્મ-પ્રવર્તન વિશે મૂલ્યવાન ગ્રંથ. લે. રઘુવીર ચૌધરી, રૂ. ૨૦૦/-

### નિરનાર

નિરનારની પરિક્રમા, નિરનાર આરોહણનું પ્રવાસવર્ણન, નિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને નિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં નિરનાર, જૂનાગઢના જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઇતિહાસ વગેરે વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે. લે. સંજય ચૌધરી, રૂ. ૧૮૦/-

### એક ડગ આગામ બે ડગ પાછળા

આજનું ગામનું ભલું, ભોળનું નથી. સમાજ, રાજકારણ, શિક્ષણ, ધર્મ – દરેક ક્ષેત્રના તાજાવાણા બદલાતા ગયા છે. પાત્રોના આંતરરસંબંધોના નિરૂપણ દ્વારા રસપ્રદ બનતી, દુનિયાના સંદર્ભમાં દેશની વાત કરતી નવલક્ષ્ય. લે. રઘુવીર ચૌધરી, રૂ. ૧૭૦/-

### બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો

વિશ્વ ગુજરાતી સમાજનું પ્રકાશન. લે. મકરન્દ મહેતા, શિરીન મહેતા, રૂ. ૨૨૦/-

### ગુજરાતમાં નારીચેતના

�તિહાસિક સંદર્ભમાં નારીચેતનાનો અભ્યાસ. 'દર્શક' ઇતિહાસ નિધિનું પ્રકાશન. લે. શિરીન મહેતા, રૂ. ૨૫૦/-

### સોમતીર્થ

ગુજરાતી અને હિન્દીમાં વ્યાપક આવકાર પામેલી ઐતિહાસિક નવલક્ષ્ય. ધર્મરથાન તૂટવાથી ધર્મ તૂટો નથી, બલકે જાગૃતિ વધે. છે. ચૌલા, ઉદ્ઘયમતિ, વૃદ્ધા અને સદાશિવનાં પાત્રો માનવધર્મનાં મૂલ્યોનો મહિમા કરે છે. નવી આવૃત્તિ, લે. રઘુવીર ચૌધરી, રૂ. ૧૬૦/-

પરિશ્રમ મને પ્રિય છે. પરસેવો પાડીને મેળવેલું પરિણામ જે આવે તે મીઠું લાગે છે. એ પરિણામ જાહેર જનતાને સંતોષે કે નહિ, એ પ્રત્રી પદી ઉઠે છે. પહેલો પ્રક્રિયા તો લેખકના પોતાના સંતોષનો છે.

હું એક કામ પૂરું કરું છું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે. આથી વધુ સારું હું ન જ કરી શક્યો હોત. એ થઈ મારી શક્તિની મર્યાદા.

પણ હું મારી જાતને કદ્દી એમ સમજાવી લેતો નથી કે મારી જાહેરમાં જે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેને આધારે હું જે કાંઈ ઘસવીને ફળાવીશ તે લોકો ચલાવી લેશે. ના, હું જાણું છું કે સાહિત્યકાર અને પત્રકારનું કશું જ લોકો શ્રીપુરાંતે રાખતા નથી.

અગાઉ તમે ખૂબ અસ્થી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે, એમ કદ્દી ગણશો નહીં. એથી બેલટું, અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેથી ઉચ્ચ વાચનની લોકો તમારી તરફથી અપેક્ષા રાખીને બેસશે. માટે બહેતર છે કે કાંઈ વધુ ન આપો, પણ જે કાંઈ આપો તે તમારા ૧૦૦ ટકા શ્રમનું જ અને તમારો પોતાનો સંતોષ પ્રાપ્ત કરી શકેલું પરિણામ હોય જોઈએ.

પદી શક્તિ જે નવા સીમાડા સર નથી કરી શકતી તે માટે વલખાં પણ શાં? તમારો સ્વધર્મ તમારી શક્તિમર્યાદા તેમજ જે વર્ગને તમે પહોંચાડવા માગો છો તેની મર્યાદા નક્કી કરી લેવાનો છે.

- જીવેસંદુક મેધાઝી

### સ્થાનસમાપ્તિ

## વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર  
અમદાવાદ

મેઘાણીની જહેમતથી, સાધનાથી, એ બધા સાહિત્યકારોને ભાન થયું છે  
કે જેને આપણે અભાષ સમાજ માનીએ છીએ તે સમાજમાં પણ વિવિધ  
સંસ્કારિતાની અદ્ભુત ખુશબો ભરેલી છે.

આ ભાનમાંથી લોકાભિમુખતા આ વર્ગમાં આવી, અને એને લીધે બંને  
વર્ગો નજીક આવ્યા. ઉચ્ચનીચ ભાવ મૈત્રીને પોષક નથી.

મૈત્રી માટે સમાન ગુણધર્મનું ભાન જરૂરી છે. લોકસાહિત્યમાં તુચ્છતા  
નહોતી, પણ મહાન ગુણો હતા તેનું ભાન ભડ વર્ગને કરાવ્યું.

આ છે મેઘાણીના પુરુષાર્થનું એક ઐતિહાસિક પરિણામ.

- મનુભાઈ પંચોળી

: સ્થાનસમર્પિત :

નિમેખભાઈ ડગલી

ઓમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

ઊ/એ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,  
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન નં.: ૩૨૬૦૬૬૫૫


## કવિ શ્રી સુન્દરમ્ભના નવા કાવ્યસંગ્રહો

૧. પલલવિતા	૧૮૮૫	૮૪૩૫૬	રૂ. ૧૬૦
૨. મહાનદ	૧૮૮૫	૭૧૧૮૩	રૂ. ૮૦
૩. પ્રભુ-પદ	૧૮૮૭	૧૩૪૪૧	રૂ. ૨૨૫
૪. અગમ નિગમા	૧૮૮૭	૧૧૨૮૨	રૂ. ૧૫૦
૫. પ્રિયાંકા	૧૮૮૭	૧૧૩૬૭	રૂ. ૧૫૦
૬. નિત્યશ્લોક	૧૮૮૭	૧૨૧૮૮	રૂ. ૧૦૦
૭. નયા પૈસા	૧૮૮૮	૧૩૩૩૩	રૂ. ૧૭૫
૮. વરદા	૧૮૮૮	૧૬૫૨૮	રૂ. ૨૫૦
૯. ચક્કદૂટ	૧૮૮૮	૮૨૨૫૮	રૂ. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૪૨	રૂ. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	રૂ. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૪૩૭	રૂ. ૫૦
૧૩. ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	રૂ. ૫૦
૧૪. ધ્રુવચિત્ત	૨૦૦૪	૧૭૨૭૪	રૂ. ૫૦
૧૫. ધ્રુવપદે	૨૦૦૪	૧૧૨૪૩	રૂ. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૪	૧૬૩૨૦	રૂ. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૪	૧૬૩૭૦	રૂ. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	રૂ. ૨૫૦
૧૯. મંગળા-મંગળિકા	૨૦૦૭	૨૮૨૩૮	રૂ. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮૩૦૪	રૂ. ૨૫૦
૨૧. સ્વાગતમૂળીતવાહીને			
૨૨. 'સાવિત્રી'ના કાવ્યખંડો	૧૮૮૫	૨૪૪૭૩	રૂ. ૩૦૦
(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગેજ સાથે.)			
૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	રૂ. ૫૦
(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગેજ સાથે.)			

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

- ગ્રંથાગાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, રાઠમસ ઓફ ઇન્ડિયા પાટીન,  
અમદાવાદ-૩૮૦૦૦૮
- ગુર્જર ગ્રંથરલ કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

## ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત વિશિષ્ટ પ્રકાશનો



[“ભૂકામ શાંતિનિકેતન” : પુ. લ. દેશપાંડે, અનુ. અરુણા જેઝા, બીજી આ. ડિમાઈ, કાચું પૂછું, પૃ. ૧૦+૧૭૮, કિ. રૂ. ૧૦૦/-]

મચાઈના વખ્યપત્રિષ્ઠ લેખક શ્રી પુ. લ. દેશપાંડે બંગાળી ભાષા શીખવા તથા રવીન્દ્રનાથ યાગોરના સાહિત્યનો સંસ્પર્શ પામવા શાંતિનિકેતન રહ્યા હતા. તે સમયનાં તેમનાં સંસ્મરણો, રવીન્દ્રનાથની સર્જકપ્રતિભા અને શાંતિનિકેતનની ઉત્સવપરંપરા આ પુસ્તકમાં મનોહર રીતે આવેખાયાં છે. પુ. લ.ના સાહિત્યના અભ્યાસી અને તેમનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કરનાર શ્રીમતી અરુણાબહેન જેઝાએ એ જ શીર્ષકથી સુંદર અનુવાદ કર્યો છે.

આ પુસ્તકના પ્રથમ ખંડમાં રોજનીશી છે, દ્વિતીય ખંડમાં બંગ-ભાષા શીખવા માટેનો સ્વાધ્યાય છે અને તૃતીય ખંડમાં શાંતિનિકેતનમાં ઊજવાતા વર્ષામંગળના ઉત્સવનું હફયેગમ વર્ણન લેખકે આપ્યું છે; તેમજ રવીન્દ્રનાથના પત્ર-સાહિત્ય, રવીન્દ્રનાથ અને શરદભાલુવિષયક તેમજ અન્ય લેખો છે.

ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં એનો પાઠ્યકક્ષમાં સમાવેશ થતાં ‘ભૂકામ શાંતિનિકેતન’ની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

[“ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગ્રંથ-૧” (૧૧૫૦-૧૪૫૦) પ્ર. આ. સંપાદકો : ઉમાશંકર જોષી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક : ચિમનલાલ નિવેદી. બીજી આવૃત્તિ : શોધન-સંપાદન : રમણ સોની, પરામર્શક : ચિમનલાલ નિવેદી, ડિમાઈ, પાંકું પૂછું, પૃ. ૧૪+૩૧૨, કિ. રૂ. ૧૪૦/-]



ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ. સ. ૧૮૮૧થી ઈ. સ. ૧૮૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઈતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ. સ. ૨૦૦૧થી ઈ. સ. ૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો પ્રથમ ગ્રંથ ઈ. સ. ૨૦૦૬ માં પુનર્મુદ્રિત થયેલો અને હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ (ઈ.સ. ૧૧૫૦થી ઈ. સ. ૧૪૫૦)નો ઈતિહાસ આવેખાયો છે. તેમાં ગુજરાતી ભાષાનો કિકાસ અને તેનાં વિધાયક પરિબળો તથા સાહિત્યિક પૂર્વપરંપરાનું આવેખન થયું છે.

અભ્યાસીઓને આ ઈતિહાસગ્રંથો ઉપયોગી થઈ રહ્યા છે તેનો આનંદ છે.

## ગુજરાતી સાહિત્ય પરિષદ

નદીકિનારે, ‘યાઈસ્’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮. ફોન : ૨૬૫૮૭૮૪૭

## ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત તદ્દન નવાં પ્રકાશનો



[“ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગ્રંથ : ૨ : ખંડ : ૧” (૧૪૫૦-૧૬૫૦), પ્ર. આ. સંપાદકો : ઉમાશંકર જોષી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક : ચિમનલાલ નિવેદી. બીજી આવૃત્તિ : શોધન-સંપાદન : રમણ સોની, પરામર્શક : ચિમનલાલ નિવેદી, ડિમાઈ, પાંકું પૂછું, પૃ. ૧૬+૪૮૨, કિ. રૂ. ૨૦૦/-]

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ. સ. ૧૮૭૩ થી ઈ. સ. ૧૮૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઈતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ. સ. ૨૦૦૧થી ઈ. સ.

૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો બીજા ગ્રંથનો પ્રથમ ખંડ ઈ. સ. ૨૦૦૬ માં પુનર્મુદ્રિત થયેલો. હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ (ઈ.સ. ૧૪૫૦થી ઈ. સ. ૧૬૫૦)નો ઈતિહાસ આવેખાયો છે. તેમાં મધ્યકાળનાં સાહિત્ય-સ્વરૂપો, જૈન સાહિત્ય : ૧, આદિભક્તિયુગના કવિઓ અને ભાવશાસી આખા સુધીના ઈતિહાસનું આવેખન થયું છે.

અભ્યાસીઓને આ ઈતિહાસગ્રંથો ઉપયોગી થઈ રહ્યા છે તેનો આનંદ છે.

[“ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગ્રંથ : ૨ : ખંડ : ૨” (૧૬૫૦-૧૮૫૦) પ્ર. આ. સંપાદકો : ઉમાશંકર જોષી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક : ચિમનલાલ નિવેદી. બીજી આવૃત્તિ : શોધન-સંપાદન : રમણ સોની, પરામર્શક : ચિમનલાલ નિવેદી, ડિમાઈ, પાંકું પૂછું, પૃ. ૧૬+૩૮૫, કિ. રૂ. ૧૭૦/-]

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ. સ. ૧૮૭૩ થી ઈ. સ. ૧૮૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઈતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ. સ. ૨૦૦૧થી ઈ. સ.

૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો બીજા ગ્રંથનો બીજો ખંડ ઈ. સ. ૨૦૦૬ માં પુનર્મુદ્રિત થયેલો. હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ (ઈ.સ. ૧૬૫૦થી ઈ. સ. ૧૮૫૦)નો ઈતિહાસ આવેખાયો છે. તેમાં જૈન સાહિત્ય : ૨/૩, પ્રેમાનંદ અને તેના પુરોગામી આખ્યાનકારો, ઉત્તર પ્રેમાનંદ ગંધે અને પદ્ય સ્વરૂપ, શામળ, ભક્તિપદો, દયારામ અને સંત કવિતા ધારા, પારસી કવિઓ, ગંધે સાહિત્ય, લોકસાહિત્ય અને લોકનાટ્ય સુધીના ઈતિહાસનું આવેખન થયું છે. અભ્યાસુઓ અને સાહિત્યરસિકોને આ ગ્રંથો ઉપયોગી થશે.

## ગુજરાતી સાહિત્ય પરિષદ

નદીકિનારે, ‘યાઈસ્’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮. ફોન : ૨૬૫૮૭૮૪૭